

યશોવિજય અંથમાળા સિરીઝ નં. ૧૩૬

## મહાકન્તપ રાજ રદ્રદામા

વિદ્યાવક્ષલ ઈતિહાસતત્ત્વમહોદધિ  
આચાર્ય શ્રી વિજયેન્દ્રસ્કુર

C. M. O. I. P.

યશોવિજય અંથમાળા  
હરીસરાડ-સાવનગર.

૧૯૭૭

વિ. સ. ૧૬૬૪

એ ઝીયા

ધમ્ સ. ૧૬

**Published by**  
**YASHOVIJAYA GRANTHMALA**  
**Harris Road, Bhavnagar.**

*Printed by*  
*Gulabchand Lallubhai*  
*At*  
*Mahodaya P. Press-Bhavnagar.*

## નિવેદન.

---

પુલ્યપાદ આચાર્ય શ્રી વિજયેન્દ્રસૂરી મહારાજનું આ પુસ્તક જનતાની સમક્ષ રજુ કરતાં અમને અતિ આનંદ થાય છે.

આ પુસ્તકમાં તેમણે ધતિહાસના ઉડા અવગાહનથી એક નવી બાખત-નવું સલ રજુ કર્યું છે. જૈન ધતિહાસ ને જૈનોના પૂર્વાચાર્ય કાળકાચાર્ય સંબંધી નવો પ્રકાશ ફેંક્યો છે, જે આજસુધી જગતના વિદ્યાનોએ સ્પષ્ટ રીતે ખતાભ્યું નહોંદું. સંભવ છે કે કોઈના ઘ્યાલ ઉપર એ વરતુ આવી નહીં હોય. જૈન સમાજમાંથી પણ તેના ઉપર ખાસ અન્વેષણ કર્યું હોય એવું અમારા ઘ્યાલમાં નથી.

શક રાજનોનો કાળકાચાર્ય અને જૈનધર્મ સાથેનો નિકટનો સંબંધ ધતિહાસની હકીકતો ને ધર્મનાઓપૂર્વક જે રીતે આચાર્ય મહારાજશ્રીએ રજુ કરી છે તે અપૂર્વ છે. અમને લાગે છે કે જૈનોમાં અને ધતિહાસના વિદ્યાનોમાં આ પુસ્તક નવું આંદોલન ઉત્પત્ત કરરી, અને જૈન સમાજ આ પુસ્તક માટે તેમનો અણી બનશે.

થીજુ પણ ડેટલીક હકીકતો મહાક્ષત્રપ નહોંના, મહાક્ષત્રપ લૂભક, શક રાજનોનો માર્ગ વિગેરે સંબંધી પણ વિદ્યાનોને મનન કરવા લાયક મંતવ્યો, સિદ્ધાતો તેમાં રજુ કર્યો છે. આ પુસ્તક વિદ્યાનોમાં જરૂર આદરપાત્ર બનશે.

થીજુ આનંદની વાત એ છે કે—તેમના આગલા પુસ્તકના પ્રકાશન વખતે લગ્નાનું મહાવીરના જીવન, વિહાર, સંસારિક કૌઠુંબિક પરિવાર સંબંધી અમે જે માગણી આચાર્ય મહારાજ સમક્ષ મુક્તી હતી તેનો સ્વીકાર કરી “લગ્નાનું મહાવીરના કૌઠુંબિક પરિવાર” સંબંધી પુસ્તક લખવાનું તેઓશ્રીએ મંજુર કર્યું છે. અમારી માન્યતા પ્રમાણે એ પુસ્તકથી જૈન ધતિહાસમાં નવો પ્રકાશ ફેલાશે.

તે સાથે સાથે ‘સંપૂર્ણ જૈન ધતિહાસ’ લખવાની તેમની ભાવનાએ નવી આકંક્ષા, નવો રસ પેદા કર્યો છે. અમે આશા રાખીએ છીએ અને શાસન હેવને પ્રાર્થના કરીએ છીએ કે તેમને જૈન ધતિહાસ લખવાના સર્વ અભીષ્ટ સંયોગો પ્રાપ્ત થાય અને પુસ્તક વેલાસર પ્રકાશિત થાય એવી અંતરની લાગણી પૂર્વક વિરભીએ છીએ.

અંધમાળા બોક્સ.  
હેરીસરોડ-ભાવનગર.  
કાતક ૧૯૬૪

}

પ્રકાશકો.

## પ્રસ્તાવના.

આપણો ભૂતકાળ એટલો અધ્યો અંધકારખરો છે કે પહેલાં શું હતું અને તેવું હતું એ વાસ્તવિક રીતે જાણવું ધર્ષું અધર છે. અત્યારના ધતિહાસનો ધર્ષો ખરો ભરો ભાગ ધર્ણનાઓ ઉપર અનુમાનોને આધારે અંગ્રેજો છે. ખીંડે ઉપાય પણ નથી. છતાં એ અનુમાનની દોરીએ દોરીએ વિદ્યાનો ધર્ષો ખરો ધતિહાસ શોધી કાઢ્યો છે.

શક દેંડા ભારત વર્ષમાં લગભગ ૨૩૦૦ વર્ષથી-સમાદૃ ચંદ્રઘૂરના વર્ષતથી પ્રવેશ કરી ચૂક્યા છે. અને સાતસો વર્ષ સુધી ભારતમાં રહ્યા છે. છતાં તેમનો ખરો ધતિહાસ નોંધ્યો તેવો વિશુદ્ધ રીતે મળતો નથી. તેમના રાજ્ય વિરસારની સીમા, તેમની પરાપૂર્વની પેઢી દર પેઢીની સિલસિલાવાર વિગતો હંલ ધર્ષી અંધકારમાં છે.

શકાની જુદી જુદી શાખાઓ હતી. તેમાં પદ્ધતિમાં શકરાજનો જૈન જ્યોતિર્ધર આચાર્ય કાળકસુરિ સાથે ધ. સ. પુ. બીજી શતાબ્દીની શરીરતામાં સીરિતાનમાંથી ભારતવર્ષમાં આવ્યા. કાળકાચાર્ય જૈનધર્મની રક્ષાને માટે તેમને અહો લાભ્યા હતા. ૬૬ શકરાજીઓ પોતાની સેનાઓ સાથે આચાર્ય કાળકસુરિના નેતૃત્વ નીચે ભારતમાં આવ્યા. એ આચાર્યના નેતૃત્વ નીચે શકરાજીઓએ પોતાના જીવનની રક્ષા કરી, આભાહી અભિવૃદ્ધિ કરી, રાજ્યો મેળવ્યાં, સત્તા ને સંપત્તિ મેળવ્યાં. કાળકાચાર્ય જૈન સાધ્યાની લાજ લુંટનાર ગર્દબી વિદ્યાને અણે અણે ગણ્યાતો અધ્વરનિપતિ ગર્દબિલ્ખ રાજને પરાજિત કરી માગાતું આખું રાજ્ય શકાને અપાવ્યું. કાળકાચાર્ય ડેટલાક કાળ સુધી તેમની સાથે રહ્યા અને શકરાજનો તેમના લક્ષ્ણ અની પોતાના અનન્ય ઉપકારી તરીકે આચાર્યની પૂળ કરતા રહ્યા. તેમના ઉપર આચાર્ય કાળકસુરિનો અદ્ભુત પ્રકાશ હતો. શકા તેમના ઉપર મંત્રમુખ હતા.

શકા સાથે આચાર્ય કાળકસુરિનો આટલો બધો નિકટનો સંબંધ હતો છતાં ભારતીય ધતિહાસમાં શકા અને આચાર્ય કાળકસુરિનો સંબંધ યોગ્ય રીતે આદેખાયો નથી. સર્વ પ્રથમ યૂરોપીયન વિદ્યાન પ્રો. કેંદ્રાધારો અને ભારતીય વિદ્યાન શ્રીયુત જ્યથસ્વાલે શકાના ધતિહાસમાં કાળકાચાર્યનો ધર્શારો કર્યો, પરંતુ તે ઉપરાંત તેમની વધુ હક્કાકત બહુ પ્રકાશમાં આવી નહીં તેમાં અનેક કારણો છે. મોટે લાગે આપણે-જૈનો જવાબદાર ધીએ.

પદ્ધતિમાં શક અથવા ક્ષત્રપ રાજનો અહુ લાંઝા કાળસુધી ગાઢી ઉપર સ્થિર રહ્યા છે, લગભગ ૫૦૦ વર્ષસુધી. ૪૦૦ વર્ષસુધી તો કંચ્ચ-સૌરાષ્ટ્રની ગાઢી નિરંતર તેમના હાથમાં રહી હતી. તે બધા આમેતિક-ભૂમકના વંશનારસો હતા.

આમેતિક (યસામેતિક) માટે ધતિહાસમાં બહુ મતબેદ છે. ડેટલાકનું એમ માનવું છે કે “ભૂમક અને આમેતિક અને જુદા જુદા છે. આમેતિક ચણનનો પિતા છે. ભહાક્ષત્રપ ભૂમક ક્ષત્રપ નહ્યાનનો પિતા અથવા પૂર્વવર્તી છે. વિગેર” (નહ્યાન અને ચણન સમકાલીન હતા.) ભહાક્ષત્રપ ભૂમક ક્ષત્રપ નહ્યાનનો પિતા હોય એવું બતાવવા એક પ્રમાણ ધતિહાસમાં નથી. એક સિક્કામાં નથી, સિલાલેખમાં નથી. ભૂમક નહ્યાનનો પિતા હોય એ મારી દણિએ યુક્તિ

સંગત નથી, કરણ કે નહ્યાન જે ભૂમકનો પુત્ર હોત તો નહ્યાનના ઠગલાઅંધ સિક્કાઓમાંના એકાદમાં તો “રાજો ભૂમકસ પુત્ર” એવું અવસ્થ ડેતરાયું હોત, (તે વખતે સિક્કાઓમાં કે શિલાદેખોમાં પિતા પ્રપિતા આહિના નામો ડેતરાવવાનો રિવાજ હતો.) પરંતુ ક્યાંય હજુ સુધી મળ્યું નથી. એટલે ભૂમક નહ્યાનનો પિતા નહોતો. તેવીજ રીતે ભૂમક અને આમોતિક જુદા જુદા હોય તે પણ મને અરાબર લાગતું નથી.

ભૂમક અને આમોતિકના મૂળ શષ્ઠો, તેની બુન્ધપત્રિ અને તત્કાલીન પરિસ્થિતિનો વિચાર કરતાં પણ મને લાગે છે કે ડૉ. સિહેવન લેવીની અને છેલ્લે ડૉ. સ્ટીન ડોનેનાની દલીલ વધુ બ્યાળબી છે.

ધ્યાનામોતિક-આમોતિકમાંનો ‘ધ્યાન’-‘આમ’ શષ્ઠ એ શક્ત શષ્ઠ છે, સંસ્કૃતમાં તેનો અર્થ ‘ભૂમિ’ થાય છે. તત્કાલીન અવસ્થા એવી હતી કે બહારના રાજીઓ, આગન્તુકા અને પરહેઠી મુસાફરો પણ ભારતીય સંરક્ષિતમાં આડર્થિયા છે, રંગાયા છે, ઓનપ્રોત અન્યા છે. તેમના ધ્યાનો પોતાના જીવનમાં આર્થ સંરક્ષિત અપનાવી છે, પોતાના નામો ભારતીય ભાષામાં ફેરવી નાખ્યાં છે. આસપાસના સંગ૊ળોમાં અને અહીંની રહેણીકરણીમાં મળી જવા મારે પણ તેમણે તેમ કંધું છે એટલે ગુજરાતીઓ નેમ બંગાળી નામો તરફ આડર્થિને પોતાના બંગાળી નામો રાખે છે તેમ ધ્યાનામોતિક-આમોતિક પોતાનું નામ ભારતીય ભાષામાં ભૂમક રાખ્યું હોય તો તે સાચ સ્વાભાવિક છે. એ હિસાબે આમોતિક અને ભૂમક એકજ બ્યક્ઝિત અને છે. અને પદ્ધિમી ક્ષત્રપો બધા તેના વંશવારસો હતા.

(૧) તેમના ધર્મ સંધારી ડાઇ પ્રશ્ન ઉપરિસ્થિત થયો નથી. તે આખી હકીકિત અંધારામાં રહી છે. કેવળ કાળજીચાર્થનોજ અત્યાર સુધી ધશારો થયો છે. જ્યારે ક્ષત્રપરાજીઓ કાળજીચાર્થ સાથે આવ્યા ત્યારથીજ તેમના પ્રભાવ નીચે હતા એમ પુસ્તકો અતાવે છે.

(૨) કાળજીચાર્થનું બ્યક્ઝિત અને વિભૂતિ નેતાં અને આસપાસની પરિસ્થિતિ નેતાં પદ્ધિમી ક્ષત્રપોનો આન્દો ડાઇ ધર્મ હોય એ સંશય પણ ભાગ્યેજ થઈ શકે.

(૩) કાળજીચાર્થના ભારેમાં ભારે ઉપકારતળે આવેલા હોધ નેમનાથી તેમને જીવનદાન, લક્ષ્મી, રાજ્ય-સત્તા, અને અખૂટ વૈભવ મળ્યાં હોય એવી તેમના ભક્તા અનુયાયી અન્યા હોય તો તેમાં કંધું આંશ્ર્ય નથી.

(૪) બીજું તરફ જૈનધર્મના પ્રભાવક આર્થ એવી તહોનો લાલ ચુમાવે એ પણ જ્યાનનોંગ નથી.

(૫) નૈન અતુશુતિ-કાલજીચાર્થ કથાઓ, પ્રથંધો પણ એ વાતને પ્રતિપાદન કરે છે. વળી અત્યાર સુધી જૈન ધર્તિહાસ પ્રમાણિત મનાતો આવ્યો છે.

(૬) સૌથી મોટી વરતું-બીજી શતાબ્દીની લગભગ અંતમાં થયેલા દૃદ્જામાના પુત્ર દામજદશી કે ફૂલસિહોનો ગિરનારનો શિલાદેખ એ વસ્તુને પ્રમાણુરૂપે પ્રદર્શિત કરે છે. બધા વિદ્ધાનો એ શિલા-દેખને જૈન શિલાદેખ તરીક એકમતે સ્વીકારે છે.

(૭) દૃદ્જામાની મતુષ્યવધ ન કરવાની પ્રતિસા પણ કદાચ એ સંસ્કારને લીધેજ હોય.

આ બધી ઘટનાઓ ઉપર વિચાર કરતાં એ નિર્વિવાદ સત્ય તરી આવે છે કે પદ્ધિમી ક્ષત્રપો જૈન ધર્માનુયાયી હતા. એસુંજ નહીં લાંબા કાળ સુધી પેઢી દર પેઢી તેઓ જૈનધર્મના સંરક્ષાર નીચે રહ્યા છે.

એ શષ્ઠો જૈન સંપ્રદાય પ્રત્યે કહેવાની રૂમ લઈ કે, એ બધો ધર્તિહાસ, ઔતિહાસિક દિશાઓ

પ્રકાશમાં નથી આવ્યો. તેમાં ખાસ કારણ અને ભૂલને પાત્ર જૈનો છે. જૈનોએ જોતાનું સાહિત્ય જગત સમક્ષ મૂક્યું નહીં, પ્રકાશિત કર્યું નહીં, તેના ઉપર અન્વેષણ કર્યું નહીં. જૈનોમાં સાહિત્ય અખૂટ છે, ગંભીર છે, સર્વચાહી છે, પ્રમાણિક છે, સર્વમાન્ય છે, જૈનાચાર્યોએ જે જે વખ્યું છે તે મેટે લાગે પ્રમાણિક અને વિશુદ્ધ છે; પરંતુ તે અધું ભાંડારોમાં ભરી રાખ્યું, પચારાઓમાં સંચાહી રાખ્યું તે જમીનમાં દાટી રાખ્યું. પરિણાગે ક્રાડાઓએ આધું, સડી ગયું, નષ્ટ થયું. અને જૈન સાહિત્ય, જૈનધર્મ, જૈન ધતિહાસ ખાખેચીયામાં પછો રહ્યો. પ્રકાશમાં ન આવ્યો. અધિકારી અને વિવેક વગરની ગ્રાનપૂજાએ શાનનો પ્રચાર અટકાવ્યો, શાનનો નાશ કર્યો, જગતનું સન્માન ખોયું. જૈન સાહિત્ય અને જૈન ધતિહાસને રાજકીય દિશિએ મહત્વજી. મહત્વનું નહીં. જૈનો તે કદી સમજન્યા નહીં, અને વર્તમાન પરસ્પરની પરિસ્થિતિને જોતાં લાંઘા કાળ સુધી એ મહત્વ હજુ નહીં સમજય. જૈન અમણું સંધ્ય સમાજને સત્યમાર્ગ આપી શકતો નથી. દોરા શકતો નથી, ઉપગોગી ને આવશ્યક કાર્ય કરી શકતો નથી એ બહુ દુઃખનો વિષય છે.

સાહિત્યની દિશિએ મારે એગ્ઝ્યું નિવેદન ડરનું જોઈએ કે જૈન સાહિત્ય, જૈન ધતિહાસને જગત સમક્ષ મૂકવામાં આવે તો દુનિયાનો ધર્મો આદર મેળી શકે. આ કટોકરીના સમયમાં જૈન સાહિત્ય જગતને પથપ્રદર્શક અની શકે, નવો ધતિહાસ ને નવાં સૂત્રો જગતને મળી શકે, પ્રગતિનો માર્ગ સાધી શકે. સમાજના વિદ્યાનો અને ખાસ કરીને અમણું પુંગવો—સાધુઓએ બીજું બધી બાઅતોને છોડી દ્ધને સાહિત્ય ક્ષેત્રમાં ઉત્તરી જય તો સાહિત્યનો, ધર્મનો, ને જગતનો બધી રીતે ઉદ્ઘાર કરી શકે. સાધુઓનું પ્રધાન કાર્ય સાહિત્ય સેવા છે અને સાહિત્ય સેવાનું પરિણામ ધર્મનો ઉદ્ઘોત છે.

આ પુસ્તકમાં શક-પથિભી શક રાજાઓની હુંકા સમીક્ષા યથાવત્સર કરી છે, તેને મારે જ્યાં જ્યાં બિન અથવા અસત્ય મંત્રનો હતાં—મને લાગ્યાં તેની સમીક્ષા પણ કરી છે.

આવના એવી છે કે જે સ્થિરતા અને અનુકૂળ સંયોગો મળી જશે તો ‘જૈન ધતિહાસ’ બોધ સમયમાં જગત સમક્ષ મૂકવો શરીર કરી દ્ધરણ.

પહેલા દામજદર્શી અથવા પહેલા દૂદસિંહના શિલાલેખની પ્રતિકૃતિ અન્યત્ર નહીં મળવાથી લાલનગર રટેટ તરફથી બહાર પડેલ ‘પ્રાકૃત અને સંસ્કૃત શિલાલેખો’ માં આપેલ શિલાલેખ ઉપરથી બ્લોક તૈયાર કરાયો છે જે મારે લાલનગરના દરભારશ્રીનો આભાર માનવામાં આવે છે. વળી બીજું ચંદ્રનું ચિત્ર મધુરાના કર્જન મ્યૂઝીયમનાં ક્યૂરેટર શ્રીયુત વાસુદેવશરણુ એમ. એ. ની સમતિથી પ્રાસ થયો છે તે મારે તે મ્યૂઝીયમના વ્યવરથાપકો ધન્યવાદને પાત્ર છે.

આ પુસ્તક લખવામાં ન્યાય-બાકરણુ-તીર્થ શ્રીયુત ઇસેહુચંદ્ર એલાણુએ કેટલાક અંશો સહયતા કરી છે.

ડૉ. સ્ટીનકોનો, ડૉ. હુરાનંદશાસ્કો અને શ્રીજ્યયચંદ્રવિદ્યાલ કાર્યાલાયના પુરતકો ડીક ટીક ઉપગોગી થઈ પણાં હતાં તેની નોંધ લઇ છું:

જરીરી પુરતકો પૂરાં પાડવા મારે ઇલોધી ( મારવાડ ) ના સંધને ધન્યવાદ ધરે છે.

ઇલોધી ( મારવાડ )

કાર્તિક

ધર્મ. સં. ૧૬

{

વિજય-દસ્તરિ

# પુસ્તકેનું સૂચિપત્ર

જેના પ્રમાણે આ પુસ્તકમાં આપ્યાં છે

## ENGLISH

1	Ancient India	Ptolemy	1927
2	Ancient Indian History and Civilization	R. C. Majumdar	1927
3	Ancient India and Indian Civilization	M. R. Dobie	1934
4	Ancient Indian Numismatics	Dr. D. R. Bhandarkar	1921
5	Ancient Indian Tribes Vol. II	Dr. B. C. Law	1934
6	Antiquities of Kathiawar and Kachh	Dr. James Burgess	1876
7	Asoka	Dr. D. R. Bhandarkar	1932
8	"	J. M. Macphail	1928
9	"	Dr. R. Mookerji	1928
10	"	Dr. E. J. Rapson	1916
11	"	V. A. Smith.	1919
12	Asokan Rock at Girnar	Gaekwad's Archaeological Series	1936
13	Bactria	Rawlinson	1912
14	Buddhist India	Rhys Davids	1903
15	Buddhistic Studies	Dr. B. C. Law	1931
16	Cambridge History of India Vol. I	Dr. Rapson	1935
17	Cambridge shorter History of India	J. Allan	1934
18	Catalogue of the Indian Coins in the British Museum	Dr. E. J. Rapson	1908

મહાભાગ રાજ શદામા.

19	Chandragupta Maurya	P. L. Bhargava	1935
20	Chronology of India	C. Mapel Duff	1899
21	Collection of Prakrit Sanskrit Inscriptions	P. Peterson	
22	Early History of India	V. A. Smith	1924
23	Epigraphia Indica Vol. VIII	E. Hultzsch	1905-06
24	The Geographical Dictionary of Ancient.....India	Nandalal Dey	1927
25	Geography of Early Buddhism	Dr. B. C. Law	1932
26	Hindu History	A. K. Mazumdar	1920
27	History of the Aryan rule in India	E. B. Havell	MCMXVIII
28	History of India	K. P. Jayaswal	1983
29	Historical Inscriptions of Gujrat Part I	G. V. Acharya	1933
30	Inscriptions of Asoka	E. Hultzsch	1925
31	Kharoshthi Inscriptions Cor. Ins. Indi. Vol. II part I	Dr. Sten Konow	1929
32	Megasthenes ( Ancient India )	M'Crindle	1926
33	The Mauryan polity	V. R. R. Dikshitar	1932
34	Oxford History of India	V. A. Smith	1928
35	Political History of Ancient India	Ray Chaudhari	1932
36	Short History of India	Moreland & Chatterji	1936
37	Story of Kalaka	Dr. W. Norman Brown	1933
38	Sudarshana Lake of Girinar	Manishankar R. Trivedi	
39	Traditional Chronology of the Jains	Shantilal Shah	1935

अन्य भाषामां.

४०	कालक कथाओ कल्पसूत्र	जीवनचन्द्र साकरचन्द्र झवेरी	१९३३
४१	प्रभावकचित्र		
४२	विविध-तीर्थकल्प	सं. जिनविजयजी	१९३४
४३	हेमन्तथेरावलि		
४४	अशोक ( बंगला )	श्रीचारुचन्द्र बसु	१३१८
४५	अशोक के धर्मलेख	जनार्दन भट्ट एम. ए.	१९३२

पुस्तकेनुं सूचिपत्र.

४६ गुप्तवंशका इतिहास	रघुनन्दन शास्त्री एम. ए.	१९३२
४७ चन्द्रगुप्त विक्रमादित्य	गंगाप्रसाद महता एम. ए.	१९३२
४८ द्विवेदी अभिनन्दनग्रन्थ	काशी नागरीप्रचारिणी सभा	१९१०
४९ पाणिनि	रजनीकान्त	१९२८
५० बौद्धकालीन भारत	जनार्दन भट्ट एम. ए	१९८२
५१ भारतीय इतिहास की रूपरेखा जि. १	जयचन्द्र विद्यालंकार	१९३३
जि. २	"	"
५२ मौर्यसाम्राज्य का इतिहास	सत्यकेतु विद्यालंकार	१९८५
५३ बौद्धयुगेर भूगोल	विमलचरन लौ	
५४ गिरनारनुं गौरव	जयसुखराम पु. जोषीपुरा	१९२८
५५ गिरनार माहात्म्य	दोलतचंद बरोड़ीया बी. ए.	१९१०
५६ चन्द्रगुप्त मौर्य	जयसुखराम जोषीपुरा	१९२८
५७ समुद्रगुप्त	भरतराम म्हेता	१९२७
५८ हिन्दुस्थाननो प्राचीन इतिहास	गुजरात बर्नार्क्युलर सोसायटी	१९११
५९ महाभारत	कृष्णाचार्य तथा व्यासाचार्य	१९०८
६० परिशिष्टपर्व भाषान्तर	जैनधर्मप्रसारकसभा	१९७८

JOURNALS.

61 Indian Antiquary Vol. XXXVII		1908
62 Indian Historical Quarterly Vol. XIII		1937
63 Journal of the B. O. R. S. Vol. XIV. Part III		1928
64                                 "	V.    "   IV	1919
65                                 "	VI.   "   I	1920
६६ लैन रैप्य भडात्सव अंक		१६३०
६७ नागरीप्रचारिणी पत्रिका	भाग १८/१	१९२८
६८ पुरातत्व पुस्तक १.		१६७६
६९ पुरातत्व पुस्तक २.		१६८०
७० भुद्धिप्रकाश		१६३४

## વિષયાનુક્રમણીકા.

વિષય.	પૃષ્ઠ.	વિષય.	પૃષ્ઠ.
<b>પ્રથમ વિભાગ.</b>			
<b>૧ રાજ ઇદ્વામા</b> ...	... ૩-૫	<b>ક્ષત્રપ એ પદ્ધતી કે કુલ ? ...</b>	... ૩૮
શકોતું ભારતમાં આગમન ...	... ૪	શક રાજ્યાનો ધર્મ ...	... "
યૌધેયોનો પરાજ્ય ...	... ૫	ઇદ્વામાના સિક્કાઓ ...	... ૪૧
<b>૨ શકોતિનું મૂળ ...</b>	... ૬-૧૬	ચણવંશીય ક્ષત્રપોની વંશાવળી ...	... ૪૩
શકોતું કંખોજ પર આક્રમણ ...	... ૧૬	<b>૪ સુદ્રશિન તળાવ ...</b>	... ૪૪-૪૭
શકોતોડાની પાર્થિવ રાજ્ય સાથે લડાઈ ...	... ૧૭	સુદ્રશિન તળાવનું સ્થાન-માપ ...	... ૪૪
<b>૩ શકોતોકોતું ભારતમાં આગમન ૨૦-૨૬</b>		ચંદ્રગુમના વખતમાં તળાવની મર્યાદા	૪૬
નોનોના જ્યોતિર્ધર કાલકાચાર્ય ...	... ૨૦	ઇદ્વામાના વખતમાં તળાવની મર્યાદા	૪૭
હિન્દી શકસ્થાન ...	... ૨૪	<b>૫ શિલાલેખ અને અનુવાદ ...</b>	૪૮-૫૪
પશ્ચિમ ભારતમાં ગ્રાવાસ ...	... "	શિલાલેખની સામાન્ય માહિતી ...	૫૮
ક્ષત્રપ-મહાક્ષત્રપની ચોજના ...	... ૨૫	અડકું માપ ...	... ૫૬
ક્ષત્રપનો હિન્દમાં પ્રચાર ...	... "	અડક ઉપરના લેખો ...	... "
ઉણોન ઉપર હુમદ્રી ...	... ૨૬	અડકની દિશા ...	... "
<b>૪ રાજ ઇદ્વામાનો રાજ્ય અધિકાર ૨૭ ૪૩</b>		ભાષારૈલિ ને લિપિ ...	૫૦
ઇદ્વામાનો રાજ્ય અમલ ...	... ૩૨	મૂળ સંસ્કૃતશિલાલેખ ...	૫૩
યશસ્વી દિગ્ભજ્ય ...	... "	ગુજરાતી અનુવાદ ...	૫૫
યૌધેયો પર વિજ્ય ...	... ૩૩	હિન્દી અનુવાદ ...	૫૮
સુદ્રશિન તળાવનો પુનર્દ્વાર ...	... ૩૪	ધૂગલીશ ટ્રાન્સલેશન ...	૬૧
રાજ ઇદ્વામાનો જ્યોતા રાજ્યો ...	૩૫	શિલાલેખમાના વિરોધનામોની અનુક્રમણીકા ૬૪	
રાજ + ઇદ્વામાના ઉત્તરાધિકારીઓ ...	,,	<b>૭ પોકળ વિધાનોનો પ્રતિવાદ ૬૫-૮૨</b>	



# મહાક્ષત્રપ રાજ તૃદ્રણામા

## પ્રથમ વિભાગ



## રાજ રૂદ્રદામા.

૧

પ્રસિદ્ધ ચાષનવંશીય કૃતપરાજ જયદામાના પુત્ર મહાકૃત્રય રાજ રૂદ્રદામા શક્નીતિનો મહા પરાકર્મી ને સમર્થ રાજ થઈ ગયો છે. તેણે ઈ. સ. ૧૩૦-૧૫૦ સુધી રાજ્ય કર્યું હતું.

શક્નીતિ મૂળ ફરની-લટકતી જાતિ હતી એટલે તેમની મૂળ ભૂમિ કર્દ હતી તે નિશ્ચિત કરવું સુશ્કેલ છે, છતાં તેમના વાસ-વિહાર વિગેરેથી એટલું કંઈ શકાય કે તેનું ખાસ સ્થાન પૂર્વદેશાન હતું. તે વખતે તે ભૂમિ શક્નીસ્થાન હાતનું સીસ્તાન કહેવાતી હતી. બાકી તો એ જાતિ ચીનની ઉત્તરી સીમાથી લઈ કરીને રશિયાનો દક્ષિણ ભાગ વીધી ડેડ પૂર્વદેશાન સુધી વિસ્તરી ચૂકી હતી. દેશાન, યૂનાન અને ભારતીય લોકો પણ તેને પ્રાચીન કાળથી જાણતા હતા.

તે જાતિના મૂળે ત્રણ લેદો હતા.

- ( ૧ ) સકા તિથઘોદા,
- ( ૨ ) સકા હૈમવર્કર્ચ,
- ( ૩ ) સકા તરદરથા.

ભારતની સાથે સકા તિથઘોદાનોજ વધારે સંબંધ રહ્યો છે.

તે ત્રણ પ્રકારના શકો ઈ. પુ. C ની. સહીથી વિદ્યમાન હતા એ નિર્વિવાદ સત્ય છે. તેમની ભાષા-ઝોલી આર્ય હતી.

## શકેનું ભારતમાં આગમન—

શકેનું ઉજ્જવેનના રાજ ગાર્દલિલ્લિના વખતમાં જૈનધર્મના જ્યોતિર્ધર્મ, મહાવિલૂતિ આચાર્ય કાલકસૂરિ સાથે ડ. સ. પુ. ના એન્ન-સૈકામાં-સૈકાની શરૂઆતમાં (૧૨૫-૧૫ ની વચ્ચેમાં) ભારતમાં આવ્યા.

તેઓ સિન્ધુનદી પાર કરી સિન્ધુમાં થઈ, રસ્તામાં પોતાની સત્તા જમાવતાં જમાવતાં કુચછિ-કાડીઆવાડ-સૌરાષ્ટ્ર પહોંચ્યા. ત્યાં તેમણે પોતાનું રાજ્ય જમાયું. શકેનુંશાની સ્થાપના કરી અને પછી દક્ષિણ ગુજરાતના રાજ્યોની મહેદ લદ ઉજ્જવેન ઉપર ચડાઈ કરી તેને લૃતી લીધું, ત્યાં રાજ્યાની સ્થાપી.

સિન્ધુ-સૌબાઈર એ શકેનું હિન્દુસ્તાનનું શકેસ્થાન મનાયું. તેની રાજ્યાની મીનનગર થઈ. ત્યાંના નાયક રાજ કહેવાયા. એને જ્યાં જ્યાં તેમની સત્તા હતી ત્યાંના સૂણાઓ કે શાસકે ક્ષત્રપો અને મહાક્ષત્રપો કહેવાયા.

એવા એક મહાક્ષત્રપ રાજ ચાટન-લેણે પોતાના નામથી વંશની શરૂઆત કરી અને ચાટનવંશ કહેવાયો તે કુચછિ સૌરાષ્ટ્રનો મહાક્ષત્રપ હતો, તેનો પૈત્ર રાજ રદ્રદામા પણ તેની સાથે રહેતો હતો; પણ પાછળથી તેના લુધનનો અને પરાક્રમનો અસાધારણ વિકાસ થયો.

સૌરાષ્ટ્ર તે વખતે ચારે તરફથી લડાઈના સકંનમાં સપડાયલું હતુ. ૪૦ વર્ષથી લડાઈના લયથી અને જાનમાલની ઝુચારીથી ત્યાંની પ્રજા વાસી ઉઠી હતી. તેમને એક પ્રભળ પ્રતાપી, રાજ્ય તથા પ્રભળની સહીસવામતી જગતી શકે, પ્રભળની સંપૂર્ણ રક્ષા કરી શકે, અને આર્થસંસ્કૃતિનો વિસ્તાર કરી શકે તેવો સમર્થ પ્રલાવશાળી રાજ જોઈતો હતો. ત્યાંની સમર્સ્ત પ્રભળે ક્ષત્રપ રદ્રદામાની પસંદગી કરી.

તેણે પોતાની જાતને આર્થસંસ્કૃતિમય બનાવી હીધી એટલુંજ નહીં પોતે પ્રત્યેક અંશમાં ભારતીય સંસ્કૃતિ અપનાવી, રાજ્યપણાંખમાં પણ ભારતીય પદ્ધતિ સ્વીકારી, તેણે પ્રભળીય સંસ્થા અને મંત્રી (કર્મસંચિબ ને મતિસંચિબ) પરિષ્ઠમાં આર્થસંસ્કૃતિનો એપ આય્યો.

તે ઉપરાંત તેણે અપૂર્વ કૌશલ્ય, પ્રચંડ પ્રતાપ ને કુનેહથી રાજ્યની રક્ષા કરી, માયા લરી રીતે સુરાષ્ટ્રનું શાસન કર્યું અને તે ખરેખરે પ્રભળનો પાલનહાર-રક્ષક બન્યો. પોતાના રાજ્યની અપરિમિત સીમા વધારી.

પોતાના રાજ્યકાળના વર્ષેમાં તેણે અનેક યુદ્ધો કરી અનેક દ્વારા ઉપર પોતાનો વિજયદૂર રૂક્ખાંધ્યો. મોટા મોટા રાજ્યોને મહાત કર્યા.

### ઘોધેયોનો પરાજય—

ત્રણુસો વર્ષની રાજકીય ઉથલ-પાથલ ને ખૂનામરકીમાં પણ જેમણે પોતાનું સ્વાતંત્ર્ય અપદિત ને અણાધિત રાજ્યુ હતું, જેઓ અનેક ટક્કરે લુહી હૃસનોના મોરચાં ને લડાઈઓમાં વિજયી ણન્યા હતા, વીર તરીકે દેશમાં જ્યાતિ મેળવી હતી અને અનેક જય વિજયનાં અલિ-માનથી મહોન્મત ણની ગયા હતા એવા ઘોધેયલોકોને પણ જરૂરી ઉખાડી નાખી સૌરાષ્ટ્રથી સિનધુ-સૌવીર અને દક્ષિણમાં આંધ્રથી ઉજજૈન સુધી રાજ્યનો વિસ્તાર કરી એક છત્ર રાજ્ય તરીકે પોતાની આણ વર્તાવી ઉજજૈનને પોતાની રાજ્યધાની ણનાવી, અને પોતે સ્વયં મહાક્ષત્રપતું બીરદ ધારણ કર્યું. પોતાના સ્વતંત્ર સિક્કાઓ ચાલુ કર્યા, ( જેનું કંચ્છ કાઠીયાનાડથી માળવા સુધી ચલણું હતું. તેના ઉપર \*રાજ્ઞો ક્ષત્રપસ જયદામ-પુત્રસ રાજ્ઞો મહાક્ષત્રપસ રૂદ્રદામસ ડેતરાયદું રહે છે ) પ્રાંતે પ્રાંતે પોતાના સુખાઓ ગોડંયા.

તે કેવળ પરાક્રમી ઉજજૈન રાજવી હતો. એટલું નહીં પણ તે અર્થશાસ્ત્ર નિપુણ, વિદ્ધાન, શાસ્ત્રપાત્રંગત પણ હતો, સાથે સાથે ચુદ્ધ સિવાય મનુષ્યવધ ન કરવાનો નિશ્ચયી-ફદ્પતિજ્ઞાવાળો હતો.

ગિરનાર-ખૂનાગઢના સુદર્શન તળાવને સમરાવી-ખંધાવીને તો તેણે પોતાના યશ ઉપર મહોર મારી હતી. તેના બાંધકામના ખર્ચમાં પ્રજન પાસેથી એક પાઈ પણ લીધી ન હતી. પોતાના ખાનગી અન્નનામાંથી તે ખર્ચ આપ્યો હતો.

તે સૌદર્યવાનું પણ હતો અને અનેક સ્વયંવરોમાં ધણી રાજકુંવરીઓની વરમાળા ધારણ કરી હતી.

એ રીતે તેણે ધતિહાસમાં પરાક્રમી, યશસ્વી, વીર, વિદ્ધાન, ઉદ્દાર અને સુસક્ષ્ય રાજવી તરીકે અમર નામના મેળવી છે.

\* A Catalogue of Indian Coins in the British Museum by E. J. Rapson. P. 78.

## શક જાતિનું મૂળ.

રાજ દૃદ્રદામા મૂળો શકજાતિનો હતો, અને શકજાતિનું મૂળ સ્થાન કયું તે શોધવું બહુ સુસ્કેલ છે, છતાં પ્રાચીન ચીનના ઉત્તરભાગમાં તાતાર જાતિએનું મૂળ સ્થાન હતું. તે તાતારોને ચીન વૈકો હીયંગનૂ (Hiungnū) કહેતા. ૧હીયંગનૂ, ૨હૂણુ, ૩હન, ૪હૂણુ એ બધા એકજ જાતિના ધોતક નામાન્તરો છે. એ હૂણુ વૈકો ચીનની ઉત્તરના મુદ્દકમાં-લાગમાં રહેતા હતા. ત્યાં આસપાસમાં થીનાં પણ ટોળાંએં વસતાં હતાં. તે બધા જંગલી અવસ્થામાં, ગાય લેંસ, બંકરાં ઘેટાં વિગેરે પશુધન અને સ્વી, બાળ બન્યાના કુદુંણ કખીલા સાથે જ્યાં પુષ્કળ ધાસચારે ભળી શકે એવા પ્રદેશમાં અટકતા ફરતા હતા. આ હૂણુ વૈકો પણ તેમાંનાં એક ટોળાનાં હતાં, તેઓ લડવૈયા તરીકે પણ મશફૂર હતા. એટલે ઘોડાઓ ઉપર સ્વારી કરી વારંવાર ચીનની સરહદ ઉપર ધરી આવતા અને લૂંટકાટના હુમલાઓ કરતા. એ રીતે ચીનાવૈકોને તેમની સાથે વારંવાર સંધર્ષણુમાં આવવું પડતું.

ચીનાવૈકો તે વખતે કાંઈક સભ્ય ને સુસંસ્કૃત પ્રજા ગણ્યાતી. તે ધરણાર વસાવી

૧ ચાઈનિઝ વૈકો હીયંગનૂ કહે છે. ૨ સંસ્કૃતમાં હૂણુ કહે છે. ૩ અંગ્રેજમાં હન કહેવાય છે. ૪ પારસીએ હૂણુ કહે છે. મારતીય ઇ. રૂપરેખા જિ. ૨ પૃ. ૭૪૬.

વ્યવસ્થિત રીતે રાજનૈતિક ને સામાજિક બંધારણોને આધીન રહી શાંતિથી સ્થાયી લુધન ગુણરત્તી થઈ ગઈ હતી. તે પ્રણ આ કટકતી ટોળીઓથી પરિચિત હતી.

ફૂણુલોકોથી તેને ખાસ થતો હતો, તેમના જાનમાલને નુકશાન થતું અને તેમની સાથે વારંવાર લડાઈમાં ઉત્તરવું પડતું એટલે તે લોકોના ફુમલાઓથી ને લયથી બચવા માટે અને પ્રણનું સારી રીતે રક્ષણ થઈ શકે એ શુદ્ધ આશાયથી ત્યાંના રાજ શાન્તિ-હુદ્દાંગન્તીઓ હ્ય. પૂ. ૨૪૬-૨૧૦ ના અરસામાં ચીનના ઉત્તરલાગમાં સમુદ્ર કિનારાથી કાનસૂ પ્રાંત સુધી એક મોટી દીવાલ બંધાવવાનું શરૂ કર્યું. જે દીવાલ આજે ધર્મિણાસમાં હુનિયાના આશ્રમોમાંનું એક આશ્રમ બની રહી છે. તે દીવાલ એવી તો મજબૂત બનાવવામાં આવી કે ડેઇપણ વિલ્લવકારી દળ તેને તોડી શકે નહીં તેમ કોઈ અંદર ધૂસી પ્રણને રંબડી શકે નહીં. આ ઘટનાએ-ચીની દીવાલની બનાવટે હુનિયાના અને ખાસ કરીને એશિયાના ધર્મિણાસમાં લારે ઉથ્લ-પાથ્લ મચાવી દીધી છે.

જ્યારે આ દીવાલ બંધાણી ત્યારે ફૂણુલોકો વિગેરેની કટકતી ટોળીઓ. સંકઢા-મણ્યમાં આવી. તેઓ આ દીવાલ અને દરીયા કિનારાની વચ્ચોવચ્ચ્ય આવી પણ્યા એટલે ધાસચારો ને સાધન સામની મેળવવા માટે તેમને બીજું સ્થાન શોધવાની જરૂર પડી. એથી તેઓએ એ પ્રદેશમાંથી નિકળી કાનસૂપ્રાંતને છેવાડે વાયવ્ય લાગ તરફ ચાલવા માંડયું.

આ ફૂણુલોકોની કૂચ ધર્મિણાસમાં ડેવા પરિવર્તન કરે છે અને તેના આધાત પ્રત્યાધાત ક્યાં સુધી લાગ્યા છે તે આપણે આગળ નોઈશું.

કાનસૂપ્રાંતની એક ધાર તિથિભતમાં સિમ્કિયાંગ સુધી વધેલી છે. તેની પશ્ચિમે એક હિસ્સામાં બહુ પ્રાચીનકાળમાં તાહીયા નામની જાતિ રહેતી હતી. અને એજ પ્રદેશમાં નીયા અને ચર્ચાનનદીઓનાં કંડાઓમાં ચુદ્ધિશા જાતિ પણ રહેતી હતી.

ચુદ્ધિશાજાતિ એ ભારતના પ્રાચીન અંશોમાં \*ન્ડાધિકાજાતિ તરીકે વિખ્યાત છે. પ્રાચીન લોકો તેને ન્ડાધિકાજાતિ તરીકે એજભતા હતા. તેને અસિ, અસિયાન, ઉષિ કે ચુદ્ધિ લોકો પણ કહેવામાં આવતું હતું.

\* 'મહાલારત' ના 'સભાપર્વ' માં અજુન ના 'ઉત્તરદિવિજિયન્ય' ના અસંગમાં આ ઝષિક જાતિનો ઉલ્લેખ છે. એથી તો એ પણ મળો આવે છે કે તે લોકો પોતાના મૂળ ધરમાં હતા ત્યારથીજ ભારતીય લોકો તેને જણુના હતા. કારણ કે મહાલારતનું આ વર્ષનું હ્ય. પૂ. ૧૧૫ પહેલાનું છે.

બીજી હક્કાત આથી એ સાખીત થાય છે કે તરીમ નદીના કાંઠા ઉપર ભારતીય લોકોનો પ્રવેશ બહુ પ્રાચીન કાળ-અશોકના સમયથી શરૂ થઈ ચૂક્યે. હતો.

તાહીયા લોકો શાંતિ પસંદ કરનારા હતા. નયારે ચુદ્ધિશિ-ઝડપિક જાતિના લોકો પ્રચંડ લડવૈયા હતા.

હવે પેલા હૂણુ લોકો કરતા કરતા આ ચુદ્ધિશિ લોકોના પ્રદેશમાં આવી પહોંચ્યા. ચુદ્ધિશિ લોકો તો એ હૂણુ લોકોના કદ્દર વિદેશી હતા. તેમને તો પરસ્પર વારંવાર યુદ્ધો થયા કરતાં હતાં. આ વખતે પણ તેમને પરસ્પર બોર સંઘામ-લડાઈ થઈ. તેમાં ચુદ્ધિશિ લોકો હાર્યા, અને તેમને પોતાનો એ પ્રદેશ છોડવો પડ્યો. તેઓ થીયાનશાનની દક્ષિણ પાક્ષિક તરફ ચાલ્યા ગયા.

ઇ. પૂ. ૧૭૬૫ માં હૂણુનો સરદાર મો-તૂ-મોહુકે આ ચુદ્ધિશિના સંબંધી એક સંદેશ ચીનના સામ્રાટુને મોકલ્યો હતો. કે “ચુદ્ધિશિ-ઝડપિક જાતિના લોકો તથા આસ-પાસની પોણારી ટોળાઓને જીતી લીધી છે અને તે થીયાનશાનની દક્ષિણ દક્ષિણ પાક્ષિક તરફ ચાલ્યા ગયા છે.”

તે પછી એ વર્ષે હૂણુનો સરદાર મોહુક ઇ. પૂ. ૧૭૪ માં મૃત્યુ પામ્યો.

ઇ. પૂ. ૧૬૫\* માં હિયંગનૂ-હૂણુ લોકોના સરદાર લાઓ-ચાંગુંયે ચુદ્ધિશિ લોકો સાથે કુરી લડાઈ કરી, ચુદ્ધિશિ લોકોને કુરી પણ હરાયા. તેમના સરદારને મારી નામ્યો અને તેની પોપરીનો જ્યાદો જનાવી લીધો.

\* We read in the *T'sien Han-shu*: ‘the *Yue-chi* had been conquered by the *Hiung-nu* and had, in the west, attacked the *Sai-wang*. The *Sai-wang* had fled southwards and settled in the distant country...’ the *yue-chi*, that their defeat at the hands of the *Hiung-nu* had been effected in 176 B. C., and that they were themselves driven out of the old *Saka* country about 160 B. C.

*Corpus-Indicarum Vol. II, Part 1, P. xix-xx.*

તાહી હુન-શુ ઉપરથી એમ જાણ્યા છે કે હિયંગનૂ લોકોએ ચુદ્ધિશિ લોકોને જીતી લીધા પછી ચુદ્ધિશિઓએ પાક્ષિકમાં સૈ-વાંગુ ઉપર હુમલો કર્યો, ને તેમને દક્ષિણમાં દૂરના દેશમાં જવાતી ફરજ પડી... હિયંગનૂના હાથે ચુદ્ધિશિ લોકો ઇ. પૂ. ૧૭૬ માં પરાજિત થયા હતા અને ઇ. પૂ. ૧૬૦ માં તેઓ જૂના શક્દેશમાં ગયા.

ડા. રસીન કેનો.

\* About the year 165 B. C. the great tribe of the *Yueh-chi* were driven out of their pastures in North-West China by a rival horde, and, moving in southwardly direction, came into contact with the conglomerate bands of scythians.  
“Bactria” P. 91-2.

ચુધશિલોકેનો કાફ્લો બહુ મોટો હતો. જૈરા, છોકરાં હોર દાંખર ઉપરાંત એકથી એ લાખ તીરકામડાંવાળા લડવૈયા હતા. બધા મળીને પાંચ લાખથી એદુસ લાખની સંખ્યામાં હશે. આવડી મોટી જનસંખ્યાના વાસને માટે બહુ વિશાળ પ્રદેશ જેહાએ. તે લોકો આવે પ્રદેશ શોધતાં શોધતાં તકલા-મકાન\*વાળા પ્રદેશમાંથી પસાર થઈ ટેકેસ અને કોન્જેસ ઉપનાનીએ જેને મળે છે તે ઈલી ( Ill ) નાનાના કાંઠા ઊર કુલજ પ્રદેશમાં આવી પહોંચ્યા.

એ પ્રદેશમાં ‘લુ-સુન’ નામની એક જાતિ રહેતી હતી. તે સંખ્યામાં નાનો હતી છતાં પરાકમી વીર્યવાળી ને તેજસ્વી હતી. તેમનામાં તો કેવળ દસેક હજરજ લડવૈયા હતા.

From them (chinese records) we learn that the *Yueh-chi*, pushed westwards by the *Huns* about 165 B. C., displaced the *Cakas*, who inhabited the country of the *Jaxartes* to the North-East of *Sogdiāna* and *Bactria*.  
*Cambridge History of India Vol. 1. P. 459*

In the neck of country between the *Great Wall* and the mountains which forms part of the province of *Kan-su*, lived a people known to Chinese historians as the *Yueh-chi*. Being attacked and defeated by the *Huns*, C. 165 B. C., the *Yueh-chi* were driven from their country.....

*Cambridge History of India Vol. 1. P. 565.*

ચીનની મોટી દીવાલ અને પહાડો વર્ચેનો પ્રદેશ કાનસ્યુ પ્રાંત તરીકે ઓળખાય છે. ત્યાં એક જાતિ વસતી હતી જેને ચીનના ઐતિહાસિક પુરુષો ચુધશિ કહેતા હતા. તેમને છ. ખ. 165 માં હૂંજુ લોકોએ હુમલો કરી પરાણિત કર્યા ત્યારે તેઓ તે દેશમાંથી ચાદ્યા ગયા.

કૃષ્ણજ હીસ્ટ્રી. પૃ. ૫૬૫.

\* The moving horde (yueh-chi) mustered a force of bowmen, estimated to number from one hundred to two hundred thousand; and the whole multitude must have comprised, at least, from half a million to a million persons of all ages and both sexes.

*The Early History of India. P. 263.*

ચુધશિ લોકોને કાનસ્યુ પ્રદેશમાંથી ગયા હતા તેનો કાફ્લો બહુ મોટો હતો. તીરકામડાવાળી સેનાનાં જ લગભગ એક લાખથી એ લાખ માણસો હશે, આકી નાનાથી મોટા અને ઓપુરુષ વિગેર સૌ મળાને જે ગણુની કરવામાં આવે તો લગભગ પાંચથી દસ લાખની સંખ્યા થાય.

‘અલ્રી હીસ્ટ્રી.’

\* આ પ્રદેશ તિણ્યતની ઉત્તર તરફ અને સિમકિયાંગની પદ્ધિમાં ખોતનની બરાબર નીચે આસપાસ આવેલો છે. જ્યાં ચુધશિ લોકો સૌથી પ્રથમ રહેતા હતા.

આ એ ચુદ્ધશિ અને વુ-સુન જાતિનો આ પ્રદેશમાં લેટો થયો. તે બન્ને વચ્ચે ખૂનખાર લડાઈ થઈ 'વુ-સુન' જાતિ નાની હોવા છતાં તેમણે સામનો કર્યો પણ પરિણુંને તે પ્રણ હારી ગઈ અને વુ-સુન જાતિનો સરદાર મરાયો.

'વુ-સુન' જાતિનો ઈલી ( Ili ) નાની કંઠાને પ્રદેશ ઘણો નાનો હતો. ચુદ્ધશિ લોકોનો બધાનો સમાવેશ અહીં થઈ શકે એવું નહોતું. એટલે તેમાનાં કેટલાક લોકો વિશેષ વિસ્તૃત અને ફળદૂપ સપાટ પ્રદેશની આશાએ આગળ ચાલ્યા.

ચુદ્ધશિના એ રીતે એ ભાગ-શાખા-થયા. તેમાં એક નાની શાખા નાના ચુદ્ધશિ-ક્રાંકિક કહેવાયા અને મેરી શાખા મેટા ચુદ્ધશિ-ક્રાંકિક કહેવાયા. નાની શાખા દક્ષિણ તરફ ચાલી. મેરી શાખા પશ્ચિમ તરફ ચાલી. તે તરફ ચાલતાં ચાલતાં તેઓ સ્તીરદરયા ( સીતા ) નાની કાંઠે પહોંચ્યા. ત્યાં વળી એક નવી જાતિનો તેમને લેટો થયો. તે લોકો સૈંક્રણીયાની હતા. પારસી લોકો તેમને 'સક' તરીકે ઓળખાતા હતા. યૂરોપ અને એશીયા ખંડની ઉત્તરમાં લટકતી જગતી જાતોને 'સિથિયન' નામથી ઓળખવામાં આવે છે. પારસીલોકો એજ અર્થમાં આ 'સૈ' લોકોને સક-વિસ્તૃત વિવેચન આગળ જોડુશુ-કહેતા હતા. એ સૈ લોકોના નાયક ને સૈ-વાંગ્ર કહેવાય છે. તે સૈ-વાંગ્ર ઉપર મેટા ચુદ્ધશિ લોકોએ હુમલો કર્યો. સૈ લોકો તીતર વીતર થઈ ગયા. તેમના સરદારે પોતે જ

\* We hear that the *Sai-wang* were, some time before 160 B. C., driven out from their old home by another tribe, the *Yue-chi*..... The *Yue-chi* were, in their turn, driven out by the *Wu-sun*, whose settlements have been defined by professor *Franke* as extending from *Urumchi* to the west of *Issik-kul*, from the *Dzungarian* desert and down towards the *Tarim*.

Here accordingly *Saka* tribes must have been settled in the beginning of the second century B. C., near the *Issik-kul*.

*Corpus...Indicarum. Vol. II,*  
*Pt. I, P. xix.*

એમ સમજય છે કે, ચ. પૂ. ૧૬૦ પહેલા સૈ-વાંગને તેના પોતાના રહેણાથુમાંથી ચુદ્ધશિ લોકોએ ભગડી મૂક્યો હતો અને ચુદ્ધશિ લોકોને વુ-સુન લોકોએ કાઢી મૂક્યા હતા. પ્રો. ફંકના કથન પ્રમાણે તે વુ-સુન લોકા ઉદ્મશીથી ધસિકુલના પશ્ચિમ લાગ સુંધી અને ડંગરીયાન ( Dzungarian )ના રણ્યથી તરીમના નીચેના લાગ સુંધી વસેલા હતા.

તે પ્રમાણે તો એમ અનુમાન થાય કે શકલોકા ધસિકુલની આસપાસમાં, લગલગ ચ. પૂ. ખીજ શતાબ્દિની શરૂઆતમાં, વરસા હતા.

ડા. સ્ટીનકોનો.

પોતાના સાથીએને વેર વિખેર કરી નાખ્યા. કોઈ મોટી ટોળીઓ તેણે સાથે રાખી નહીં. સૌ લોકો બધા અહીં તહીં વિખરાઈ ગયા. કેટલાક ખાકદ્વીયા તરફ ગયા અને સૌ-વાંગુ \*કિપિન-કપિશ-નામના દેશમાં ચાહ્યો ગયો. કિપિન-કપિશ કેટલાક વિકાનો કાશમીરને ગણ્યાવે છે. કેટલાક વિકાનો કંઘોજના ભાગને ગણ્યાવે છે. પણ કંઘોજને કપિશ કહેવો એ વધારે વાસ્તવિક છે.

આ સૌ લોકોના ત્રણ ખાસ લેહો છે. તે નણેના મોટાં મોટાં સંસ્થાનો હતા, ને તેમને વણુને જુદા જુદા નામોથી ઓળખાવવામાં આવતા.

( ૧ ) સકા ×તિથખૌદા—અર્થાતું અણુદાર ટોપી પહેરવાવાળા આ લોકો સીર-દરયા-નહીને કાંઠે રહેતા અને પાડોશના ખાકદ્વીયાના સૈનિકો સાથે જોડાઈને લશકરી કામ પણ કરતા હતા.

\* S. Levi identifies kipin with Kasmira. But his view has been ably controverted by Sten Konow who accepts the identification with Kāpisha. Gandhār was the eastern part of Kipin. Political History P. 293.

By Raychaudhuri

ડૉ. સિદ્ધવન લેવી કાશમીર દેશને કિપિન દેશ જણ્યાવે છે. જ્યારે ડૉ. સ્ટીન કોનો બહુ પ્રમાણું પૂર્વક તેમનાથી જુદા પડી કપિશ દેશને કિપિન તરફ ઓળખાવે છે. વળી ગંધાર એ કિપિનનો પૂર્વીય ભાગ હતો એમ પણ કહે છે. રાયચૌધુરી.

\* In the Persepolis inscription e 2 the Sакas are mentioned among the eastern countries, after Arachosia, India, and Gandhāra, and before the Makas.

In the Naksh-i-Rustam inscription a 3 we have another enumeration : Media, susiana, Parthia, Aria, Bactria, Sogdiana, Khorasmia, Zranka, Arachosia, the Thatagush, gandhāra, India, Sakā Haumavarkā, Sakā Tigrakhaudā, Babylon, Assyria, Arabia, Egypt, Cappadocia, Sparda, Ionia, Sakā tyaiy taradraya ( or paradraya ), Skudra, the Takabara Ionians, Puntians, Kushians, Maxyes and Karkians.

From these enumerations we can hardly draw any other inference than that there were several Saka tribes, and that they all belonged to the eastern parts of the Empire.

“ Corpus—Indicarvm. ” Vol. II,  
Pt. 1. P. xvii—xviii.

(૨) સકા હૌમવર્કા—તેમનો બીજો ભાગ આ નામે એળખાતો. આ લોકો પારસી પ્રાંત (સીસ્તાન) દ્રંગિયાનમાં રહેતા. આ પ્રદેશ હેલમન્ડ (Helmund) નહીનાં કાંઠા ઉપર છે. પાછળથી તે પ્રદેશ ‘સકસ્થાન’ તરીકે પ્રસિદ્ધ થઈ ગયો. પારસીઓ તેને ‘સિજિસ્તાન’ કહેતા. હાલ તેને ‘સીસ્તાન’ કહેવામાં આવે છે.

(૩) સકા તરદ્દરયા—બીજો ભાગ તરદ્દરયા સક તરીકે એળખાતો. તેઓ કારપીયન સી-સમુદ્રને કિનારે રહેતા હતા. સમુદ્રની ઉત્તરે તથા રશીયાની દક્ષિણે આવેલા પહીડી પ્રદેશમાં તેઓ રહેતા હતા.

તે લોકો પોતાના નાયકને સ્કૈ-વાંગ્ કહેતા હતા. અને સ્કૈ એટલે સક એ આપણે ઉપર જાણી લીધું. \*વાંગ્ એ ચીનીભાષાનો શણદ છે. તેનો અર્થ સ્વામી, સરદાર કે રાજ એવો થાય છે. અર્થાત સ્કૈ-વાંગ્ એટલે સકરાજ, સકસરદાર \* સકમુર્દન્ડ કે સકસ્વામી એ અધા એકજ અર્થવાચક શણાંતરે છે.

ઉપર આપણે જોઈ ગયા કે આ સ્કૈ-વાંગ્ પોતાના માણસોને અને લશકરને વેર વિભેર કરી કપિશ-કિપિન દેશમાં ચાલ્યો ગયો. બીજી લોકો બાક્ટ્રીયા તરફ ગયા. ત્યાં તાહીયા લોકો રહેતા હતા. તેમની સાથે આ લોકો પણ વસી ગયા.

પેલી તરફ ચુદ્ધશિ-ઝડપિક જાતિના લોકો માંડ પંદર વીસ વર્ષ સીરદરયા નહીને કાંઠે આરામથી વસી રહ્યા હતા તેમાં એક ઘનાવે તેમને વળી તે સ્થાન છોડાવવાની ફરજ પાડી. ઉપર વાંચી ગયા કે તે લોકોનાં એ ભાગ થયા પહેલાં તેમને લુસુન જાતિના લોકો સાથે લડું પડ્યું હતું. તેમાં લુસુન જાતિનો રાજ મરાયો હતો.

તે રાજ મરાયો તે પછી તેના પુત્રને હૂણુ લોકોએ હતક-ખોળે લઈ લીધો હતો. તેમણે તેને પાળી ચોણી માટો કર્યો. એજ છોકરાએ તેના પાલનહાર-રક્ષક હીયંગનૂ હૂણુ લોકોનો મદદ લઈને પિતાનું વૈર વાળવા છ. પૂ. ૧૬૦ માં ચુદ્ધશિ-ઝડપિક જાતિ ઉપર હુમલો કર્યો. તેમની સાથે ભારે લડાઈ થઈ. હૂણુ અને ચુદ્ધશિ લોકો તો પરાપૂર્વીથી હૃમનો હતાજ. હૂણોએ ચુદ્ધશિએને મારિને હૃતાયા. એટલે તેમણે સ્કૈ-સક લોકોના રહેડાણો. જે પડાવી લીધાં હતાં તે બધા ચુદ્ધશિએને આલી કરવા પડ્યા એટલે ત્યાંથી નિકળી ચુદ્ધશિ લોકો સીરદરયા-નહીની દક્ષિણ તરફ ચાલ્યા ગયા. ત્યાંથી ‘વંકુ (આસુ)’ નહીને પાર કરી બાક્ટ્રીયામાં આવી પડ્યાંન્યા.

\* Saka-murunda, Murund being a later form of a Saka word which has the same meaning as Chinese “wang,” i. e. master, lord. In Indian inscriptions and coins it has frequently been translated with the Indian word “Svamin.” *Political History, P. 292.*

બાક્ટ્રીયા એ તાહીયા લોકોનો હેશ હતો. તાહીયા લોકોની ત્યાં મોટી વસાહતો હતી. તાહીયા લોકો શાંતિપ્રિય બ્યાપારીઓ હતા. તેમની સાથે સકુલોકો પણ પડવો નાખીને રહ્યા હતા. તે અન્ને સાથે ચુઈશિ લોકોએ લડાઈ કરી. તેમને હશાંયા. ચુઈશિ-એના માર ખાવાથી વળી પાછા સ્કુલ ટોળાયો. વેર વિઝેર થઈને નાઠા, ને નવી વસાહતો શોધવામાં શુંથાયા. અને ચુઈશિએ ત્યાં તાહીયા લોકોની જમીન કણજે કરી તેમના પર સત્તા જમાવવા માંડી.

આ રીતે ચુઈશિ અને સૈ લોકોનું બાક્ટ્રીયામાં જોડાણું થયું. અને તાહીયા ઉપર સત્તા જમાવવી ચુઈશિ લોકો તેમના રાજ થઈ એડા.

તાહીયા લોકો ચીનની ઉત્તર સીમામાંથી બાક્ટ્રીયામાં કયારે, કેવી રીતે, ને શા માટે આચાયા તે તો ઈતિહાસથી ખાસ જાણી રહ્યાતું નથી. પણ એટલું તો નિશ્ચિત થઈ શકે છે કે તે લોકો. ચીનની મોટી પ્રસિદ્ધ દીવાલની શરૂઆત વખતે જેમ ચુઈશિ કે ફૂણું લોકોને ભાગવું પડ્યું હતું તેમ તેની સાથે સાથે આ તાહીયા લોકોને પણ ભાગવું પડ્યું હશે.

અતાહીયા લોકો સ્વાભાવિક રીતે એશ-આરાભી ને બ્યાપારી હતા, વળી સફય પણ હતા. તેમને લડાઈમાં ન રસ હતો ન ગૌરવ હતું. એટલે ચુઈશિ લોકોએ તેમના ઉપર સત્તા જમાવવા માંડી અને તાહીયા લોકોએ તેમનું આધિપત્ય બંધુ સરળ રીતે સ્વીકારી પણ લીધું.

ઐતિહાસિકોનું એમ પણ માનવું છે કે સુગંધહેશ તથા સીરદરદ્યા-નહીંને પેલે પાર ‘આસ્તિ’ ‘આસ્થિયાન’ ‘તુખાર’ ને ‘અસરોલ’ નામની જંગલી-કુરન્હી લટકતી

\* કાનસૂ સીમાન્તના જે પ્રદેશને, પ્રાચીન ચીની ઈતિહાસકારોએ તાહીયા કહ્યું છે. તેનું જ નામ સાતમી શતાબ્દીમાં જૌફ્યાત્રી ‘અવાન ચ્વાંગ’ ‘તુહુલો’ લખ્યું છે. અને આરથ લેખકોએ તેજ પ્રદેશને તુખારિસ્તાન તરીકે એળખાય્યો છે.

તે સાથે સાથે અવાન ચ્વાંગ વિગેર એ તાહીયા લોકાને જેમ શાંતિપ્રિય બ્યાપારી તરીકે એળખાય્યા છે તેવીજ રીતે મધ્યકાલીન ( લગ્ભાગ તેજ અરસાના ) આરથ લેખકોએ તુખારાને શાંતિપ્રિય બ્યાપારી તરીકે ખતાબ્યા છે.

એટલે વિચાર કરતાં એમ નક્કી થઈ શકે છે—ચીની લોકોનું ‘તાહીયા’ ‘અવાન ચ્વાંગનું’ ‘તુહુલો’ અને આરથ લેખકોનું તુખારિસ્તાન કે તુખાર લોકો એ ત્રણે એકજ પ્રદેશ અને એકજ જતિને બતાવનારા લિન લાખાના લિન શબ્દાંતરોજ માત્ર છે.

અર્થાત તાહીયા તુહુલો અને તુખાર એ Rice, ઓરન ને ચાવલ ની માફક એકજ વસ્તુ છે.

જર્મન વિદ્યાન માર્ક્યાર્ડ આ સિદ્ધાંત ઉપર સ્થિર થાય છે. અલખત કેટલાક વિદ્યાનો આ મન્તવ્યથી જુદા પડે છે. પરંતુ કેટલાક વિવરણ ને ઘટનાઓ ઉપર વિચાર ચલાયા પછી તે ત્રણે એકજ છે એ મંતવ્ય વધારે વાસ્તવિક ને યુક્તિયુક્ત લાગે છે.

જાતિઓએ યૂનાનીઓએ સાથે લડાઈ કરી તેમની પાસેથી બાકદ્રીયાનું રાજ્ય છીનવી લીધું હતું. તેને અનુકૂળ બીજી હકીકત એ મળે છે કે 'દીઓદોત' ને સરાઉચ ( Saraucae ) અને 'આસિયાન' ( Asiani ) નામની સંકળતિઓ સાથે લડાઈ કરવી પડતી હતી. અને તે જાતિઓએ છેવટે બાકદ્રીયા જીતી લીધું હતું.

વળી "આસિયાન વોકો, તો 'તુખારો' ના રાજ બની એડા, અને સરાઉચ ( saraucae ) વોકો નષ્ટ થયા. " એમ પણ ઉલ્લેખો મળી આવે છે.

હવે મેળવીએ કે—'આસિયાન વોકો તુખારવોકોના રાજ બની એડા' અને "ચુધશિવોકો, તાહીયાવોકોના રાજ બની એડા." તે બન્ને વાક્યોનો અર્થ બીજુકુલ એકજ છે. કારણુકે આસિયાન ને ચુધશિ એ બન્ને એકજ જાતિ છે. અને 'તાહીયા' અને 'તુખાર' એ બન્ને પણ એકજ જાતિ છે.

હવે આગળ વિચારીએ—ચુધશિ અને તુખાર એ બન્ને સંક જાતિ સાથે મળતી આવતી જાતિઓ છે. અને ભારતવાસી પ્રાચીન વોકોએ તો ચુધશિ જાતિને સંકળતિની અંતરગતજ ગણ્યાની છે. અલથત અમૃક વખત સુધી આ જાતિઓને મંગોલવર્ગની જાતિઓ ગણ્યવામાં આવતી હતી; પરન્તુ છેવટી શોધખોળને પરિણામે મધ્ય એશીયાવામાંથી તેમની પોતાની ભાષાના ભારતીયલિપિમાં લખેલા પ્રાચીન વેણો મળવા માંગ્યા ત્યારે એ સિદ્ધ થયું કે તે બધા સંક, તુખાર ને ચુધશિ વોકો આર્થવંશની જાતિઓ હતી.

વળી તાહીયા કે તુખાર વોકો 'તકલા-મકાન' ની દક્ષિણપૂર્વમાં રહેતા હતા અને પાછળથી બાકદ્રીયા સુધી પહેંચી ગયા હતા, પરન્તુ તેમની ભાષા અને વેણો તકલા-મકાનની ઉત્તર પૂર્વમાંથી પણ મળી આવે છે. તેથી એમ પણ સિદ્ધ થાય છે કે તેઓ નીયાનની અને ચર્ચાનનનીના કંઠા ઉપરથી ઉત્તર પદ્ધિમાં પણ વસેલા હતા. વળી ચુધશિ વોકોનો માર્ગ પણ એ હતોજ. એટલે તે વોકો આ તાહીયા વોકોમાં થઇને આવ્યા હોય અને તેમને પણ સાથે ઘસડતા આવ્યા હોય.

વળી ઉદ્ધગૂર-તુર્ક્વોકોએ સિમ્ર-કિયાંગ્ના રહેવાસીઓની ઉત્તર તરફ રહેનારી એક શાખાને જીતી લીધી ત્યારે તેમણે ત્યાંની પહેલી ભાષાને તુખારી ભાષા તરીકે વર્ણુવી છે. તે ભાષા તુખાર જાતિની હતી. વર્તમાન વિદ્ધાનોએ પણ તુખારજાતિના નામથી તે ભાષાને તુખારી ભાષા તરીકે સ્વીકારી છે.

તેનું તેમના લેખામાં આશીર્વાદ એવું નામ આપેલું છે. અને આશીર્વાદ આસિ કે આસિયાન સાથે સિધ્યા સંબંધ હેઠાએ આવે છે.

વળી જ્યારે આસિ અથવા ચુધશિ વોકો તુખારોના રાજ થયા હતા ત્યારે તેમનું

નામ ભાષા સાથે પણ જોડાઈ ગયું હોય એ તરફની સ્વાભાવિક છે. જેમ ગુજરાત ઉપરથી ગુજરાતી અને હિન્દુ ઉપરથી હિન્દી.

ચુહશિ લોકોની ભાષા વિષે ખીંચે પણ એક મતલેદ છે. કેટલાક વિદ્ધાનો એમ માને છે કે તે લોકો ઐતનદેશીભાષા બોલતા હતા. કેટલાક કહે છે કે તે લોકો તુખારીભાષા બોલતા હતા.

વાસ્તવમાં એ બન્ને વસ્તુ સત્યપ્રતીત છે. કારણું ચુહશિ લોકોના માર્ગમાં ઐતાનનો પ્રદેશ તો આવતોં હતો. અને તેથી તે લોકો ઐતનદેશીભાષા બોલતા હોય તો તેમાં આશ્ર્ય પામવા જેવું કશું નથીજ. અને તુખારલોકોના તો એ રાજની હતા એટલે તુખારીભાષા તેમની પોતાની ભાષા થઈ હોય તો તેમાં પણ કશું આશ્ર્ય પામવા જેવું નથી.

વળી ભારતના પ્રાચીન અંથો-પુરાણો માંતો ચુહશિ લોકોના રાજવંશને પણ તુખાર તરીકે વર્ણાવ્યો છે કારણું કે તુખારેમાં રહેવાથી અને તુખારેના રાજ બની જવાથી ચુહશિ-કંપિકુલોકોના રાજવંશને તુખાર કહેવો એ સાવ સ્વાભાવિક છે, પછી ભાષાનું તો કહેવું જ શું? વળી તે બધી આર્યભાષા જ હતી એ નિર્વિવાદ સત્ય છે.

આ બધા વિવરણ પછી એક સત્ય એ તરી આવે છે કે-ચુહશિ, કંપિક, અસિ, અસિયાન, ડિષિ, ચુશિ, સુ ( Su ), સૈ, સે ( Se ), સેક ( Sek ), સોક ( Sok ) તાહિયા તુહુલો, તુખાર, એ બધા લિઙ્ગ વખતના લિઙ્ગ લોકોને મુખેથી નિકળેલા, બોલાયલા પ્રચાર પામેલા પણ એક જાતિના વાચક શરૂદાન્તરે છે. અને તે બધા ‘સક’ જાતિના નામાન્તરે છે. તેમનું મૂળ સ્થાન ચીનના \*ઉત્તરી ભાગમાં હતું, અને ધીમે ધીમે તેઓ ફરતા ફરતા સીસ્તાન સુધી આવી પહોંચ્યા હતા.

\* Scythians, whom the Greeks knew by the vague general name of ‘Saceae,’ who may be identified pretty certainly with the ‘Saka’ of the Indian writers ; and the ‘Su,’ ‘Sai,’ ‘Se,’ ‘Sek,’ or ‘Sok’ of the Chinese annalists.”

Bactria P. 92.

શ્રીકલોકા સિથિયન લોકોને સામૃહિક રીતે સકા (sacae) નામથી એળખતા. જ્યારે હિન્દના લોકો નિશ્ચિતરૂપે તેમને સક કહેતા; અને ચીના વિદ્ધાનો તેમને ‘સુ’ ‘સૈ’, ‘સે, સેક’ કે ‘સોક’ તરીકે એળખતા.

\* ... Produced a general condition of unrest among the tribes inhabiting the northern fringe of the deserts of Chinese Turkestan.

Cambridge History of India p. 565

સમય જતાં આ યુઈશિ-સક લોકોએ પોતાની જંગલી રીતલાતો પણ છોડવા માંડી, નરીની ઉત્તરના ફળદુષ પ્રદેશમાં એતી કરીને પોતાના લુવન નિર્વાહના માર્ગો શોધ્યા, તાણીયા જલિના સમાગમથી શિષ્ટ રીતલાત ને નિયત્રણ તેમજ વ્યવસ્થાપૂર્વક રહેવાનું પણ અપનાવી લીધું, અને એ રીતે એ એક પેઢીમાં તો તે લોકોએ વ્યવસ્થિત અની સામાજિક ને રાજનૈતિક બંધારણો પણ મુકુર કર્યું.

આ અરસામાં તો તેમણે પાંચ જુદાં જુદાં સંસ્થાનો પણ સ્થાયાં, આ સંસ્થાનો હિન્દુકુશની ઉત્તરમાં આવેલાં હતાં.

તેમાં અનેક નાનામોટા કુળો હતાં. તેમાં કુશાન\* કુશમાં એક બળવાન પુરુષ થયો, તેણે પોતાના બાહુભળ ને મગજશક્તિથી પાંચ સંસ્થાનોનાં રાજ્યોને એક સૂત્રમાં બાંધ્યા, પોતે બધાનો ઉપરી થયો, અને તે આપી સક પ્રણનો સાનાટ કહેવાયો હતો. તેનું નામ કડ્ફિસેસ-કફ્સ ( Kadphises ) હતું.

### શકેનું કંબોજ પર આકુમણુ—

એતો પહેલાં જ કહેવાઈ ગયું કે—તુખાર, ઝડધિક કે યુઈશિ એ એકજ સક જલિના લેદો નામાન્તરો છે. તેમની રાજધાની બદખાંમાં હતી. બદખાં પામીરપ્રદેશમાં હતું.

આ પામીર બદખાં અને બલખ મધ્યકાળ સુધી તુખાર અથવા તુખારિસ્તાન કહેવાતાં હતાં. અર્થાતું પ્રાચીન કંબોજ અને વાલિક દેશોમાં ઝડધિક-તુખારોએ લગભગ છ. પૂ. બીજી શતાબ્દિની મધ્યમાં જ આકુમણુ કરી દીધું હતું, કંબોજ તે વખતથી જ તુખારિસ્તાન અની ગયું હતું, કારણ કે તુખારોની રાજધાની બદખાંશહેર તુખારિસ્તાનમાં ગણ્યાયું છે.

The well-known tribes which, according to Strabo, deprived the Greeks of Bactriana, viz., the Asii, Pasiani, Tochari, Sacarauli and the sacae or Sakas.  
*Political History, P. 288.*

In the second and first centuries B. C., Greek rule in parts of kafiristan, Gandhara and the Hazara country (?) was supplanted by that of the sakas.  
*Political History, P. 292.*

Sakas came to Sistan about the end of the second century B. C..."  
"corpus...Indicarvms." Vol. II,  
Pt. I, P. xvii.

\* તુખાર પણ તેમતુંજ નામ છે.

બાક્ટ્રોયા એ પ્રથમ યવન રાજ્ય હતું, તેને સક્રિયા-ગ્રંથિક તુખારોએ નષ્ટ કરી દીધું હતું. એ ઘટના ઈ. પૂ. ૧૬૦માં થઈ. જ્યારે ઈ. પૂ. ૧૨૮-૨ સુધી ચુદ્ધિશિલોકો વંશુ નહીની ઉત્તર તરફ હતા, તે વખતે બાક્ટ્રોયા તો તાહીયા જની ગણું હતું. એટલે કે યવનરાજ્ય તો ધણા વખત પહેલાં જ સમાસ થઈ ચૂક્યું હતું. અને તે પછી તરતજ ગ્રંથિકોએ વંશુનહીનો પ્રદેશ કરી લીધો હતો.

એ પ્રસંગ પછી—અર્થાત્ યવનરાજ્ય તૂલ્યા પછી યવનોને ભારતવર્ષમાં આવવાનું કારણ બન્યું હોય તો તે તદ્દિન સ્વાભાવિક છે. સાથે સાથે યવનોને જેમ ભારતમાં આવવાનું કારણ મળ્યું હોય તો યવનોએ પંજાબના માલવ ને શિવિ લોકો ઉપર હુમલા કર્યા હોય, પરિણામે તાહીયા લોકોના હુમલાથી જેમ યવનોને ભારતમાં લાગી આવવાની કરજ પડી હોય તેમ યવનોના હુમલાથી પંજાબના માલવ અને શિવિલોકોને પંજાબમાંથી ઉજાજૈન તરફ ભાગવું પડ્યું હોય.

તો તો એમ કહેવું જોઈએ કે—કાનસુ પ્રાંતથી જે જાતિની ઉથલપાથદ ને સંધર્ષથું શરૂ થયા તેના આધાત પ્રત્યાધાત અને અસર ભારતવર્ષમાં ઠેડ ઉજાજૈન સુધી પહેલાં કારણ કે માલવ ને શિવિ લોકો પંજાબમાંથી લાગીને ઉજાજૈન—અવન્તિ પ્રદેશમાં આવ્યા.

થીણ તરફ એજ ઉથલપાથદના કારણે સ્વીરદરથા—નહીને કંઠે રહેનારા સક્રિયાને પણ ભાગવું પડ્યું ( મિશ્રદાત થીજના વખતમાં ) અને છેવટે તો તેમને પણ જૈનાચાર્ય કાલકસ્તુરિ સાથે ભારતવર્ષમાં સિન્ધુ—સૌવીર ને સૌરાષ્ટ્રમાં ક્રીને ઉજાજૈન સુધી જવું પડ્યું છે જ અર્થાત્ એ બન્ને જાતિએ પાછી ત્યાંના સીમાઓમાં આપસમાં ટકરાઈ.

અર્થાત્ ચીનની દીવાલ બંધાવાથી જે લોકોને ટજીર લાગી તે લોકો એ ભાગમાં વહેંચાઈ જઈ તેજ બન્ને સાતાવહનના રાજ્યની સીમામાં આવીને લરાણી અને ત્યાં બન્નેએ લેગા થઈ પોતાનું જેર અજમાઓયું.

### શકલોકોની પાર્થીવ રાજ્ય સાથે લડાઈ—

ઉપર આપણે જોઈ ગયા કે સ્વીરદરથા—નહીને કંઠે સકોનો રાજ સૈ-વાંગ કિપિન-કુપિશ-કંધોળ દેશમાં લાગી ગયો હતો. તેના સગાસંખ્યી-કુટુંભીએ બધા છિન્નલિન્ન શીર્ષુવિશીર્ષુ થઈ ગયા હતા, બાક્ટ્રોયામાંથી પણ તેમને લાગી જવું પડ્યું હતું. તેઓ ત્યાંથી લાગીને હિન્દુ-કુશ પાર કરી ભારતમાં ન આવ્યા એટલે કાણુલ-હુનનું યવનરાજ્ય અચી ગણું.

યવનરાજ્ય હિંદમાં પણ તે વખતે આવી ગયું હતું. ચુદ્ધિ પ્રજાના કુશાનકુળના પુરુષે રાજ્યસ્થાપના કરી તે પહેલાં બાક્ટ્રોયા અથવા ભલાખના યવન અને પાર્થીયા અથવા પશીયા ના પાર્થીવ અથવા પહ્લ્લવ હિંદમાં ધણા જૂના વખત થયા રાજ્યકર્તા

થઈ ગયા હતા. અલખત બાકુટીયાના યવનલોકેનું રાજ્ય પડતી દશામાં હતું, પણ પાર્થીવ કે પદ્મલવનું રાજ્ય તો બરાબર ટકી રહ્યું હતું.

સૌ-વાંગ કિપિન-કપિશ, કાફિસ્તાન અથવા ગન્ધારમાં નાશી ગયો હતો. અને ચુદ્ધશિશ્ચાચે સ્કેનાં ટોળાંને તાહીયાના પ્રદેશમાંથી કાઢી મૂક્યા હતા. તે પછી સ્કેનાં ત્યાં રખડતા હતા પણ તેઓ ભારતમાં આવવાને બાદ્યે લુંટશાટ કરતા નૈર્દ્ય દક્ષિણ-પશ્ચિમમાં હેરાત તરફ અને ત્યાંથી પોતાના જૂના મુલક સીસ્તાન-જયાં પ્રાચીન સકલોકે રહેતા-તે તરફ જવા લાગ્યા. પણ સીસ્તાન તે વખતે પાર્થીવ રાજ્યના તાખામાં હતું. એટલે સકુનાં ધાડાંઓને રોકી તેના ઉપદ્રવથી પ્રલાને બચાવવા પાર્થીવ રાજ્યને સક ટોળાંઓ સાથે ધાર્ષી લડાઈઓ લડવી પડતી. સકુનાં આ ધાડાંઓના પ્રવાહને ખાણી રાખવા ને અટકાવવા માટે લગીરથ પ્રયત્નો કરવા પડ્યા. એ પ્રયત્નો કરતાં કરતાં પાર્થીવ-રાજ ઝ્રાવત બીજો ધ. પૂ. ૧૨૮ માં મરાયો.

તે વખતે આ સકલોકે તો લુંટશાટ કરતા, સ્થાયી રહેકાણું-મુલકની શોધમાં-શીકરમાં હતાજ પણ સાથે તેજ વખતે ચુદ્ધશિશ્ચાંતો પણ તેજ દશા હતી. તેઓ પણ લુંટશાટ કરતા રખડતા હતા. જયાં આવે ત્યાં ધાડાઓ લઈ જતા એટલે પાર્થીવ રાજ્યને તેમની સાથે પણ લડવું પડતું.

ક્રાવત બીજો સકુના ટોળાંઓ સાથે લડતાં લડતાં મરાયો. તેની ગાદીએ અર્તભાન આવ્યો. તે તુખાર-ચુદ્ધશિશ્ચાંતો કોણાના ધાડાને ખાળવામાં ને અટકાવવામાં રોકાયો. એ તકનો લાલ લઈ બીજું તરફથી સ્કેનાં તેના રાજ્યમાં ધુસ્યા. લુંટશાટ કરી દેશને જોદાન મેદાન વેરાન ઊજજડ કરી મૂક્યો. ને છેવટે તેઓ સીસ્તાનમાં પાછા આવી ગયા.

આ તરફ રાજ અર્તભાન તુખારો-ચુદ્ધશિશ્ચાંતો સાથે લડતાં લડતાં હાથે ધવાયો ને તરતજ મરણ પામ્યો. ( કદાચ હથિયાર જેશીલું હશે. ) ધ. પૂ. ૧૨૯ માં તે મરાયો.

અર્તભાનની ગાદીએ તેના ઉત્તરાધિકારી તરીકે તેનો પુત્ર ભિશ્રદ્ધાત બીજો ગાદીએ આવ્યો. તે વખતે આન્દું બાળુના પ્રદેશમાં સકલોકેનાં થાણુંઓ જયાં ત્યાં પડ્યાં હતાં. તે થાણુંના સરદારો પાર્થીવ કે યવન રાજની સૂખેદારી પણ કરતા.

**ઇરાની અથવા પારસ્પી લાખામાં સૂખેદારીને સત્રપી કહે છે. ને સૂખાને ×સત્રપ**

× યથાપિ ક્ષત્રપ શબ્દ સંસ્કૃત કા સા પ્રતીત હોતા હૈ, તથાપિ વાસ્તવમે યદુ પુરાને ઇરાની “ક્ષત્રપ-પાવન” શબ્દકા સંસ્કૃતરૂપ હૈ। ઇસકા અર્થ ‘પૃથ્વીકા રક્ષક’ હૈ। ઇસ શબ્દકે “ખતપ” ( ખતપ ) “છત્રપ ” ઔર “છત્રવ ” આદિ પ્રકૃત રૂપ ભી મિલતે હોયાં। ઉત્તરી ક્ષત્રપ લોગ ‘પાર્થીવ ’ ( પાર્થીયન ) રાજાઓ કો અપના સમ્રાદ યા અધીધર માનતે થે; ઔર ઇસી લિએ વે “ક્ષત્રપ ” ( અર્થાતિ સમ્રાદ કે સૂખેદાર ) કહલતે થે।

બૌદ્ધકાળીન ભારત પૃ. ૨૮૫

કહે છે. લખકરમાં ભરતી થવા ઉપરાંત કોઈ રાજ્યમાં સ્થાનિક ખાતે પણ તેઓ નાના નાના જમીનહારો તરીકે થઈ ગયા હતા. દરેક થાણુનો આ સરદાર કે જમીનહાર તે 'સાહી' કહેવાતો હતો.

સીસ્ટાનમાં સ્થિર થયા પણી તેઓ પાર્થીન સાથેની અથડામણે છોડી ફર્જ નિયંત્રણ અને બંધારણમાં શાંતિપૂર્વક એક પ્રણ તરીકે રહેવા લાગ્યા. પાર્થીન અથવા પહુલવ બોકેના આચાર વિચાર રીતભાત અથવા સંસ્કૃતિનો મોટો ભાગ તેમણે સ્વીકારી લીધ્યા હોતો.

**મિશ્રદાત** ધીજના વખતમાં આ સંકુલોકો-સાહીઓના થાણા ધણું જામી ગયા હતા. લગલગ તેઓ બધાં મળીને ૬૬ સાહીઓએ હતા.

પરન્તુ મિશ્રદાત બહુ બળવાન અને પરાક્રમી રાજી હતો. તેણે પોતાના કાળ્યું નીચેના આ બધા સાહીઓને ખૂબ દબાવ્યા, સાથે સાથે પોતાના રાજ્યની સીમા પણ ખૂબ વધારી. ધણું ફર ફરના પ્રદેશો ઉપર પોતાની આણ વર્તાવી, ફુરમનોને મારીને ઊર કર્યો. સંકુલ-સાહીઓના વેરને પણ તે ભૂલ્યો ન હતો. ભૂતકાળમાં સંકુલોળાંઓએ પહેંચાડેલું તુકશાન અને તેના પિતાનો સંહાર તેમા સમરણ બહાર ન હતો, તેણે એનો સારી રીતે બદલો લીધ્યો.

તેણે પોતાના અતુલ પરાક્રમથી "રાજ્યરાનેશ્વર"- " \*ક્ષાયધિયાનાં ક્ષાયધિય " ની ઉપાધિ ધારણ કરી. આ પદવી પાર્થીનરાજીઓમાંજ પહેલા શરૂ થઈ અને તે મિશ્રદાત ધીજનો પોતાના રાજ્યકાળમાં ચાલુ કરી.

\* Cor. Ins. India Pt. I. P. xxI.  
Palitical History of A. India. D. 351.

## શકલોકોનું ભારતમાં આગમન.

ઇ. સ. પૂ. ૧૨૭ ની આસપાસ ભારતવર્ષમાં ઉજાજૈનમાં ગર્દ્બિલ્હુ રાજ ગાઠી નથીન હતો. શક લોકો પણ આજ અરસામાં ભારતવર્ષમાં આવેલા છે. તે શામાટે ને કયે રસ્તે ભારતમાં આવ્યા તે આપણે આગળ વિચારીશું.

### નૈનોમાં કાલકાચાર્ય ને જ્યોતિર્ધર કાલકાચાર્ય.

નૈનોમાં કાલકાચાર્ય તો ત્રણુ ચાર કે પાંચ થયા છે. પ્રસ્તુત આચાર્ય નેમનો ગર્દ્બિલ્હુ સાથે સંબંધ છે, તેમનો સમય ઇ. સ. પૂ. બીજુ શતાખ્દીની મધ્યમાં અર્થાત् વીર સં. ઓથી શતાખ્દીની વચ્ચમાં ગણ્યાનો જોઈએ.

જ્યારે ગર્દ્બિલ્હુ રાજ ઉજાજૈનની ગાઠી ઉપર હતો. તે વખતે નૈન આચાર્ય કાલકસૂરિ પણ ઉજાજૈનમાં આવી ચઢ્યા. તેઓ પણ જ્યોતિરશાસ્કના પ્રખર વિદ્ધાનુ ગણ્યાતા. તેમનો ત્યાં સારો પ્રકાશ હતો.

તે વખતે કાલકસૂરિની જ્ઞાન સરસ્વતી સાધી પણ વિચરતી વિચરતી ઉજાજૈન આવી. તે યુવતિ અને સ્વરૂપની હતી, એક વખત સાધીએ સાથે તે શહેર બહાર ગયેલી; તે વખતે ગર્દ્બિલ્હુ પણ ઉપવનમાં નિકળ્યો હતો. તેણે તેને જોઈ, ગર્દ્બિલ્હુ રાજએ તેને પેતાના અંતઃપુરમાં લાવી મંગાવી. ઉજાજૈનમાં હાહાકાર થઈ ગયો. કાલકસૂરિએ અને નૈન સંઘે ગર્દ્બિલ્હુ

રાજને ખૂબ સમજાવ્યો, મનાવ્યો, પરન્તુ રાજી ન માન્યો. તે વખતે કાલકસ્તુરિએ શુસ્સામાં આવી \*પ્રતિજ્ઞા કરી કે “ રાજ ગર્દભિદ્વલને અને તેના રાજ્યને ઉખાડી સાથ્વી સુરસ્વતીને છોડાતું નહીં તો હું હુર્ગતિનો ભાગી થઈ.” આવી લીખે પ્રતિજ્ઞા કરીને આચાર્ય કાલકસ્તુરિ ઉજાળૈનથી ચાલી નિકળ્યા. તેઓ †પારસ્કૃત પ્રદેશમાં પહોંચ્યા. ત્યાંના રાજ “ સાહી ”

\* ..... કોપેન સન્ધાર કુરુતે સુનીશા: ॥ ૧૯ ॥

યે પ્રત્યનીકા જિનશાસનસ્ય, સંઘસ્ય યે ચાશુભર્વણવાચઃ ।

ઉપેક્ષકોદ્ભાહકરા ધરાયાં, તેષામહં યામિ ગર્તિ સદૈવ ॥ ૨૦ ॥

યદેનમુર્વાપતિગર્દમિલં, કોશેન પુત્રા: પ્રબલં ચ રાજ્યાત્ । નોન્મૂલયામીતિ કૃતપ્રતિજ્ઞો વિધાય વેષં ગ્રહિલાનુરૂપમ् ॥  
કાલકાચાર્યકથા પૃષ્ઠ ૮૫-૬.

..... ઉપાયેનોન્મૂલયિષ્યન् શક્કુલં યયૌ ગુરુ: ॥ ૨૩ ॥

યે સ્યુસ્તત્ર ચ સામન્તા: તે સાખ્ય ઇતિ સ્મૃતાઃ । તેષાં તુ નૃપતિ: સાખાનુસાખીરિતિ વિશ્રુતઃ ॥ ૨૪ ॥  
આચાર્યસ્તસ્તિયાંસ્તત્ર સાખેરેકસ્ય સંજીધૌ । મન્ત્રયન્ત્રપ્રયોગાદૈ: તં ચાત્યન્તમરજ્યત્ ॥ ૨૫ ॥

X            X            X            X            X            X

‘ કાલકાચાર્ય જિનદેવીય ’ કથા પૃષ્ઠ ૯૦

† પારસ્કૃતને વિષે ધતિહાસમાં ખાસ કરોને વૈન અનુશુટિમાં ધણેણ મતભેદ છે. સંસ્કૃત-પ્રાઇતિ-ભાષામાં લખાયલી જુદી જુદી વૈન પ્રતોભાં ‘ પારસ્કૃત ’ ના જુદા જુદા નામો આવે છે. ડોઝ રથણે શક્કુલ, શાખીદેશ, પશ્ચિમપાર્શ્વકુલ, પારસ્કુલ, પારિસ્કુલ, સગ્કુલ, સિન્ધુજનપદ વિગેરે વિગેરે નેમણે—

શાખીદેશ—“ શાખીદેશાશ ” તત્ત્વાસ્તિ રાજાનસ્તત્ર શાખય:

પ્રલાવક્યરિત્ર કાલકપ્રથાં ॥

શક્કુલ—

અહ સૂરિ ‘ સગ્કુલે ’ વચ્ચ ઇગસાહિણો સમીવંચિ

કાલક કથા.

ઉપાયેનોન્મૂલયિષ્યન् ‘ શક્કુલં ’ યયૌ ગુરુ:

કાલક કથા.

પાર્શ્વકુલ—

શુલ્વેતિ સૂરીર્ગત એવ સિન્ધો-ર્ન્યાસ્તાં પશ્ચિમપાર્શ્વકુલમ् ।

કાલક કથા ( જિનદેવ )

સિન્ધુદેશ

કોહકંતો કાલિગજો તથો વિહારં કિચા સિન્ધુજણવયં પતો

હિમવંતથેરાવલિ

આમ પારસ્કૃતના અનેક નામાંતરો ભણે છે, અને તે બધા મારો દાખિએ હંગિતશબ્દે। વધ-રાયલા છે. નેમણે ‘ સાહી ’ ઉપરથી ‘ સાહી દેશ ’ ‘ સાખીદેશ ’ કે ‘ શાખીદેશ ’; ‘ દ્વારસ ’ ઉપરથી ‘ પારસ્દેશ ’, ‘ પાર્શ્વકુલ ’ કે ‘ પારિસ્કુલ ’; ‘ શક્ક ’ ઉપરથી ‘ શક્કુલ ’ કે ‘ સગ્કુલ ’ વિગેરે.

ન \*“ સાહાનુસાહી ” કહેવાતા હતા. કાલકસૂરિ એક સાહીને ત્યાં રહ્યા અને જ્યોતિષ વિગેરેથી તેને પ્રસન્ન કર્યો.

એક વખત ‘ સાહી ’ ઓના વડા + ‘ સાહાનુસાહી ’ એ સાહીઓ ઉપર ગુસ્સે થઈ બધા સાહીઓને એકેક કટાર મોકલી અને તેના ઉપર લખ્યું કે “ આ કટારથી તમારાં માથાં કાપી મારી પાસે મોકલવાનો ” સાહીઓ આ આદેશથી સુંઘાણું. આચાર્ય કાલકસૂરિ ખુલું ચતુર હતા અને તે વખતે ત્યાં હતા. તેમણે આ બનાવનો લાલ લેવા ચાદ્યો. કાલકસૂરિએ આ વાત જાણી તેમણે સાહીને સમજળવ્યો કે તમારે નિર્યાર આત્મધાત શામાટે કરવો જોઈએ? તમે બધા મારી સાથે ચાલો, આપણે ભારતવર્ષમાં હિંદુગદેશ તરફ ચાહ્યા જઈએ. તેણે બીજા બધા સાહીઓને લેગા કરી કાલકસૂરિનો સંદેશ સંભળ્યો. સૌ સર્બત થયા અને તે કુલ છન્ન-૬૬ સાહીઓ એક સાથે જ્યોતિર્ધર

સાથે સાથે “ કુળ ” શબ્દ માટે પણ ધણો મતનેદ છે. અમૃત વિદ્વાનો દીર્ઘ ઉકારવાનો “ કુળ ” શબ્દ વાસ્તવિક માની તેનો “ કિનારો ” એવો અર્થ કરે છે જ્યારે પ્રાચીન પોથીઓમાં-પ્રતોમાં કુળ શબ્દ મોટે બાગે હુસ્વ ઉકારવાનો મળે છે.

મારી માન્યતા પ્રમાણે તેમાં કોઈ એક જ વિચાર નિશ્ચિત કરવો બાળભી નથી, તે બન્ને કુળ શબ્દો ઠીક છે. કોઈ રથે દેશવાચક શબ્દ સાથે ‘ કુળ ’ શબ્દ દીર્ઘ ઉકારવાનો ઉપયુક્ત છે. જેમણે ‘ પારસકૂળ ’ કારણું અહીં કિનારા વાચક ‘ કુળ ’ શબ્દનો સંબંધ યથાર્થ છે. પારસહેશ અને કૂળ=દૂરીયા કિનારો; બલ્ક અહીંયા પારસકૂળ શબ્દ અસંગત થઈ પડે છે.

જ્યારે ‘ શક ’ કે ‘ સાહી ’ એ બ્યક્તિવાચક શબ્દો ગણી શકાય. એટલે કે જે બ્યક્તિ વાચક શબ્દ ‘ શક ’ કે ‘ સાહી ’ કેવામાં આવ્યા હોય તો સમૂહ-જાતિવાચક ‘ કુળ ’ શબ્દ તેની સાથે ઉપયુક્ત ને યથાર્થ ગણ્યાય. ‘ સાહીકુળ,’ ‘ શકકુળ ’ વિગેર. ઉદ્દુ બ્યક્તિવાચક શબ્દ સાથે કિનારાવાચક શબ્દનો મેળ અણુધટતો થઈ પડે છે. એટલે કે દેશવાચી શબ્દ સાથે કિનારાવાચક ‘ કુળ ’ શબ્દ અને બ્યક્તિ વાચક શબ્દ સાથે સમૂહ-જાતિવાચક ‘ કુળ ’ શબ્દ લગાડવામાં આવે તો ઉપયુક્ત અર્થો મળી આવે; ‘ પારસકૂળ ’ અને ‘ સાહીકુળ ’ એ બન્ને શબ્દો લેવાથી અર્થ તો એજ નિકળે છે કે આચાર્ય કાલકસૂરિ સિંહ નદીને પાર કરી પારસકૂળ—ફારસહેશમાં ગયા, ત્યાં સાહી સાથે રહ્યા અને તેમના ઉપર પ્રલાવ પાડ્યો.

\* રાજાઓનો રાણ, રાજરાજેશ્વર, રાજધિરાજ, શહેનશાહ.

+ આ સાહાનુસાહી તે મિથ્યાદાત બીજે પાથ્યવરાન હતો. તે અર્થાત્યાન રાજાનો ઉત્તરાધિકારી હતો. તેણે પોતાના પિતાનું વેર વાળવા શક લોડાનું નિકંદન કાઠવાની યુક્તિ રચી હતી. તે એટલો બધો પરાક્રમી હતો અને સાહીઓને એટલા સત્તવીન બનાવી મુક્યા હતા કે ૬૬ સાહીઓ પણ તેની સાથે માયુ ઉચ્ચકી શકયા ન હતા. તેણે આ કટાર મોકલીને પિતાનું પૂર્ણ વેર વાલ્યુ. તેનો ધરાદો તે બધાને નષ્ટ કરવાનો હતો, પરન્તુ આચાર્ય કાલકસૂરિએ તેમને બધાને સાથે લીધા, ને તેમના તારણુંથાર અન્યા.

આચાર્ય કાલકસૂરિના નેતૃત્વ નીચે ભારતવર્ષ તરફ ચાલ્યા. કાલકસૂરિ તેમના સૂત્રધાર બન્યા. તેઓએ સિનંધુ નહી પાર કરી ભારતમાં પ્રવેશ કર્યો.

તેમના ભારત પ્રવેશ સંખ્યાં કેટલોક મતલેદ છે. મુનિરાજ x શ્રીકલ્યાણવિજયાળ એમ માને છે કે તેઓ પારસ્પરથી સમુદ્ર માર્ગે સૌરાષ્ટ્રમાં આવ્યા. પ્રાચીન પ્રતોભાં લખાયું છે કે સિનંધુ \*નહીને પાર કરી તેઓ થીન રાખ્યો ઉપર વિજય કરતા કરતા સૌરાષ્ટ્રમાં આવ્યા છે. જ્યારે થીન ઈતિહાસકારો એમ માને છે કે તેઓ સિનંધુ નહી પાર કરી સિનંધુમાં થઈને સૌરાષ્ટ્રમાં આવ્યા છે.

મુનિરાજ કલ્યાણવિજયાળનો મત સ્વીકાર કરવામાં આવે અને સમુદ્રમાર્ગે સૌરાષ્ટ્રમાં શક્કોકેનું આગમન માનવામાં આવે તો તેઓ સિનંધુમાં ક્યારે ગયા? ત્યાં વાસ ક્યારે કર્યો? હિંદુ શક્કસ્થાનની સ્થાપના ક્યારે કરી? વિગેરનો મેળ બેસી શકે નહીં. વળી શક્કસ્થાનની સ્થાપના તો ઈ. પૂ. ૧૨૦-૧૫ ની અંદર થયાનું માનવામાં આવે છે અને શક્કોકેનું ભારતમાં આગમન ઈ. પૂ. ૧૨૩ ની આસપાસ મનાય છે. એટલે કે ભારતમાં આવ્યા પછી તરતા લગલગ હિંદી શક્કસ્થાનની સ્થાપના કરી છે અને સૌરાષ્ટ્રમાં તો ૧૧૫-૧૦ ની અંદર આવ્યા છે.

x સબકે સબ અપને-અપને સ્થાનસે ભાગકર હિન્દુસ્તાનકી તરફ રવાના હુએ। ઇસ પ્રકાર ચિયાનબે સાહિ સમુદ્રમાર્ગસે સૌરાષ્ટ્ર ( કાઠીયાવાડ ) મેં આએ।

મુનિ કલ્યાણવિજયજી  
‘ દ્વિવેદી અમિનન્દન ગ્રંથ ’ પૃ. ૯૮

\* ઉત્તીર્ણ સિનંધું કટકં ચુરાષ્ટ્રા-દેશે સમાગમ્ય ચુખેન તસ્યૌ  
“ કાલકાચાર્ય કથા. ”

.....સમ્ભૂય સાસ્વય: સદ્ય: સિનંધુતીરે સમાગમન ॥ ૩૭ ॥

આચાર્યદર્શિતપથ: સાસ્વીશ: સોડપિ સત્વરમ । પ્રયાળૈરનવચિછૈરપસિનંધુ સમાસદત ॥ ૩૮ ॥

તેઽથ સિનંધું સમુત્તીર્ય, સાધ્યન્તોડખિલાન્નૃપાન્ ચુરાષ્ટ્રવિષયં પ્રાપુ-સ્તત્ર પ્રાચ્છદ્યેણુંથી ॥ ૩૯ ॥

કાલિકાચાર્ય કથા ( જિનદેવ )

વજ્ઞા હિન્દુગદેસે.....

જાવ ઉત્તરિતુ સિનંધું પત્તા સોરઢુમણલં તાવ

*The Story of Kalaka ( Brown ) P. 94.*

ઉત્તરિં સિનંધુની કમેળ સોરઢુમણલે પત્તા !

*The Story of Kalaka ( Brown ) P. 74.*

They crossed the river Indus and in time, came to the land of Saurashtra.

*Dr. Brown P. 81.*

થીને વિરોધ એ આવે છે કે-સૌરાષ્ટ્રમાં આવ્યા પણી તેઓ સિધા સિધમાં ગયા નથી. તેઓએ દક્ષિણ ગુજરાતમાં થતા ગુજરાતના રાજોની મહદ લેતા લેતા ઉત્ત્રાષ્ટ્રન ઉપર ચડાઈ કરી ગર્દિલિંગને હરાયો છે. ગર્દિલિંગને હરાયા પણી તેઓ સિધમાં ગયા હોય અને શક્ષસ્થાનની સ્થાપના કરી હોય એવું ઇતિહાસમાં નથી.

એટલે માનવું પડશે કે તેઓ પારસ્કૃણ-ક્રારસમાંથી સાહીએ સાથે સમુદ્રમાર્ગે સૌરાષ્ટ્રમાં નથી આવ્યા પણ સિન્ધુ નહીને પાર કરી છ. પૂ. ૧૨૭ ની લગભગ સિન્ધુમાં ઉત્તર્ય અને ત્યાંથી કુચળ્યમાં થઈ સૌરાષ્ટ્રમાં આવ્યા.

### હિન્દી શક્ષસ્થાન—

સિન્ધુ નહીને પાર કરી હિન્દની વાયોય સરહદમાંના પ્રાંતમાં થઈ તેઓ મથમ સિધમાં આવી અટક્યા. એ અરસામાં ત્યાં કોઈ મોટી રાજ્યસત્તા નહીંતી. નાના નાના યવન રાજ્યો-જમીનદારો અને લોકસંધની સત્તા સામાન્યરીતે પ્રવર્તતી હતી. તે જમીનદાર યવનોને અને સ્વતંત્ર જનસમૂહોને આ શક્ષલોકોએ દણાવી, તેમના ઉપર શક્ષસરદારોએ પોતાનું આધિપત્ય જમાઓયું અને તેમાંના કેટલાક સરદારો અહીંના સત્તાધીશ થઈ એઠા, એટલું જ નહીં તેમણે તે સ્થાનને “ભારતીય શક્ષસ્થાન” એવું નામ પણ આપ્યું. આ સ્થાપના છ. પૂ. ૧૨૦-૧૫ ની અંદરના વખતમાં થઈ હતી. એથી સ્વાભાવિક અનુમાન થાય છે કે ત્યાં સિધમાં શક્ષસરદારોની સત્તા ખૂબજ જમી ગઇ હતી, કે જેને પરિણામે તે પ્રદેશ ‘દુનિએ-સ્કુથિયા’ અથવા ‘હિન્દી શક્ષસ્થાન’ કહેવાયો.

આ હિન્દી શક્ષસ્થાનનું મુખ્ય શહેર-રાજ્યાની \*મીનનગરમાં હતી. તે શહેર સિન્ધુ નહીને કિનારે આવેલું હતું અને ત્યાંથી નળકમાં સમુદ્ર કિનારા ઉપર ખર્બેરક નામનું શક્ષલોકોનું બંદર હતું.

### પશ્ચિમભારતમાં પ્રવાસ—

સિધમાં પોતાનો અડો ને રહેઠાણું સ્થાયી જનાવીને તે લોકો પશ્ચિમ તરફ ચાલ્યા. કુચળ્યમાં થઈને તેઓ સૌરાષ્ટ્રમાં આવ્યા. આ ક્ર્યુ તેઓએ એકજ વર્ષમાં ખતમ કરી હતી એમ કાળકાચાર્ય ફુલથાનકથી સ્પષ્ટ પ્રતીત થાય છે. આ સમય છ. પૂ. ૧૧૦-૧૦૫

\* હિન્દી શક્ષસ્થાન કી રાજ્યાની મીનનગર સિન્ધુનદીકે કિનારે કહીશી સમુદ્રતપર બર્બરક નામકા બન્દરગાહ ઉસકે નજીવી હી થા. ઇસ કે બાદ જब ભારત કે દૂસરે પડોસી પ્રાન્તો મેં શકોંની ઉત્તા પહુંચી, તબ વહાં ઉનકે શાસક ક્ષત્રપ યા મહાકશ્ત્રય કહલાતે,... સંભવત: ઉનકા અધિપતિ મીનનગર કા શક મહારાજા હી હોતા થા. ઇસ પ્રકાર ભારતવર્ષમે સિન્ધુપ્રાન્ત શકોંના અડો ઔર આધાર બન ગયા, ઔર વહીસે વે દૂસરે પ્રાન્તો કી તરફ બઢે।

ભારતીય ઇંદ્ર રૂપરેખા પૂ. ૭૫૭.

ફુલથાનકથી સ્પષ્ટ પ્રતીત થાય છે. આ સમય છ. પૂ. ૧૧૦-૧૦૫

હરભ્યાનનો ગળી શકાય. સિન્ધુથી કાડીયાવાડ વચ્ચેના વૃણિષુ કુદુરે વિણેરે સત્તામો શક્લેકોએ સ્વાધીન કરી લીધી. સૌરાષ્ટ્રમાં તેઓ ઢીક ઢીક રદ્ધા. ચોમાસુ આન્ધુ હતું એઠલે આગળ વધુનુ સુશ્કેલ હતું. કુચ્છિ, સૌરાષ્ટ્રમાં તેમણે પૂણ સત્તા જમાવી. સૈન્યબળ ને સાધન સામચી પણ તૈયાર કરી. કહેવાય છે કે સૌરાષ્ટ્રને તે સરહારોની વચ્ચે વહેંચી લીધું હતું. અને ‘પારસ્ફૂળ’ માં જે સાહીને ત્યાં આચાર્યાંકાલકસ્ફૂરિ રદ્ધા હતા તેને સૌરહારોનો-સૌરાષ્ટ્રનો અધિપતિ નિમ્નો હતો.

### ક્ષત્રપ-મહાક્ષત્રપની ચોજના—

સિન્ધુમાં ‘શક્તસ્થાન’ ની સ્થાપના કર્યા પણી સૌરાષ્ટ્ર તરફ કૂચ કરી ત્યારે રાજ્યધાની તરીકે તો મીનનગર જ સુકરર હતું. ત્યાંના સત્તાધીશ તેમના અધીક્ષર-રાજી કહેવાતા. તે પણી જ્યાં જ્યાં તેમની સત્તા સ્થાપન થતી ત્યાં સૂણા કે વડાસૂણા નિમાતા. આગળ કહી ગયો તેમ સૂણાને સત્રપ કહેવામાં આવે છે અને સત્રપનું સંસ્કૃતક્રિપ-ભારતીયભાષામાં ક્ષત્રપ થાય છે. આ સૂણા કે ક્ષત્રપ અને વડાસૂણા કે મહાક્ષત્રપ બન્ને બરાખર સમાનાર્થક શાખાએ છે. તે સૂણા ને વડાસૂણાની સ્થાપના થતી. શક્તસ્થાન પણી જ્યાં જ્યાં સત્તા તેમણે જમાવી ત્યાં ત્યાં ક્ષત્રપ અને મહાક્ષત્રપની નિમણુક થઈ. શક્તસ્થાનમાં સાહીએ એમ સાડાનુસાહી (શહેનશાહ) મિશ્રદાત થીજાને આધીન હતા તેમ અંહિના ક્ષત્રપો ને મહાક્ષત્રપો ‘શક્તસ્થાનના રાજીને આધીન કહેવાતા.

### ક્ષત્રપનો હિંદમાં પ્રચાર—

આ ક્ષત્રપ કે મહાક્ષત્રપનો પ્રચાર પહેલ વહેલા મહાવિજેતા એલેક્ઝાન્ડરના વખતથી શરૂ થયો છે. હિંદ ઉપર ઈં સ૦ પૂરો ૩૦ તરફ-૩૨૪ ના અરસામાં એલેક્ઝાન્ડરે લડાઈએ. કરી હિંદના ધણુ પ્રદેશો જીતી લીધા અને તેના સ્વદેશ તરફ પાછો કર્યો લારે તેણે જીતાયલા સુલ્કો ઉપર સત્રપો નીમી પોતાના જીતાયલા પ્રદેશોને મોટી પાંચ સત્રપીમાં વિભાજિત કરી નાખ્યા હતા. તે પાંચ સૂણાગીરી (સત્રપી) માં પાંચ સૂણાએ નિમ્યા હતા. તેમાં

### એક સત્રપી તક્ષણિલામાં ક્ષત્રપ પ્રીલિપ

બીજુ સત્રપી કાબૂલમાં ક્ષત્રપ નિકેનર જેની હદ ખાકદ્વાર્યામાં આવેલા હિન્દુ-કુરશના ધારો સુધી હતી.

ત્રીજુ સત્રપી સિંધમાં એળુનરનો પુત્ર પિથન વિણેરે; એમ સત્રપો નિમાયા હતા.

આ સત્રપો આસપાસના નાનાં મોટાં સંસ્થાનોને દણાવી પોતાના અંડીયા ઘનાવી

લેખારે તે, મહાક્ષત્રપ બની જતો. આ મહાક્ષત્રપ તે વડોસૂણો, પ્રતિનિધિ કે વાયસરોથ્ય ને સ્થાને મનાતો.

### ઉજાજૈન ઉપર હલ્દો—

સૌરાષ્ટ્રમાં તેઓ સ્થિર થઈ, સાધન સામચી એકઠી કરી લીધી અને આચાર્ય કાલકસૂરિની સૂચનાથી ચોણ્ય સમયે તેઓએ ઉજાજૈનના રાજ ગર્દાભિષ્ટના રાજ્ય ઉપર હું મલો કરવા કૂચ કરી. તેઓએ દક્ષિણ ગુજરાતના રાજ \*ખળમિત્ર અને લાનુમિત્રને પણ સાથે મેળવી લીધા. કારણ કે તે એ ગર્દાભિષ્ટથી અપમાનિત થયા હતા એટલે ગર્દાભિષ્ટ સાથે તેમને પણ વૈર હતુંજ. એમ તે બનેને અને બીજા પણ ગુજરાતના રાજીઓને સાથે લઈ સૈં આચાર્ય કાલકસૂરિના નેતૃત્વ નીચે ઉજાજૈન તરફ આગળ વધ્યા અને ઉજાજૈન ઉપર હલ્દો કર્યો—ઘેરો ઘાલ્યો.

રાજ ગર્દાભિષ્ટ મહા શક્તિશાળી અને બ્યાંતરી વિદ્યા—ગર્દાલી વિદ્યાની સાધનાવાળો હતો. એ વિદ્યાને લીધે તે 'આચેય' ગણ્યાતો. કાલકસૂરિ એ હડીકિતથી પૂર્ણ વાકેદું હતા. ઘેરો ઘાલ્યા પણી આચાર્ય કાલકસૂરિને સમાચાર ભજ્યા અને જાણ્ય થઈ કે રાજ ગર્દાભિષ્ટ નણ્ય ઉપવાસ કરી ગર્દાલી વિદ્યાની સાધના કરી રહ્યો છે. ત્યારે તેણે સેનાના ચુનંદા એકસો આઠ શખ્ખાવેદી બાણ્યાવળી ચોઢાઓને છોલાવી આ હડીકિત જણ્યાવી અને સલાહ આગી કે જયારે ગર્દાલી—ગધાડી ભૂંકવા માટે મોઢું ઉધાડે ત્યારે એકદમ ગર્દાલીના મોઢામાં જાણ્યોનો વરસાદ વરસાવવો, બાણ્યાથી તેનું મોઢું લરી હેતું નેથી તે અવાજ ન કરી શકે. ચોઢાઓએ તે પ્રમાણે કર્યું અને રાજ ગર્દાભિષ્ટનો પરાજ્ય થયો.

આચાર્ય કાલકસૂરિએ તેને ઉખાડી ઉજાજિની ઉપર અધિકાર મેળવ્યો. પોતાની ખેણ સરસ્વતી સાધ્યાને છોડાવી કરી સંયમમાં પ્રવૃત્ત કરી, અને શક્લોકોએ ઉજાજૈન ઉપર પોતાની રાજ્યસત્તા સ્થાપી.

એ રીતે તે શક્લોકો તેમના મૂળ શક્લસ્થાનથી હિન્દૂકુશને માર્ગ સિન્ધૂનાં પાર કરી સિન્ધુમાં પોતાનું નહું શક્લસ્થાન જમાવી કુચછિને વિધી સૌરાષ્ટ્ર સુધી પહોંચ્યાં ત્યાં સત્તા જમાવી. ગુજરાત તરફ થઈ ઉજાજૈન ઉપર ચડાઇ કરી, ત્યાં રાજ્યસત્તા જમાવી. એ રીતે લારતના પાંચમણંડ ઉપર તેમનું એકછત્ર રાજ્ય સ્થાપન થયું.

\* દક્ષાનિનાદેન કૃતપ્રયાણ નૃપા: પ્રચેરુગુરુલાટ્દેશમ् ।

તદેશનાથી બલમિત્ર—માનુમિત્ર ગૃહીત્વાઽગુરવન્તિસોમામ्

## રાજ દ્વદ્રદામાનો રાજ્ય અધિકાર.

ઉજાજૈનમાં શકલોકોએ રાજગાહી સ્થાપન તો કરી પરંતુ લાંબા કાળ સુધી તે રકી નહીં. લગભગ ચારેક વર્ષ પછી શકલોકો પાસેથી ઉજાજૈનનું રાજ્ય છીનવાઈ ગયું. પરંતુ પશ્ચિમ ભારતમાં તો તેઓ અહુ લાંબા કાળ સુધી રાજ્યસત્તા લોગવી શક્યા, એટલું જ નહીં રાજ્યનો વિસ્તાર પણ વધાર્યો. તેમાં શકરાજ મહાક્ષત્રપ ચાષ્ટન અને મહાક્ષત્રપ દ્વદ્રદામા વધારે પ્રસિદ્ધ છે. મહાક્ષત્રપ ચાષ્ટને પોતાના નામથી વંશની સ્થાપના કરી હતી અને તે ચાષ્ટનવંશ કહેવાયો. અને રાજ દ્વદ્રદામાએ ઉજાજૈનની ગાહી પાઠી મેળવી હતી. રાજ દ્વદ્રદામા ચાષ્ટનનો પૌત્ર થતો હતો.

રાજ દ્વદ્રદામા વિગેરે ભૂળે તો કાર્દિભક્ત વંશના હતા. કાન્ડેર શુક્રાના એક ખાંડિત લેખ જે અમાત્ય સતેરકે એક પાનીયસાજન-પાણી ભરવાની ગોળી લેટ આપ્યા આખતનો છે તેમાં ખાસિષ્ઠીપુત્ર શ્રીસાતકણ્ણુંની હેઠી-રાણી કાર્દિભક્ત રાજએના વંશમાં ઉત્પત્ત થયેલ મહાક્ષત્રપ દ્વદ્રદામાની હિકરીનો ઉલ્લેખ છે.

આથી એમ જણાય છે કે-દ્વદ્રદામાના પિતામહ મહાક્ષત્રપ ચાષ્ટને સ્થાપેલો ચાષ્ટન-

વંશ તે વખતે વધારે ખ્યાતિ પામેલો ન હોવો જોઈએ અને ત્યાંસુધી વિશેષપણે તે કાર્ડ્બક વંશના કહેવાતા હોવા જોઈએ એટલે કે મૂળ તો એ કાર્ડ્બક વંશના હતા. વળી ચષ્ટનના પિતામહ આમેાતિક (ધ્સમેાતિક, ધ્સામેાતિક) સુધી તો ચષ્ટનવંશનું નામ નિશાનજ ને હતું.

ચષ્ટનના પિતામહનું નામ ખરેખર શું હતું તે ઘણું કાળ સુધીતો અજ્ઞાત અને સંશયાત્મક જ રહ્યું છે. તેને પહેલાં ધ્સમેાતિક કે ધ્સામેાતિક કહેતા પણ પાછળથી આદ્ધીલિપિ અને ખરોઢી લિપિમાં જેમ જેમ અન્વેષણ થતું ગયું ને ઉચ્ચારણનું જેમ જેમ સ્પષ્ટીકરણ થતું ગયું તેમ તેમ તેના વાસ્તવિક શફ્ટ્સાચચારણું થવા લાગ્યા. અને મૂળ શફ્ટ્સામાં પરિવર્તનો થતાં ગયાં. તેના પરિણામે પહેલાં જેને ધ્સમેાતિક કે ધ્સામેાતિક કહેતા હતા તેને આજે આમેાતિક કહે છે. કારણકે † જ ને કહેવા માટે તે વખતે ચ્સ નો ઉપયોગ થતો હતો. અત્યારની શોધખોળ પ્રમાણે આમેાતિક એ છેલ્દું ને પરિણિત નામ ગણ્યાય છે.

કેટલાક વિદ્યાનો સ્ટીનકોનો +સિલ્વનલેવી વિગેરે ભૂમક અને આમેાતિક બન્ને એકજ છે એમ માને છે, અને દલીલ રણ્ણ કરે છે કે આમેાતિક એ શકુશાણ છે અને તેમાં ‘અમ’ નો અર્થ ‘ભૂમિ’ એવો થાય છે એટલે આમેાતિક ને સંસ્કૃત ભાષામાં અનુદ્દિત કરવામાં આવે તો ભૂમક એવું નામ થાય, એટલે ભૂમક અને આમેાતિક બન્ને એકજ વિકિતના નામાન્તર હોવા જોઈએ.

વળી તે વખતે શક, પાર્થ્વ, કુશાન વિગેર લેકો જેમ અને તેમ પોતાના વ્યવહારમાં આર્થિકની છાપ લાવવા વિશેષ કોશીશ કરતા હતા એટલે સંલઘ છે કે તેમણે તેમના નામો આર્થિકભાષા—સંસ્કૃતમાં ફેરવી નાખ્યાં હોય.

વળી એ વખતે હિન્દનો પદ્ધિમ ભાગ સુરાણ્દ, ગુજરાત, કુચ્છ વિગેરે હિન્દી-રાજના અમલ નીચે ઘણું વખતથી હતો એટલે એમની સાથે લાગી જવા માટે આમેાતિકે પોતાનું નામ ભૂમક × રાખ્યું હોય.

† એજાનઇ એસાનઇ. મારતીય. રૂપરેખા પૃ. ૮૧૭

+ This *Ysamotika* is evidently derived from the Saka word *Ysama*, ‘earth’. I therefore agree with M. Sylvain Levi in identifying *Ysamotika* with *Bhumaka*, seeing in the latter name a clumsy attempt at translating the Saka name into Sanskrit.

*Kharoshthi Inscriptions.*  
Cor. Ins. Indi. Vol. II. Pt. I. P. lxx.

× ખરોઢી છન્સકીયશન પૃ. ૭૦.

અલગત પ્રતિહાસકારોએ આ દલીલોને બહુ ઓછું વળુફ આપ્યું છે. રાયચૌધરી વિગેરે પ્રતિહાસકોએ ક્ષહરાટ વંશનો ભૂમક અને ચાણનના પિતામહ આમેાતિક બન્ને લિખ વ્યક્તિત્વો હે એમ બતાવ્યું છે અને અત્યાર સુધી તે મનાતુંઆવે છે. પરંતુ વિચાર કરતાં મને એમ લાગે છે કે આમેાતિક અને ભૂમક બન્ને એકજ હોવા જોઈએ. શાક શણ આર્ય ભાષામાં પદવાયલો હોવો જોઈએ. અર્થાતું આમેાતિકનો અનુવાદ ભૂમક (સંસ્કૃતમાં) કરી લેવાયો હોય તે તફન સંભવિત છે. પરંતુ એટલું તો ખર્દંજ કે તે (એ હોય તોપણ) બન્ને શક્કાતિના હતા. તેના કુળ વિશે તેમણે ખાસ કશું કર્યું નથી.

ડુરેખસને તેના કુળ વિશે કાંઈક વિશેષ પ્રકાશ પાડ્યો છે અને તે કાર્દ્મકુળનો હોવા વિશે ઉલ્લેખ કરતાં એમ બતાવે છે કે—

એ કાર્દ્મક કુળનું મૂળ ઈરાન-પાર્થીયાના પ્રદેશમાં કાર્દ્મમ નહી આવેલી છે, અને ત્યાંના આ લોકો રહેવાસી હોય તો તે નહીના નામથી આ વંશનું નામ કાર્દ્મકવંશ પડ્યું હોય એ સાવ સંભવિત છે.

વળી રદ્ધામાની ખુન્તી પોતાને કાર્દ્મક કુળની ઓળખાવીને ગર્વ ધરતી હતી. એ પણ એક કારણ છે.

અર્થાતું આ નહીના નામથી અને પેલા લેખથી એમ માનવાને કારણ મળે છે કે તે મૂળે \*કાર્દ્મક કુળના હતા.

§ Lastly, the Karddamaka family, from which the daughter of the Mahakshatrapa Rudra claimed descent, apparently derived its name from the *Karddama* river in Persia.

*Political History of A. India P. 422.*

\* The queen's name is missing, but she is described as the queen of Vāsisthiputra shri Sātakarni, descended from the family of *kārddamaka* Kings. She was almost certainly also described as '[ the daughter ] of the Mahakshatrapa Rudra.'

*Indian Coins by Rapson* LI

The term is used so as to include at least two distinct families. The Ksaharatas and the family of castanā. It is possible that the proper name of the latter may have been *Kārddamaka*.'

*A catalogue of the Indian coins,  
in the British Museum* CIII

આમેતિકના પુત્ર ચષ્ટને તે કાર્ડ્ઝ મંડ કુણતું નામ હેઠળી પોતાના નામનો વંશ સ્થાપિત કર્યો અને તે પણ ધીરે ધીરે તેઓ ચષ્ટનવંશના રાજન્યો કહેવાયા.

ચષ્ટનના નામ માટે પણ ધોણો મતલેદ હતો. પ્રે. +એન્ડ્રીયસના મંત્રય પ્રમાણે પણ લાખામાં ચષ્ટન શઘનો ‘માલિક’ અર્થ થાય છે. અને પઢ્ટોલાખા એ પૂર્વ-તુર્કસ્તાનની પ્રાચીન શકુલાખા સાથે અમુક અંશે સંબંધ રાખનારી છે.

કેટલાક તેને \*પસ્તન કહેતા. પસ્તન એ નામ કુશાનવંશના દેવકુળમાંથી મળી આવેલી એક મૂર્તિ નીચે કોતરાયલું છે, તે ફિયષ્ટનની મૂર્તિ છે એમ શ્રી ભદ્રાચાર્યે પ્રથમ શ્રાધી કાલ્યું અને વિદ્ધાનેસ તે માન્ય રાખ્યું છે. એટલે પસ્તન એ ચષ્ટનતું જ નામ છે.

ડ્રાલેમી તેને ટીઅસ્ટનેસ તરીકે વર્ણિયે છે. ટીઅસ્ટનેસ એ યૂનાની લાખાનો શણ છે, તેનું ઇપ લારતીયલાખામાં ચષ્ટન થાય છે, એવો વિદ્ધાનેસ મત છે.

આ ચષ્ટન પ્રથમ તો સાધારણ ક્ષત્રપ હતો. કેટલાકના મતે તે કુશાનવંશનો ક્ષત્રપ હતો. પણ પાછળથી મહાક્ષત્રપ બન્યો અને રાજની ઉપાધિ પણ તેણે ધારણ કરી હતી.

તેનાં ચાંદી, તાંખાના સિક્કાઓ પણ મળ્યા છે તેના ઉપર આશ્રીલિપિમાં રાજો ક્ષત્રપસ છસ્મોતિકપુત્ર[સ—]...” લખ્યું છે. બીજી બાંનું અરોધીલિપિમાં “\*રાજો ચ[—], ચઠનસ” એટલું વાંચી શકાય છે.

+ Cor. Ind. Ins. Vol. II Pt. I P. lxx

\* “ ભારતીય ઇ. રસેરા. ” પૃ. ૮૫૨.

Muttra Sculptures P. 9

† B. Bhattacharya.....declares that the name on one of the two statues discovered with the statue of Kanishka at Mat, 9 miles north of Mathura, is 'Chastana.' K. P. Jayswal...points out that the fact that this statue was found in the same Devkula as the statue of Kanishka justifies the view that chashtana was a relative of Kanishka and belonged to the same family. Early History of India, P. 223.

§ Ptolemy tells us that in his time *ozēnē* was the capital of *Tiastanes*. This name transliterates *chashtana*, one which is found on coins and the cave temple inscriptions of Western India. This prince appears probably to have been the founder of the Kshatrapa dynasty of Western India ( see Ind. Alt. Vol. III, P. 171. )

Ancient India as described by Ptolemy. P. 155.

¶ Catalogue of Indian coins P. 72.

\* Catalogue of Indian coins by Rapson p. 73-4.



મહાકશ્ત્રપ પ્રસ્તાવ અથવા ચાપન  
( જે અત્યારે મથુરાના કર્ણિન ભૂજીયમભાં વિઘમાન છે. )



તેના તાંણાના સિદ્ધાચ્છે ઉપર ખોદેલા અક્ષરે સ્પષ્ટ વાંચી શકતા નથી.

પાછલા પ્રકરણમાં આપણે જેઠ ગયા કે શક્લોકોએ ગર્દિલિંગ પાસેથી ઊજૈનનું રાજ્ય છીનવી લીધું હતું પણ તે લાંબા કાળ શક્લોકો નભાવી શક્યા નહીં. લગભગ ચારેક વર્ષ પછી તે રાજ્ય તેમની પાસેથી ન્યાલ્યું ગયું. પરંતુ સૌરાષ્ટ્રની સત્તા તેમની પાસે બહુ લાંબા સમય સુધી રહી. લગભગ ચારસે વર્ષ સુધી સૌરાષ્ટ્રમાં તેઓ પ્રથમી સત્તાધીશ હતા.

\*ટોલેમીની ભૂગોળ ઉપર દીપ્પણ કરતાં મજમુદાર લએ છે કે શક્લોકો પાસેથી રાજ્ય છીનયું તે સસુદ્રગુમ્ને પુત્ર ચંદ્રગુમ્ને હતો અને તેણેજ શક્લોકો પાસેથી ઊજૈનની ગાદી છીનવી લીધી હતી.

આચાર્ય કાલકસુરિના નેતૃત્વ નીચે શક્લોકો ઊજૈનની ગાદીએ આવ્યા અને ચારેક વર્ષ પછી પાછી ગાદી એઈ તે પછી દૃદ્રદામાએ લીધી એટલે ચાષન કુચ્છિ-કાઠીયાવાડમાં તો બહુ લાંબા વખત રાજ તરીકે રહ્યો. લગભગ ઈ. ૮૦ થી ૧૧૦ સુધી તે મનાય છે. તે બહુ પ્રતાપી હતો.

તેનો પુત્ર જયદામા તેની પછી ગાદીએ આવ્યો, પણ તે બહુ પરાકર્મી નહતો. બલ્કે તેના સમયમાં તેના પિતાએ મેળવેલો ઘણોખરો વિસ્તાર તેની પાસેથી બીજી પ્રથમ સત્તાએ છીનવી લીધો હતો.

જયદામા પછી તેનો પુત્ર દૃદ્રદામા પ્રબન્ના પ્રતિનિધિ તરીકે રાજ્યાસન ઉપર આવ્યો. તે તેના દાદા ચાષન ક્રેવો પ્રથમ પ્રતાપી ને તેજસ્વી રાજીવી હતો. શરૂઆતમાં તો તે મહાક્ષત્રપ ચાષન સાથે કુચ્છિમાં રહેતો હતો, પરંતુ પાછળથી તો તે ભારે ચશસ્વી ને વિજેતા તરીકે વિભ્યાત થયો.

દિશાલોગોને યાં પહુલે હો પહુલ જો સૌરાષ્ટ્ર કો અધિકૃત કિયા થા વહ બહુ સમય તક ટિકા રહા। ઊજૈન કા અધિકારસૂત્ર તો ચારવર્ષ કે બાદ ઉનકે હાથ સે નિકલ ગયા થા; પર એસા પ્રતીત હોતા હૈ કે સૌરાષ્ટ્ર તો કમસે કમ ચારસો વર્ષો તક નિરંતર ઉન્હીંને અધિકાર મેં રહા। મું કલ્યાણવિજય.

‘દ્વિવેદી અમિનન્દન ગ્રન્થ’ પૃ. ૧૯

\*Ozene—...Ptolemy informs us that It was the capital of Tiastenes ( Chastana ). The descendants of him are known as the saka satraps. They were conquered by Chandra-Gupta II, Vikramaditya, the son of Samudra-Gupta.

*Ancient India as described by  
Ptolemy P. 373.*

તેના પિતાના વખતમાં સૌરાષ્ટ્રનો ઘણો પ્રદેશ છીનવાઈ ગયો હતો, બલ્કે આખા સુરાષ્ટ્રનો મુલક સાતવાહનવંશના રાજાઓના તાખામાં હતો.

જ્યારે શકુલોકે પહેલ વહેલા સૌરાષ્ટ્રમાં આવ્યા ત્યારે ત્યાંનું રાજ્ય પ્રજાસત્તાક હતું. નાના નાના લોકસંઘો પોતાના વિલાગનું રાજ્યતંત્ર ચલાપતા હતા. ધીમે ધીમે વિદેશીઓના હુમલાઓથી આ તંત્રવિવસ્થા નાચ થઈ અને સુરાષ્ટ્ર શકુલોકોને હાથે પડ્યું. તે પછી આંદ્રાના રાજ ગૌતમીપુત્ર સાતકણ્ઠિ<sup>x</sup> ને કર્ણી. પૃ. ૧૧૬-૪૪ સુધી રાજ્ય કરી ગયો—તેના હાથમાં હતું. તેના અવસાન પછી સુરાષ્ટ્ર ઉપર વિદેશી આકામણું થયું અને કુશાનવંશના ક્ષત્રપોના હાથમાં ગયું. એમ લગભગ ૪૦ વર્ષ સુધી સુરાષ્ટ્ર ઉપર ઉત્તર અને દક્ષિણ બન્ને તરફની બળવાન સત્તાઓના હુમલાઓ બરાબર ચાહું રહ્યા. એ હુમલાઓથી સુરાષ્ટ્રની પ્રજા પણ થાકીને ત્રાસી ગઈ હતી. તેમને તો એક એવા પ્રથમ રાજની જરૂર હતી ને એવા પુરુષને રાજ બનાવવા ચાહતી હતી કે જેનાં સંરક્ષણ નીચે પોતાની સંસ્કૃતિની, જનમાલની, ને સુંદરી બહાદુરી પૂર્વક રક્ષા કરી શકે. તેથી સુરાષ્ટ્રની સમસ્ત પ્રજાએ રાજ ઇદ્રદામાની પસંદગી કરી, તેમાં પ્રજા સંક્રણ નિવડી, એટલું જ નહીં ખૂબ આણાદ અને સુખી થઈ. ઇદ્રદામાએ પ્રજાની રક્ષામાં રાજ્યના શાસન અને વિસ્તારમાં આપ્રવ્ય કૌશલ્ય, કુનેહ ને બહાદુરી બતાવ્યા. સાથે સાથે પોતાની જાતને તેણે આર્થિકસંસ્કૃતિમાં ઓતપ્રોત કરી.

### ઇદ્રદામાનો રાજ્ય અમલ.

સુરાષ્ટ્રને સત્તાધીશ બની ઇદ્રદામાએ જીવનના ફરેક અંશમાં આર્થિકસંસ્કૃતિને અપનાવી, રાજકારબારમાં પ્રથાઓને બહુ જતનપૂર્વક સંભાળી રાખી, પ્રજા પંચાયતો, પ્રજાપ્રતિનિધિ—લોકસંઘોની સ્થાપના કરી, સલાહકારક મંત્રિમંડળ અને કાર્યવાહક મંત્રિમંડળની સ્થાપના કરી, રાજ્ય સંચાલનને ખૂબ વ્યવસ્થિત કર્યું. તેનુંજ એ પરિણામ છે કે શકુલોકોની સત્તા ઇદ્રદામા પછી પણ બહુ લાંબા કાળસુધી ભારતમાં ટકી રહી. તેણે પોતાના પાછળથી જીતાયલા બધા પ્રદેશો ઉપર એજ રીતે રાજ્યઅમલ કર્યો. બધે પોતાના પ્રતિનિધિ નિભ્યા અને તેજ પદ્ધતિએ તેનો રાજ્ય વિસ્તાર વધ્યો.

### યશક્રણી દિનગંધ.

ઇદ્રદામાના રાજ્યશાસનના વર્ષો તેના જીવનનાં અત્યંત યશક્રણી ને જનજવલ્યમાન હતાં. તે વર્ષોમાં જુદા જુદા મુલ્કો ઉપર ચાહાઈ કરી, તેણે ત્યાં પોતાની સત્તા કાયમ કરી. માળવા, સિંધ, કેંઠળ દેશો તાણે કર્યા. આંદ્રેશનાં રાજ વાશિષ્ઠીપુત્ર પુલુમાયીની

<sup>x</sup> આ પુલુમાયી સાથે તેણે પોતાની દિકરીનું લઘુ કર્યું હતું. એટલે વાશિષ્ઠીપુત્ર પુલુમાયી તેનો જમાઈ થતો હતો. માટે તેને બે વખત પકડવા છતાં મારી ન નાખ્યો અને જીતો છોડી દીધો.

સાથે એ વાર ચુંદો કરી તેને હરાવ્યો, પક્કાઓ અને છોડી હીધો. પુલુમાયીએ પોતાના પિતા પાસેથી જીતી લીધેલા ક્ષહરાતવંશના રાજયોના તમામ મુલ્કો દૃદ્રદામાએ પુલુમાયી પાસેથી પડાવી લીધા અને પોતાના રાજ્ય વિસ્તારમાં મેળવી હીધા.

પુલુમાયી પાસેથી મેળવેલા મુલ્કોની વ્યવસ્થા કરી તે છેક ગોદાવરીના કિનારા સુધી ગયો, પૂર્વમાં વિધ્યાચળની પહેલી પારસુધી, ઉત્તરમાં રાજપૂતાના, પંજાબ, તથા સિંધના ખધા પ્રદેશોને ચુંદો કરી જીતી લીધા.

### યૌધેયો પર વિજય—

રાજપૂતાનાના યૌધેયો તે વખતે પ્રભળ પરાક્રમી ગણ્યાતા હતા. ત્રણસો વર્ષથી ચાલી આવતી ખૂનામરકી અને લડાઈઓમાં તેઓ હુંમેશાં વિજયી રહ્યા હતા, અને પોતાનું અખંડ સ્વાતંત્ર્ય બહુ વીરતા પૂર્વક સંભાળી-સાચવી રહ્યા હતા. તેથી આખા દેશમાં યૌધેયોની વીર તરીકે ગણ્યના થતી. તેઓ પોતાના સિક્કાઓમાં ભાવાધારી વીર ચોઢાની મૂર્તિ રાખતા, અને ‘ \*યૌધેયગણસ્ય જય ’ એ પ્રમાણે ડેટરાવતા. બહુ લાંબા કાળ સુધી અપરાજિત રહેવાને આરણે, ને ખધા વિજયોને પરિણિતે તેઓ અત્યંત ફિદ્ધમંડી ને મહમસ્ત થઈ ગયા હતા. તેમને ડેઅ સત્તા દળાવી શકતી ન હતી, તેથી તેઓ અદ્ભુત મનના હતા. તેમને રાજ્ય વિસ્તાર રાજપૂતાના, ભરતપુરથી માંડીને ઈભાવલપુરની સીમા સતતલગ્નના નીચેના પ્રવાહ સુધી જતો હતો. અત્યારનું જોહીયાવર એ યૌધેય નામનું સૂચ્યક છે. આવા અદ્ભુત, અપરાજિત અને મહોન્મત યૌધેયોને પણ રાજ દૃદ્રદામાએ જખરજસ્તીથી ઊખાડી નાખ્યા હતા અને યૌધેયોનો આપો મુલ્ક કણજે કરી પોતાના રાજ્ય વિસ્તારમ મેળવી હીધો હતો. એ રીતે ઘણા રાજ્યોનો અને સૂખાઓનો અધિપતિ થવાથી તેણે મહાક્ષત્રપત્ર બિર્દદ પણ ધારણ કર્યું હતું.

તેણે ઉજાનૈન-માળાવદેશ ઉપર પણ ચડાઈ કરી તેને જીતી લીધો હતો. સુરાષ્ટ્ર-માંથી રાજધાની ઉડાલી લધ ઉજાનૈનમાં રાજધાની સ્થાપન કરી અને સુરાષ્ટ્રના સંચાલન માટે પહુલવ જાતિના સુવિશાળ નામના સરદારને સૂણા તરીકે નીચ્યો.

\* ભારતીય ઇ. રૂપરેખા પૃ. ૮૬૨.

† ૧૧-૧૨ સર્વક્ષેત્રાવિષ્કૃતવીરશબ્દજાતોત્સેકાવિધેયાનાં...

ડ્યુ યે ( યૌધેય ) પંજાબ કે દક્ષિણ મેં બહાવલપુર રિયાસ્ત કે પાસ સતત્યજ નદી કે કિનારે રાજ્ય કરતે થે। આજકલ કી કુછ સિક્કવ રિયાસ્તો ઔર રાજપૂતાને કા ઊપરી ભાગ ઇનકે અધિકાર મેં થા।

ગુરુવંશ કા ઇતિહાસ પૃ. ૮૭.

‡ ૧૨-યૌધેયાનાં પ્રસથ્યોત્સાદકેન  
૫

ઉજજૈન અતિપ્રાચીન નગર, વળી હેશના મધ્ય લાગમાં અને અનેક રાજવંશોની તે રાજધાની બની ચૂકેલું હતું એટલે મહાક્ષત્રપ દ્વદ્રદામાચે પણ રાજધાની તરીકે ઉજજૈનનેજ પસંદ કર્યું.

વ્યાપારની દિશાએ પણ વિશેષતાવાળું શહેર હતું, પશ્ચિમ કાંઠાના બંદરોના ભોટા લાગના વ્યાપારી શહેરોની વચ્ચે હતું એટલે વ્યાપાર ઉપર નજર રહી શકે, સાથે સાથે તે વિદ્યા અને અને સંસ્કૃતિના ધાર તરીકે પણ પ્રસિદ્ધ હતું, ચૂરોપના રેખાંશો અને સૂર્યમાન જેમ શ્રીનિવાયથી મપાય છે. તેમ હિંદના રેખાંશો અને સૂર્યમાન ઉજજૈનથી મપાય છે. એ રીતે સરસ્વતી ને લક્ષ્મી બન્નેની સાધનામાં એ શહેર વિશિષ્ટ હતું એટલે ઉજજૈન પસંદ આવે એ સ્વાભાવિક હતું.

### સુદર્શન તળાવનો પુનર્દ્રદ્ધાર—

વળી સુરાષ્ટ્ર ઉપર તેને પ્રેમ તો હતોઝ. તે ગિરનારના સુદર્શન તળાવને સમરાવીને તેણું બતાવી આપ્યો.

ગિરનારની તળેટીમાં ગિરિનગર હાલનું જીનાગઢ કે ઉપરકોટ શહેર પાસે સુદર્શન નામનું તળાવ હતું. તે તળાવ દ્વદ્રદામાથી સાડા ત્રણુસો વર્ષ પહેલાં સભ્રાદ્ય ચંદ્રગુમ્ફ મૌર્યના વખતમાં, અંધાયું હતું. દ્વદ્રદામાના વખતમાં અતિવૃષ્ટિના કારણે એક વખત ઘૂળ છલકાઈ ગયું, પાણીના મારથી તેનો બંધ તૂટી ગયો. પરિણામે આખું તળાવ આદી થઈ જઈ, જયંકર જંગલ પહોડની ખીણું-કોતર બની ગયું હતું પ્રજનમાં આથી લારે અસરોષ ફેલાઈ ગયો હતો.

દ્વદ્રદામાચે પ્રજને સંતુષ્ટ કરવાનો આ ધણોજ અગત્યનો, ઉપયુક્ત પ્રસંગ જોયો. તેણું એ તળાવને પહેલાં હતું તેના કરતાં ત્રણુગણું લાંઘુ, પહોળું અને સુંદર ફરી બંધાયું. તેના સમારકમનો બધો ખર્ચ તેણું પોતાની ખાનગી રકમમાંથી આપ્યો હતો. મંત્રીઓની \*સમ્મતિ નહીં હોવા છતાં તેણું તળાવને સમરાયું અને તેના ખર્ચ માટે પ્રજા પાસેથી એક પૈસો પણ લીધો ન હતો, તે નિભિતે પ્રજા ઉપર કશો કરવેરો તેમ નજરાણું પણ લીધાં ન હતાં. આ બધાની પ્રજા ઉપર લારે અસર થઈ.

તે વખતે સુરાષ્ટ્રનો સ્થોનો સુવિશાખ હતો. તેની દેખરેખમાં તળાવનું સમારકામ થયું હતું. તેણું તે તળાવની ચાહગીરીમાં એક પ્રશસ્તિ કોતરાવી છે. અત્યારે પણ ‘અશોક રોક’ જેમાં અશોકની ચૈદ આજાયો કોતરાયલી છે તેમાં આ પ્રશસ્તિ આપોખાયલી છે. તે દ્વદ્રદામાની પ્રશસ્તિ તરીકે વિખ્યાત છે.

\* સભ્રાદ્ય ચંદ્રગુમ્ફમૌર્યના વખતમાં અંધાયું હતું અને અશોકચર્ચના વખતમાં તેમાંથી નહોરો કાઢી હતી.

\* ૧૭-મહાક્ષત્રપસ્ય મતિસાચિવકર્મસચિવै...અનુત્સાહવિમુખમતિમિ:

\* ૧૫-૧૬-અપીડયિત્વા કરવિષ્ટપ્રણયકિયામિ:...

## રાજ રૂદ્રદામાનો જીતેલા રાજ્યો.

તેણે જ્યોતિષાગઠની પ્રશસ્તિ ઉપરથી તેના રાજ્ય વિસ્તારનો પૂરો ખ્યાત આવી શકે છે.

તેણે પૂર્વાએકર, પદ્ધિમાએકર અને અવન્તિના પ્રદેશો જીતી લીધા હતા. અનૂપદેશ અથવા માહિમાતી કે ભાન્ધાતા હાલનો નીમાડ વિલાગ તેણે કંબકે કર્યો હતો. આનત્રેશ જે દ્વારકાની આસપાસનો સુલક અને સુરાજદ્વારા-જ્યોતિષાગઠની આસપાસનો સુલક તે પણ તેના તાખામાં હતા. શ્વર્ણ-સાધરમતીના કંડાનો સુલક, મદ્રદેશ-મારવાડની લૂભિ, કુચળ્ય જે કાડીયાવાડ ને સિન્ધની વચ્ચેનો પ્રદેશ તે પણ તેની સત્તા નીચે હતો. સિન્ધુ-સૌધીર દક્ષિણ સિંધની ખીણુવાળો પ્રદેશ અને કુકુર-રાજ્યપૂતાનાનો અસુલક ભાગ પણ તેણે જીતી લીધા હતા. અપરાન્ત-ઉત્તર કેંકણુનો પ્રદેશ, અને નિષાદ-વરાડ દેશ તેના રાજ્ય વિસ્તારમાં ગણ્યાતા હતા. ઘૈધેયોનો ભાવલયુરવાળો પ્રદેશ આપો તેણે જીતી લીધા હતો. પદ્ધિમ વિન્ધ્યાચળનો સુલક અને પુલુમાયીના દક્ષિણાં પ્રદેશો આંગ્રે વિંગેરે પણ તેને હરાવીને રૂદ્રદામાનો પડાવી લીધા હતા.

અર્થાતું કુચળ્ય-કાડીયાવાડને સિન્ધના સમુદ્ર કિનારાથી માંડીને ગુજરાત, મારવાડ, રાજ્યપૂતાના, માળવા અને પંજાબમાં સત્તાજ સુધીનો ભાગ રૂદ્રદામાના છત નીચે હતો એ ઉપરથી એમ કહી શકાય કે તે એક ચક્રવર્તી જેવો રાજ હતો.

વળી તે કેવળ રાજ, લડવૈયો કે યોઝો હતો એટલું નહીં પણ કુશળ નીતિનિપુણ હોવા સાથે વિદ્વાનું અને શાસપારંગત પણ હતો.

આર્ય સંસ્કારોએ પણ તેના ઉપર સારી છાપ પાડી હતી પરિણામે તેણે યુદ્ધ સિવાય માનવહત્યા ન કરવી એવી પ્રતિજ્ઞા પણ કરી હતી અને અવંતપર્યંત પાળી હતી.

તે શરીરે-હેખાવે સુંદર ને આકર્ષક પણ હતો અને એ શિલાદેખથી જણ્યાય છે કે તેણે ધર્માસ્થાને સ્વયંબરોમાં રાજકુંવરીઓની વરમાળા ધારણ કરી હતી.

## રાજ રૂદ્રદામાના ઉત્તરાધિકારીઓ.

તેણે ઈ. સ. ૧૩૦ થી ૧૫૦ એટલે કુલ વીસ વરસ રાજ્ય કર્યું હતું. તેની રાજ્ય-વ્યવસ્થાને લીધે તેની પાછળ પણ બહુ લાંબા સમય સુધી ક્ષત્રપ રાજાઓના હાથમાં તેની ગાઢી ટકી રહી હતી. રૂદ્રદામા પછી તેનો ગાઢી ઉપર ઉત્તરાધિકારી તરીકે તેના એ પુત્રો દામજદર્શી અને રૂદ્રસિંહ થયા. મોટો પુત્ર ગાઢીવારસ થયો. તે રાજનું ખાસ વર્ણન મળતું નથી, પણ તેના સિક્કાઓમાં ‘ક્ષત્રપ’ અને ‘મહાક્ષત્રપ’ કોતરૈલું મળી આવે છે.

એટલે સંભવ છે કે પહેલાં તે દુર્દામાની નીચે કોઈ પ્રદેશનો સૂધેા હોય અને પાછળથી ગાહીએ આવતાં મહાક્ષત્રપ કહેવાતો હોય.

તેના સિઝાએ ઉપર જૂદું જૂદું લખાણું મળી આવે છે તે આ પ્રમાણે છે.

( ૧ ) રાજ્ઞો મહાક્ષત્રપસ રુદ્રદામપુત્રસ રાજ્ઞો ક્ષત્રપસ દામજસદસ

( ૨ ) રાજ્ઞો મહાક્ષત્રપસ રુદ્રદામપુત્રસ રાજ્ઞો ક્ષત્રપસ દામજદશ્રિય

( ૩ ) રાજ્ઞો મહાક્ષત્રપસ રુદ્રદામપુત્રસ રાજ્ઞો મહાક્ષત્રપસ દામજદશ્રિય

આ દામજદશ્રી ૧૫૦-૧૮૧ ની વચ્ચે ગાહીએ રહ્યો હતો એમ અનુમાન થાય છે.

તે પછી ગાહી ઉપર કોણું આવે તે સંબંધી અધિકો ઉલ્લેખ થયો હતો, તેના પરિણામે દામજદશ્રીને લાઈ દુર્દસ્તિ મર્યાદ ગાહીએ આવ્યો. તેના મિશ્ર ધાતુના સિઝાએ મળ્યા છે. તેના ઉપર શક્સંવત કોતરાવેલો માલ્યું પડે છે.

તેણે ૧૮૧-૧૮૮ સુધી રાજ્ય કર્યું છે. પછી દુશ્કરદસ આલીર મહાક્ષત્રપ થયો. તેણે ૧૮૮-૧૯૦ ઈ. સ. સુધી રાજ્ય કર્યું. તે પછી કરીને દુર્દસ્તિ પ્રથમે તેની પાસેથી ગાહી લીધી અને ૧૯૧-૧૯૬ ઈ. સ. સુધી અધિકાર લોણ્યો.

દુર્દસ્તિ પ્રથમ પછી તેનો ભત્રીને જીવદામા ગાહીએ આવ્યો. તે +મહાક્ષત્રપ કહેવાતો હતો. તેણે ૧૯૭ ઈ. સ. સુધી રાજ કર્યું હતું.

તે પછી દુર્દસ્તિનો પુત્ર દુર્દસેન પ્રથમ ગાહીએ આવ્યો, તે ઈ. સ. ૨૦૦ થી ૨૨૨ સુધી ઉજાજૈનની ગાહી ઉપર રહ્યો.

તે પછી દુર્દસ્તિના એ પુત્રો, દુર્દસેનના લાઈ સંઘદામા ને દામસેન અનુકૂમે ગાહીએ આવ્યા અને તેમણે એક વર્ષ અને તેર વર્ષ કમાનુસાર રાજ્ય કર્યું. એટલે કે, ઈ. સ. ૨૨૨-૨૨૩ અને ઈ. સ. ૨૨૩-૨૨૬ સુધી.

\* ગાહીના જધડા દરમ્યાન દામજદશ્રીનો પુત્ર સત્યદામા ગાહી ઉપર એડો હતો, પણ દુર્દસ્તિને ગાહી ઉપર આવીને તેને પદભ્રષ્ટ કર્યો હતો.

તે સત્યદામાના નામના સિઝાએ મળ્યા છે તેના ઉપર “ રાજ્ઞો મહાક્ષત્રપસ્ય દામજદશ્રિય પુત્રસ્ય રાજ્ઞો ક્ષત્રપસ્ય સત્યદામન ” એવું કોતરાયલું છે.

+ Indian Historical Quarterly Vol. XIII/2.

Political History of India P. 346.

પુથીસેન, દામજશ્રી બીજે, અને વીરદામા ક્ષત્રપ તરીકે રહ્યા. જ્યારે યશોદામા પ્રથમ, વિજયસેન, દામજદશ્રી ત્રીજે, દુદ્રસેન બીજે, વિશ્વસિંહ, ભર્તુર્દામા અને વિશ્વસેન એ બધા એક પણી એક મહાક્ષત્રપો થયા.

તે પછી દુદ્રસિંહ બીજે, યશોદામા બીજે, સ્વામી દુદ્રદામા બીજે અને સ્વામી દુદ્રસેન ત્રીજે અને સ્વામી સિંહસેન ગાહીએ આવ્યા. સ્વામી સિંહસેન એ રાજ દુદ્રદામા બીજનો લાણેજ થતો હતો.

સ્વામી સિંહસેન પછી તેનો પુત્ર સ્વામી દુદ્રસેન ચેંચો, તેનો લાઈ સ્વામી સત્યસિંહ, અને સ્વામી સત્યસિંહનો પુત્ર સ્વામી દુદ્રસિંહ ત્રીજે ગાહીએ આવ્યા. તે બધા મહાક્ષત્રપની પદવી લોગવતા હતા. સ્વામી દુદ્રસિંહ ત્રીજે એ દુદ્રદામાની ગાહી ઉપર છેલ્લો ક્ષત્રપરાન ગણ્યાય છે. નચલા બીજા રાજનોની રાજ અમલની પૂરી અવાંતર વિગત મળતી નથી. છેલ્લા મહાક્ષત્રપ સ્વામી દુદ્રસિંહ ત્રીજના અવસાનની સાલ ઈ. સ. ૩૮૮ ની ગણ્યાય છે. દુદ્રસિંહ ત્રીજ પછી દુદ્રદામાનો રાજ્ય વિસ્તાર ને ઊજજૈનની ગાહી ચાષ્ટનવંશીય રાજનો પાસેથી ચાલી ગઈ. ગુમણવંશી રાજનોએ છીનવી લીધી.

દુદ્રસિંહ ત્રીજે ૭૫૩ હુરાચારી હતો અને તેના ઉપર ગુમણવંશના સ્કંદગુમણના પ્રતાપી પુત્ર ચંદ્રગુપ્તે ચડાઈ કરીને તેને કપટથી મારી નાખ્યો.

અલગત તેને લડાઈમાં મારી શકાયો ન હતો. પરંતુ દુદ્રસિંહ બહુ વિષયાંધ ડોવાથી તે ઘુંઘટેવી નામની એક સુંદરી ઉપર મેાહિત હતો. ચંદ્રગુપ્તે એ ઘુંઘટેવીનો વેશ પહેરી દુદ્રસિંહના આરામ લવનમાં જઈ છળ કરી દુદ્રસિંહને મારી નાખ્યો અને માળવ, તથા સુરાષ્ટ્રના રાજ્યો કણજે કરી પોતાના રાજ્યમાં મેળવી દીધા.

એ રીતે મહાક્ષત્રપ દુદ્રદામાએ અતુલ પરાક્રમથી મેળવેલો રાજ્ય વિસ્તાર દુદ્રસિંહે વિષયાંધ બની જોઈ નાખ્યો અને ચાષ્ટનવંશીય ક્ષત્રપ રાજનોનો નાશ થયો. કેરી તે રાજનોમાંથી કોઈ ઉકુંબું ડોય એવો ધર્તિહાસ નથી.

આ સંક્ષિપ્ત વિગતથી એમ સમજી શકાય છે કે મહાક્ષત્રપ દુદ્રદામાની ગાહી ઉપર તેજ કુદુંબના-ચાષ્ટનવંશીય ક્ષત્રપોના મોટા કે નાના લાઈઓનો અમલ-અધિકાર રહ્યો હતો. વળી એક ક્ષત્રપ કે મહાક્ષત્રપ પછી તેનો ઉત્તરાધિકારી પણ તેજ પદવી લોગવી શક્યો છે.

બીજું એક હકીકિત એ મળે છે કે છેલ્લા ચાર રાજનો ચાષ્ટનવંશની પુત્રોના વંશના રાજનો દુદ્રદામાની ગાહીએ આવેલા છે.

આ રીતે દુદ્રદામાના ગાહીવારસો-ઉત્તરાધિકારીએ કુલ ૨૬ થયા છે. તેમાં ૨૩ મહાક્ષત્રપો હતા અને ૬ ક્ષત્રપો હતા.

ક્ષત્રપ એ પદવી કે કુલ ?

મૂળે તો ક્ષત્રપ કે મહાક્ષત્રપ એ પદવીજ-સૂખાગિરીજ લેખાતી હતી. સૂખાને ક્ષત્રપ અને સરસૂખાને મહાક્ષત્રપ કહેતા હતા. પરંતુ ઈતિહાસથી તો એમ હેખાય છે કે દ્વારામાં એ કોઈનો સૂખા કે સરસૂખો ન હતો. તે તો સ્વતંત્ર રાજ, ચક્રવર્તી જેવો હતો. કારણું કે તેણે પોતે બાહુભાંથી પોતાના રાજ્યનો વિસ્તાર વધાર્યો ને ટકાંયો, છતાં તેણે પોતાને મહાક્ષત્રપ તરીકેજ લેખાવ્યો છે.

તે પછી તેના ઉત્તરાધિકારીએ પણ દ્વારામાના સ્વતંત્ર રાજ્ય ઉપર અધિકાર લોગવી ગયા છે એટલે તેઓ પણ કોઈનાં સૂખા કે સરસૂખા ન હતા છતાં તેમણે પણ ક્ષત્રપ કે મહાક્ષત્રપ તરીકેજ પોતાને ઓળખાવ્યા છે. એટલે કે દ્વારામાથી લઈ કરી બધા રાજાઓએ પોતાને સ્વતંત્ર રાજ્યાં હોવા છતાં ક્ષત્રપ કે મહાક્ષત્રપ તરીકેજ ઓળખાવ્યા છે. અર્થાત્ ક્ષત્રપ શણ માત્ર એક સૂખા તરીકે નહીં પણ કોઈએક સ્વતંત્ર પદવી શાખા અથવા કુણ તરીકે ચાલુ કર્યો લાગે છે વળી પાછળથી તેઓ ક્ષત્રપરાજ તરીકે ઓળખાવ્યા છે. એટલે પાછળથી ક્ષત્રપ એ શાખા કે કુણ વાચક શણ દ્વારા ખાની ગયો છે.

### શક રાજાઓના ધર્મ—

આ શક રાજાઓના ધર્મ વિશે, ખાસ વિશેષ જાણવામાં આવ્યું નથી, પરંતુ જૂનાગઢમાંથી મળી આવેલા એક શિલાલેખથી એવું સમજાય છે કે એ શિલાલેખ જૈનધર્મનો હોવાનો સંભવ છે. એ લેખમાં કોતારાવનારનું નામ સ્પષ્ટ રીતે વાંચવામાં આવતું નથી પણ તેના પ્રપિતામહ ચાષ્ટન તથા પિતામહ જ્યદામાનો પૌત્ર એમ વંચાય છે, ચૈત્ર શુદ્ધ પ ની મિતિ સ્પષ્ટ વંચાય છે વર્ષ ઉકેલાયું નથી, પરંતુ એ ઉપરથી તે દામજદર્શી અથવા દ્વદ્દસિંહ હોવો જોઈએ એમ અનુમાન કરવાને કારણું છે. તે જૈન હોવાનો ધણ્યા સંભવ છે. બદ્લે તેના પૂર્વનો ઉપર પણ જૈનધર્મની સારી છાપ પડી હોય તો તે સ્વાભાવિક છે. કારણું કે જૈનાચાર્ય કાલકસ્યુરિ સાથે તે લોડો ભારતમાં આવ્યા હતા, તેઓ તેમના નેતા અને અગ્રાણી રહ્યા છે, તેમને ધણી સહાય કરી છે અને ગર્દિલિંગની ગાહી પણ શકલોકોને તેમણે અપાવી છે એવા એક ધૂરંધર આચાર્યનો ધાર્મિક પ્રલાવ પણ આ લોડો ઉપર પડવાનું સુલભ છે.

ને કે થીજા રાજાઓની ધાર્મિક વલણું સંખ્યા વધુ જાણવામાં આવતું નથી. પણ દામજદર્શીના કે દ્વદ્દસિંહના આ શિલાલેખે કંઈક દિશા જતાવી છે. તે \*શિલાલેખ 'Antiquities of

\* શિલાલેખની મૂળ નકલ આ પ્રમાણે છે.

૧ ...કરું રાગ...ક્ષત્રપ.....

૨ [ સ્વામિ ] ચષ્ટનસ્ય પ્ર [ પૌ ]ત્રસ્ય રાજ: ક્ષત્રપસ્ય સ્વામિજયદામગોત્રસ્ય રાજો મહાકઃ.....

ମୁହଁରାଜୁ ପ୍ରକାଶନିଲେ କଥା  
ମୁହଁରାଜୁ ପ୍ରକାଶନିଲେ କଥା





Kathiawad and Kachh,’ લાવનગરના મહારાજ તરફથી પ્રકાશિત થયેલ ‘Collection of Sanskrit Prakrit Inscriptions’ તથા ‘Historical Inscriptions of Gujarat’ Part. I માં પ્રકાશિત થયેલા છે. ઉપરના બન્ને પુસ્તકોમાં તો મૂળ શિલાનો ઈદૂ પણ આપવામાં આવેલો છે. તેનો ધણો ભાગ એવાઈ ગયેલો છે. પરંતુ તેમાં જે લખાણ અવશિષ્ટ ભાડી રહેલું મળે છે, તેમાંના ડેટલાક શણ્હો જૈનો સાથે વધારે સંબંધ રાખે છે. × કેવલિજ્ઞાનસંપ્રાસાનાં અને જિતજરામરણાનાં એ શણ્હો જૈનોમાંજ પ્રચાર પામેલા છે એટલુંજ નહીં તેમનાંજ ધર્મના પારિલાખિક શણ્હો છે. કેવલિજ્ઞાનસંપ્રાસ કે જિતજરામરણ એ તીર્થંકરો, સિદ્ધલક્ષ્યવાન કે ડેવણીએને જ જૈનોમાં લાણું પડે છે. એટલે એમ માનવાને કારણ મળે છે કે આ શિલાલેખ જૈનધર્મ સાથે સંબંધ રાખે છે.

સંલઘ છે કે આ ઇદ્રદામાના પુત્ર દામજદશ્રીએ ગિરનાર પર્વત ઉપર \*શ્રીનેમિનાથ ભગવાનનાં મંદિર સંબંધી કાંઈ બાંધ કામ કે સમારકામ કરાયું હોય અને તેની યાદગીરિ માટે આ શિલાલેખ ડાતરાયો હોય.

એ રીતે એમ પણ માનવાને કારણ મળે છે કે, આચાર્ય કાલકસૂરિ સાથે શકુલોકો આવ્યા ત્યારથીજ તે રાજાએમાં એ ધર્મનો પ્રલાઘ રહી ગયો હોય અને તે દામજદશ્રી અથવા ઇદ્રસિહ સુધી ચાટ્યો આવેલો હોય. ક્ષત્રપરાજાએ આચાર્ય કાલકસૂરિના પ્રલાઘથી જૈનધર્મ + અપનાયો હોય. કારણ કે પ્રાચીન સાહિત્યથી તેમનો પ્રલાઘ ધણો હતો. એમ જણ્યાય છે.

૩ [ચૈ] ન્ન શુક્લપક્ષસ્ય દિવસે પદ્મમે ॥ ૫ ॥ ઇહ ગિરિનગરે દેવાસુરનાગયક્ષરાક્ષસેન્દ્ર.....

૪ ...પ્રક ( ? ) મિવ પ...કેવલિજ્ઞાનસંપ્રાસાનાં જિતજરામરણાનં ( ? ).....

*Antiquities of Kathiawad and Kachh, P. 140*

૧ ...સ્તથા સુરગ...ક્ષત્રપ... ... ... ... ... ...

૨ ( સ્વામી ) ચષ્ટનસ્ય પ્ર ( પૌ ) ત્રસ્ય રાજ્ઞિ: ક્ષત્રપક્ષસ્ય સ્વામિજયદામપૌત્રસ્ય રાજ્ઞો મહાક્ષ...

૩ ( ચૈત્ર ) શુક્લપક્ષસ્ય દિવસે ( ૫ ) ઇહ ગિરિનગરે દેવાસુરનાગયક્ષરાક્ષસેન્દ્ર...

૪ પ્રક ( ? ) મિવ પરમ...કેવલિજ્ઞાનસંપ્રાસાનાં જિતજરામરણા ( ? ) ॥

*Collection of Sanskrit Prakrit Inscriptions. P. 17*

× કેવલિજ્ઞાનસંપ્રાસાનાં શણ્હ શિલાલેખમાં અશુદ્ધ આળખાયેલો છે. ભાષાની દૃષ્ટિએ કેવલિજ્ઞાનસંપ્રાસાનાં એ પ્રમાણે શણ્હ હોવો નેબદ્ધાયો.

\* ગિરનાર પર્વત જૈનોનું તીર્થ સ્થળ છે, અને શ્રીનેમિનાથ ત્રેવીશમા તીર્થંકરના નાણ કલ્યાણુકે દીક્ષા કલ્યાણુક, ડેવળજ્ઞાન કલ્યાણુક ને નિર્વાણ કલ્યાણુક ત્યાં થયાં છે.

+ મૌલિક્યશાલિનૃપતિરપરે તસ્ય સેવકાઃ । ઈતિ વ્યવસ્થયા તત્ત્ર રાજ્યમન્વશિષન શકાઃ ॥ ૬૦ ॥

તે શ્રીમત્કાલકાચાર્યપર્યુપાસનતત્પરાઃ । ચિરં રાજ્યાનિ બુસુર્જુર્જિનધર્મપ્રમાવકાઃ ॥ ૬૧ ॥

કાલકાચાર્ય ( જિનદેવીય ) કથા ॥ પૃ. ૧૦-૧

Dr. James Burgess નું પણ મારા અનુમાનને લગતું જ એવું મંતથ્ય છે કે 'Kevalins' એ માટે ભાગે જૈનેમાં બહુ પ્રચાર પામેલો શબ્દ છે અને તેથી શિલાલેખથી એવું જણ્યાય છે કે તે જૈનોનો શિલાલેખ હોવો જોઈએ ?

તેમણે તો એમ પણ અનુમાન હોયું છે કે આ ગુફાઓઝ જૈનો માટે બીજી સફીના અંતમાં સૌઠરાફ્ટના શાહ ( શક ) રાજાએ ડેટરવી હોય, જૈનોને તે લેટ આપી હોય અને પાછળથી ઔદ્ધોએ પોતાના ઉપરોગ માટે પડાવી લીધી હોય, અથવા તો આ શિલાલેખ બીજી ગુફાઓનો હોય અને તે ગુફાઓ બીલકુલ નષ્ટ થઈ જવાથી તે શિલાલેખને અહોં ઉપાડી લાવ્યા હોય.

મારું અનુમાન એમ છે કે તે રાજાએ લગવાન શ્રીનેમિનાથ કે તેમના મંદિર સંખ્યાં કશુ ખાંધકામ કરાવ્યું હોય અને તેની યાદીમાં આ શિલાલેખ ડેટરાવ્યો હોય.

ગુરોનિદેશાદ હતિ તૈ: પ્રહણૈ: ભૂપૈ: પ્રયાણ જ્ઞાયિતિ પ્રદત્તમ् ।

સર્વેઽપિ ભૂપા: સુગુરોશ્ સેવાં કુર્વન્તિ બજ્જાઙ્ગલયો વિનીતાઃ ॥ ૩૦ ॥

Brown. P. 100

.....વર્ષારાત્રે વ્યતિક્રાન્તે સૂરિણ ભણિતાસ્તત: ॥ ૪૦ ॥

હંહો ! નિરુદ્ધમા યુદ્ધ કિમુ તિષ્ઠ સંપ્રતિ । અવન્તિદેશં ગૃહણીષ્વં પર્વાસં તત્ત્ર ભાવિ વ: ॥ ૪૧ ॥

.....  
અથાજ્ઞગા સુર્ણીદ્રસ્ય શકયોદ્ધાશ્રતુર્દેશમ..... ॥ ૪૭ ॥

કાલકાચાર્ય કથા. પં. ૧૧

\* " ...The most interesting point about it is the word કેવલજ્ઞાનસંપ્રાપ્તાનાં " of those who have obtained the knowledge of Kevalins." *Kevalin* occurs most frequently in the Jain sculptures, and denotes ' a person who is possessed of the ' Keval-jnana ' or true knowledge which produces final emancipation.' It would, therefore, seem that the inscription is Jain."

From this it would appear that these caves were probably excavated for the Jainas by the *Saha Kings* of *Saurastra* about the end the second century of the Christian era. They may, however, be much older, and the inscription may merely commemorate their being devoted to the Jainas, by the Saha king, possibly after they had ceased to be used by the Buddhas: or, the inscription may have been brought from some other caves now entirely destroyed.

*Antiquities of Kathiawad and Kachh.* P. 141

ગમે તેમ પણ આ શિલાલેખ જૈનોનો છે એ તો નિઃશંક વાત છે. પ્રે. રેસન+ પણ તે વાતને અનુમોદન આપે છે. અને તે, તે વખતના રાજ ઉપર તેની અસર હતી એ પ્રતિપાદન કરે છે. પ્રે. રેસનોના એવો મત છે કે તેઓ જૈનધર્મ પાળતા હતા. તેમણે પોતાના પુસ્તકમાં લખ્યું છે કે “માળવાના ક્ષત્રપો જૈન વિજનાદિત્યે હરાયા તે જૈનધર્મનું પાલના કરતા હતા.” તેણું એ સ્પષ્ટ કર્યું છે કે ભયુરા કે તક્ષશિલાના ક્ષત્રપો ઐંદ્રધર્મ પાળતા હતા, જ્યારે માળવાના ક્ષત્રપો જૈનધર્મનુયાચી હતા. એટલે શાકલોકો ભારતમાં જ્યારથી આયા ત્યારથીજ જૈનધર્મની અસર તળે હતા અને તે દામજદર્શી અથવા રૂદ્રસિહ સુધી તેની અસર કાયમ રહી છે. તે પણીના રાજ્યોનો ઉપર જૈનધર્મના સંસ્કાર રહ્યા હતા કે કેમ તે ધર્તિહાસથી મળી શક્યું નથી, પરંતુ સંબંધ છે કે કેટલીક પેઢી સુધી તેની અસર રહી હોય.

### રૂદ્રદામાના સિઙ્ગાચો

ક્ષત્રપ રાજ્યોએ પોતાના સ્વતંત્ર સિઙ્ગાચો પડાયા હતા એ કહેવા જેવી વાત નથી. રૂદ્રદામાના દાદા પરદાદાના વખતથી ક્ષત્રપ રાજ્યોના સિઙ્ગાચો ચાલુ હતા. તેમાં તેમણે પસંદ કરેલી નિશાનીએ, ચિન્હેની અને નામો પણ ધણી જલના મળી આવે છે. રૂદ્રદામાના પણ સિઙ્ગાચો ચાંદીના અને તાંબાના મળી આવે છે. સોનાના સિઙ્ગાચો હજુ મળ્યા નથી. કદાચ ક્ષત્રપ રાજ્યોએ સોનાના સિઙ્ગાચો પડાયા નહીં હોય.

ધર્તિહાસમાં તેનું વર્ણન આવે જ છે, પરંતુ પ્રાચીન ઐંદ્રધર્મથોમાં પણ તેના સિઙ્ગાચોનું ખૂબ વર્ણન કરાયેલું છે. તેના ઉપર સારિપુત્રથૈર અને બુદ્ધઘોષ વિગેરએ ખૂબ નિયારે કર્યાં છે. તે અથીમાં રૂદ્રદામક, રૂદ્રદામકાદિ, રૂદ્રદામકાદીનિં વિગેર શહેરો આવે છે.

સારત્થીપનીમાં રૂદ્રદામકની વ્યાખ્યા કરવામાં આવી છે કે રૂદ્રદામેણ ઉપ્પાદિતો અર્થાત ‘રૂદ્રદામા એ પડાવેલા.’ Manufactured by Rudradama. \*રૂદ્રદામક એ રૂદ્રદામકાદિ, રૂદ્રદામકાદીનાં વિગેરે શહેરોનું પ્રાથમિક રૂપ અથવા એ શહેરોનો પૂર્વભાગ છે.

વળી રૂદ્રદામા એ શકરાજ સિવાય ધીજનું નામ આજસુધી ધર્તિહાસમાં મળ્યું નથી અને તેથી એ સિઙ્ગાચો રૂદ્રદામાના છે એમ નિશ્ચિત થાય છે.

રૂદ્રદામકનો ધીજે અર્થ એવો પણ કર્યો છે કે રૂદ્રદામાના સિઙ્ગા જેવા નમૂનાના ધીજા સિઙ્ગા તેના પણીના રાજ્યોએ પડાયા હોય તો તેને પણ રૂદ્રદામકાદિ કહી શકાય. પરંતુ તેની ચર્ચા અહીં અપ્રાસંગિક થઈ જવાથી તે લંબાણ નહીં કરતાં કેવળ રૂદ્રદામાના સિઙ્ગાચો સંખ્યાંથી અહીં થાડી ચર્ચા કરી છે.

+ Indian coins in British Museum P. Lxi.

× “...The Sakas, who in Mālwa were patrons of the Jain religion...”

“ Ancient India ”. P. 143.

\* Buddhistic studies P. 389.

૬

રદ્રદામાના ચાંદીના સિક્કા ‘ સ્ટાન્ડર્ડ મની ’ તરીકે પ્રમયાત હતા અને તે રદ્રદામાના રાજ્યકાળની પહેલા ચાલતા ચાંદીના સિક્કાઓ સાથે ધ્યે અંશે મળતા હતા ને ભાગવા, કાઠીયાવાડ, કુચ્છિ, ગુજરાત, ઉત્તરી કેંકણ, નાસિક, પૂના લુલામાં પ્રચલિત હતા, જેના ઉપર રદ્રદામાએ પાચળથી રાજ્ય કર્યું છે. એથી એમ સિક્ક થાય છે કે— રદ્રદામા પોતાના તાંખાના સિક્કા કરતાં ચાંદીના સિક્કા( ને ચલણી સિક્કા Standard money તરીકે ચાલતા તે )થી વધારે જાણુંતો થયો હતો.

\*તેનાં તાંખાના અને ચાંદીના સિક્કાઓ ધણી રીતે જુદા પડે છે.

- (૧) એક તો તેના ધારણુભાં ફેરફાર હતો.
- (૨) તેના આકારો પણ જુદા હતા, ચાંદીના સિક્કાઓ ગોળ હતા જ્યારે તાંખાના સિક્કા જુદા આકારના હતા—ચાંદીયા હતા.
- (૩) તેની પદ્ધતિ અને type માં પણ ફેર હતો.

ચાંદીના સિક્કાઓમાં એક તરફ ‘ રાજ્યનું મસ્તક ’ કોતરાયલું રહે છે; તેની બીજી ભાગ્યું ‘ ત્રણ શિખરવાળા ચૈત્ય ઉપર બીજની ચંદ્રાકૃતિ ’ ‘ કિરણેવાળો સૂર્ય ’ ‘ અર્ધ ચંદ્રાકૃતિ ’ ‘ ચૈત્યની નીચે સર્પાકાર લાઈનો, ’ વિગેરે વિગેરે કોતરાયલાં હોય છે.

તેનાં તાંખાના સિક્કામાં એક તરફ એક પ્રાણીનું ચિત્ર અથવા ‘ ડાણી બાળ્યું ઉલેલો હાથી ’ અથવા “ સિક્કાની ડાણી બાળ્યું થાંબલાની સન્મુખ ઉલેલો ઘોડા ” કે ‘ જેતર તરફ જેઠને ઉલો રહેલો ખુંધવાળો ણળદ ’ રહે છે. તેની બીજી ભાગ્યું ‘ ત્રણ લાઈનો ઉપર અર્ધચંદ્રાકૃતિ સહિત ચૈત્ય ’, ‘ સકિરણ સૂર્ય,’ ‘ અર્ધચંદ્રાકૃતિ,’ અને ‘ ચૈત્યની નીચે વળાંક વાળી લાઈનો ’ વિગેરે રહે છે.

તે બન્ને પ્રકારના સિક્કામાં ટપકાવાળી બોર્ડ-કિનારી પણ ખાસ ધ્યાન એંચનારી છે. તાંખાના સિક્કામાં કોઈમાં તે કિનારી ઉપરની બાળ્યુભાં હોય છે. કોઈમાં તે નીચેની બાળ્યુભાં હોય છે. જ્યારે ચાંદીના સિક્કાઓમાં તે ટપકાવાળી કિનારી નીચેની બાળ્યુભાંજ માલૂમ પડે છે.

તે બન્ને પ્રકારના સિક્કાઓમાં પાછલી બાળ્યુભાં ‘ ચૈત્ય ’નું ચિહ્ન તો સામાન્ય પણું રહેલું છે.

તેના સિક્કાઓમાં ને અક્ષરો ને નામો કોતરાયલા છે તે પણ જુદી જુદી રીતે કોતરાયલા છે, તે આ પ્રમાણે—

- ( ૧ ) રાજ્યો ક્ષત્રપસ જયદામપુત્રપસ રાજ્યો મહાક્ષત્રપસ રુદ્રદામપસ ।
- ( ૨ ) રાજ્યો ક્ષત્રપસ જયદામપસ પુત્રપસ રાજ્યો મહાક્ષત્રપસ રુદ્રદામપસ ।

તે બન્ને પ્રકારના સિક્કાઓમાં ‘ મહાક્ષત્રપ રદ્રદામા ’ તો લખેલું મળી આવે છેજ.

\* Buddhistic studies P. 390.

અષ્ટનવંશીય ક્ષત્રપોની વંશાવળી

આત્માતિક

૧ અષ્ટન ૮૦-૧૧૦ ઈ. સ.

જયદામા

૨ ઇદ્રદામા ૧૩૦-૧૫૦.

૩ દામજદશ્રી પહેલો  
| ૧૫૦-૧૮૦

૪ ઇદ્રસિંહ પહેલો  
૧૮૧-૧૮૮  
૧૬૧-૧૬૬

પુત્રી—વાશિષ્ઠીપુત્ર સાતકણુ

સત્યદામા

૫ જીવદામા ૧૬૭.

૬ ઇદ્રસેન પહેલો ૨૦૦-૨૨૨. ૭ સંધામા ૨૨૨-૨૨૩. ૮ દામસેન ૨૨૩-૨૩૬.

પૃથ્વીસેન

દામજદશી ધીનો

૯ વીરદામા ૧૦ યશોદામા ૧૧ વિજયસેન ૧૨ દામજદશી ત્રીનો  
૨૩૮-૨૩૬ ૨૩૬-૨૪૦ ૨૫૧-૨૫૫

૧૨ ઇદ્રસેન ધીનો ૨૫૫-૨૭૭.

૧૩ વિશ્વસિંહ ૨૭૮. ૧૪ ભર્તુદામા ૨૮૨-૨૯૫.

૧૫ વિશ્વસેન ૨૯૫-૩૦૪.

સ્વામી જીવદામા

૧૬ ઇદ્રસિંહ ધીનો ૩૦૪-૩૧૬.

૧૭ યશોદામા ધીનો ૩૧૬-૩૩૨.

૧૮ સ્વામી ઇદ્રદામા ધીનો ૩૪૪-૩૪૭.

૧૯ સ્વામી ઇદ્રસેન ત્રીનો ૩૪૮-૩૫૧.

પુત્રી

૨૦ સ્વામી સિંહસેન ૩૬૦-૩૭૬.

૨૧ સ્વામી ઇદ્રસેન ચોથો ૩૮૨.

૨૨ સ્વામી સત્યસિંહ

૨૩ સ્વામી ઇદ્રસિંહ ત્રીનો ૩૮૮.

નોટ—મહાક્ષત્રપ દામજદશી પ્રથમ અને ઇદ્રસિંહ પ્રથમના રાજ્યકાળની વચ્ચાં ઈધીરસેન આલીર મહાક્ષત્રપની ગાઢી ઉપર આવી ગયો હતો.

## સુદર્શન તળાવ.

### સુદર્શન તળાવનું સ્થાન-માપ—

સુદર્શન તળાવ કોણે બંધાવ્યું, કોણે સમરાવ્યું કે પુનર્દ્વાર કર્યો અને તેના શિલાલેખ વિગેરે સંબંધી પાછવા પ્રકરણોમાં ખૂબ વિસ્તારથી વર્ણન કર્યું છે. તે સાથે સાથે સુદર્શન તળાવની પણ થાડી ઘણી માહિતિ આપવી આવશ્યક છે. અદાત તેની પૂરી માહિતિ મળી શકે તેવા પ્રમાણો અત્યારે નથી, ધતિહાસમાં તે મળી શકતાં નથી; અવલમાં તો સુદર્શન તળાવ હતું કે નહીં એનીજ માહિતિ ઓગણીસમી સહી સુધી તો ન હતી; પરંતુ જ્યારે દૃદ્રદામાનો શિલાલેખ વંચાયો ત્યારે સુદર્શન તળાવની હસ્તીનો કોડેને ખ્યાત આવ્યો. શિલાલેખમાં તેના સ્થાન કે માપ સંબંધી કશો ધસારો કર્યો નથી. એટલે તે તળાવ ક્યા સ્થાનમાં હતું અથવા હેઠું જેઠા અને તે કેટલું લાંબું પહેલું હતું તે સંબંધી ધતિહાસકારોને કેવળ એ શિલાલેખ કે શિલાથી અનુમાન બાંધીને સંતોષ માનવો પડે છે. એ ઉપરથીજ તેના વિસ્તાર સંબંધી કે તેના સ્થાન સંબંધી જેટલા અંશમાં થઈ શકે તેટલા અંશમાં વિચાર કરવો જરૂરી છે.

સુદર્શન તળાવ સંબંધી એ શિલાલેખો મૌજૂદ છે. એક મહાક્ષત્રપ રાજ દૃદ્રદામાનો અને બીજો સ્કુંદગુમનો. તે બન્ને શિલાલેખો અશોકની આજાવાળી શિલા ઉપર કોતરાયદા છે. તે બન્ને શિલાલેખોમાં તેનું નિશ્ચિત માપ કે નિશ્ચિત સ્થાન સંબંધી નિર્દેશ નથી.

તે શિલાદેખથી તેના સ્થાન સંબંધી અનુમાન કરવાને એટલું પ્રમાણું મળી આવે છે કે તે તળાવ એ શિલાની આસપાસ હોવું જોઈએ. એ શિલા તળાવની મર્યાદામાં કે તળાવની આસપાસ હોવાનો ઘણો સંભવ છે; જેમ ઘરનો લેખ કે મહિરનો લેખ મહિરની મર્યાદામાં હોય, હુકાનનું ઓર્ડ જેમ હુકાન ઉપર હોય તેમ આ તળાવનો શિલાદેખ પણ તળાવની આસપાસજ હોવો જોઈએ.

તે સાથે સાથે શિલાદેખમાં નહીંઓના નામો આવે છે. તે નહીંઓ આ તળાવમાં મળે છે એવો તેનો ધ્વનિ છે. વળી બંધ હુમેશાં નહીંઓને વહેણું રોડીનેજ બંધાયતા હોય છે. તેમાં સુવર્ણસિકૃતા અને પદ્માશિનીના નામો આવે છે અને તેના પાણી તળાવમાં મળે છે એ હડીકત છે. તે નહીંઓનાં વહેણું કંઈ તરફ હતાં તે વિચારવાનું રહે છે.

હુવે એ તળાવની દિશા નક્કી કરવાને માટે પ્રથમ ગિરનાર, તે શિલા અને જૂનાગઢની દિશા નક્કી કરવી રહી. ગિરનાર એ પૂર્વ દિશામાં છે. જૂનાગઢ પશ્ચિમ દિશામાં છે અને તે શિલા લક્ષ્મણુ ટેકરીની નીચેના લાગમાં એટલે દક્ષિણ દિશામાં છે, કારણ કે લક્ષ્મણુ ટેકરી દક્ષિણ દિશામાં છે. ઉત્તર દિશામાં પૂર્વ તરફ જોગણી ટેકરી છે અને ઉત્તરપશ્ચિમનો લાગ લગલગ આલી જેવો છે. ગિરનારમાંથી નિકળેલી નહીં દક્ષિણમાં વહી શકે નહીં કારણ કે ત્યાં ટેકરીએ છે. વળી અત્યારે દામોદર કુંડવળણી નહીનું વહેણું ઉત્તર પાંચમમાં છે અને તે ખીણું થઈને વહું જય છે. એટલે તે સુવર્ણસિકૃતા અને પદ્માશિની નહીંઓનાં વહેણું ઉત્તર પાશ્ચિમમાં જૂનાગઢ શહેરના પૂણ્યાના લાગે થઈને વહેતા હોવો જોઈએ અને ત્યાંજ એ નહીંઓનાં વહેણું અટકાવવા બંધ બાધેલો હોવો જોઈએ.

અત્યારે પણ દામોદરકુંડ હાલની સોનરેખ નહીના વહેણુંમાંજ બાધેલો છે અને તેનું વહેણું લક્ષ્મણુટેકરી અને જોગણી ટેકરીને જોડનારા પુલ નીચે થઈને ઉત્તર પશ્ચિમમાં વહે છે અને તે આગળ જઈને અશોકશિલાની સામે થઈ ગિરનારદરવાળ પાસે ત્રિવેણીના સંગમ મેળવી ઉપરકોટની પાછળ થતી થતી મજોબીદરવાળ અને સંકર-બાગની વચ્ચમાં થઈને નહીના ઢૂપમાં વહી જય છે.

એટલે કે અશોક શિલાની સામી બાળૂએ ઉત્તર પશ્ચિમમાં અર્થાત્ દક્ષિણની લક્ષ્મણુ-ટેકરી અને તેની સામે ઉત્તરમાં જોગણુટેકરીની વચ્ચમાં બંધ હોવો જોઈએ. સુદર્શન તળાવનું સ્થાન શિલાદેખવાળી શિલાની સામેના લાગમાં ઉત્તર પશ્ચિમમાં નિશ્ચિત કરી શકાય.

વળી તે તળાવ જૂનાગઢ શહેરથી બહુ હર પણ ન હોવું જોઈએ. કારણ કે શહેરથી બહુ હર ન હોય તો શહેરીઓ તેનો લાલ લઈ શકે અને આ શિલા શહેરથી લગલગ માધ્યમ પોણો માધ્યમ છે. એથી પણ એમ અનુમાન કરવાને કારણ મળે છે કે તે તળાવ જૂનાગઢ શહેર અને પ્રશસ્તિની શિલાના સ્થાનની વચ્ચા જગામાં હોવું જોઈએ.

આ બધી વિચાર કર્યા પણી એમ નિશ્ચિત અનુમાન ઉપર આવી શકાય છે કે ઉપરકોટનો પાછલો ભાગ અને આ શિલા વચ્ચે તે તળાવનું સ્થાન હતું.

તેના માપ સંખ્યી-તે કેટલું લાંબું, પહેલું ને વિસ્તારવાળું હતું તેની માહિતિ પણ નિશ્ચિતદ્વારા શિલાલેખમાં નથી. છતાં સ્કેનદગુમ્બના શિલાલેખમાં એક માપ\* આવ્યું છે પરંતુ તે પૂરા બંધનું નહીં પણ તેણે તળાવના બંધમાં પડેલું ગાબડુજ માત્ર પૂરાંથું હોય એમ તે માપનાં આંકડાઓથી જણાય છે. કારણ કે રૂદ્રદામાના વખતમાં પડેલા ગાબડાના હિસાબે સો હાથ એ લાંબું ન કરેવાય કારણ કે રૂદ્રદામાના વખતમાં ૪૨૦ હાથ લાંબું પહેલું ગાબડુજ પડયું હતું, એટલે ચંદ્રગુમ્બના વખતમાં ૪૨૦ હાથ કરતાં તળાવ ઘણું મોદું હતું. વળી રૂદ્રદામાચે તો ચંદ્રગુમ્બના તળાવ કરતાં ત્રણગણું મોદું તળાવ બંધાંથું હતું-તળાવનો બંધ બંધાંથ્યો હતો. એટલે કે રૂદ્રદામાના વખતના તળાવની લંબાઈ પહેલાંથી હિસાબે ૧૦૦x૬૮ હાથ એ તેનો સંપૂર્ણ વિસ્તાર હોઇ શકેન નહીં. એટલે તેની સંપૂર્ણ લંબાઈ પહેલાંથી કેટલી હતી તે કહેલું અત્યારે મુશ્કેલ છે.

માર્દાં અનુમાન એમ છે કે તે તળાવ ઉપરકોટની દીવાલની અડોઅડ ડેલુ જોઇએ. કારણ કે ઘણ્ણા કિલ્વાએની આસપાસ ખાઈએ હોય છે અને તેની પાછળ નહીં કે તળાવ હોય છે જેથી કિલ્વાનું સંપૂર્ણપણે રક્ષણું થઈ શકે. વળી ઉપરકોટ કિલ્વાના પાછલા ભાગમાં ખૂબ ઊડી ઝીણું જેલું પણ છે. એટલે તે તળાવ શિલાથી તે ઉપર કોટના કિલ્વા સુધી હોય તો તે સંભવિત છે.

મી. અરદેશર સુદર્શન તળાવનો જે ચાર્ટ તૈયાર કરેલો છે અને જે અત્યારે જ્યુનાગઢના સંક્રાંત બાગના ભ્રૂઝીયમાં ટાંગેલો છે તેમાં પણ તળાવનું સ્થાન ઉપરકોટ કિલ્વાની બરાબર ડેવાનું બતાવેલ છે.

મી. અરદેશરજી તથા મી. કેંદ્રિંગાટનએ અમુક માપ કરેલું છે તે આ પ્રમાણે છે. ચંદ્રગુમ્બના વખતમાં તળાવની મર્યાદા—

દક્ષિણ કિનારો—સવરામંડળ અને લક્ષ્મણ ટેકરી ૨૩૬ વાર.

\* આયામતો હસ્તશતં સમગ્રે વિસ્તારત: ષષ્ઠિરથાપિ ચાણૌ ।

ઉત્તેષ્ઠતોન્યતુરૂષાણિ સ (?) સ (?) [ .....હ ] સ્તશતદ્વયસ્ય । (II) બવન્બ યત્નાત

અર્થાત् એકસો હાથ લાણો, ૧૮ પહેલો, અને સાત પુરુષ જેટલો ઉચ્ચો બંધ બંધાંથ્યો છે.

ઉત્તર કિનારો—ત્રિવેણી ને જોગણીહિલ-ટેકરી.

પૂર્વ કિનારો—જોગણીટેકરી.

પશ્ચિમ કિનારો—ઉપરકોઠની સિધાણુમાં સવરામંડપથી ત્રિવેણી ૧૧૦૦ વાર.

રદ્રદામાના વખતમાં તળાવની મર્યાદા—

દક્ષિણ કિનારો—ઉપર પ્રમાણે.

પૂર્વ કિનારો—ઉપર પ્રમાણે.

ઉત્તર કિનારો—વિશરામગુનોથી જોગણીટેકરીની ઉત્તરમાં વધારે લાંબો.

પશ્ચિમ કિનારો—ઉપરકોઠની સિધાણુમાં વિશરામગુનો સુધી.

સાથે સાથે તે તળાવના વિસ્તાર સંબંધી તેમનું છેલેણું છે કે ચંદ્રગુપ્તના વખતમાં ૧૪૦ એકર અને રદ્રદામાના વખતમાં ૨૭૮ એકરના વિસ્તારવાળું તે તળાવ હતું.

## શિલાલેખ અને અનુવાદો.

શિલાલેખની સામાન્ય માહિતી—

કાઠીયાવાડમાં જૈનોના પવિત્ર મહાતીર્થ ગિરનાર પર્વતની પઞ્ચિમમાં અને અમરકોટ-ઉપરકોટ કે જૂનાગઢની પૂર્વ દિશામાં એટલે કે-જૂનાગઢ શહેર અને ગિરનાર પર્વતની વચ્ચમાં, દામોદર કુંડની આ તરફ, શહેરથી ગિરનાર પર્વત જતાં રસ્તા ઉપર જમણી ખાજૂએ શહેરથી એકાદ માઈલને અંતરે લાક્ષમણુ ટેક્કરીની નીચે એક નાતું છાપરી જેવું પૃથ્રણંધી મકાન આવે છે જેમાં મૌર્ય સમાટ આશોકનો ઘડક શિલાલેખ છે. તેમાં આશોક સામ્રાટના ૧૪ શાસનો કોતરાવેલા છે. તે સાથે સાથે એજ ઘડક ઉપર બીજી એ શિલાલેખો છે. એક મહાક્ષત્રપ દૃદ્રદામાનો અને બીજે સ્કંદગુપ્તનો છે.

દૃદ્રદામાનો આ શિલાલેખ સોથી પહેલાં ૧૮૭૮ માં મી. જેન્સ પ્રિન્સેપે પ્રકાશિત કર્યો હતો. અને તે પછી ડા. ને. વીલ્સન, પ્રો. લાસેન, પ્રો. બર્જિસ, ડા. લગવાનાલાક ઈન્ડ્રાલ, ડા. ભાડ્વાળ વિગેરએ તેનાં ઉપર ધણું સંરોધનો કર્યો છે.

મહાક્ષત્રપ દૃદ્રદામાના રાજ્ય અમલમાં શક સં. ૭૨ ના માગશર વહિ ૧ પ્રતિપદાએ મુશળાધાર વરસાદ વરસ્યો. અને પુષ્કળ પાણી ભરાઈ જવાથી પાણીના ધંધાને લીધે તળાવના અંધમાં ૪૨૦ હાથ લાંબું, ૪૨૦ હાથ પહોળું અને ૭૫ હાથ ઉંડું ગાંધુ પડી જવાથી

તળાવ આણુ કુટી ગયું અને તેમાંનું બધુ પાણી તે ગાળડા વાટે બહાર ચાલ્યુ ગયું. છેવટે તે તળાવ લયંકર જંગલ જેવું દેખાવમાં હૃદર્શન થઈ ગયું.

આ વખતે આખા આનાર્ટ અને સુરાજદ્ર પ્રાન્ત ઉપર સમાદ્ર દૃદ્રદામા તરફથી પહૂલવ જલિના કુલૈપનો પુત્ર સુવિશાખ સૂખા તરીકે અમલ ચલાવતો હતો તેણે મહાક્ષત્રપ દૃદ્રદામાની આજાથી તળાવને મજબૂત પાળા બંધાવ્યા, નાળાંએ ભૂકાંયા, તેમાંથી નહેરો કાળી, તળાવને ફરતા ધાટો કર્યા, અને પહેલાં હતું તેના કરતાં ગણુગણું વિશાળ સુદર્શન સરોવર બંધાવી તેનો પુનર્દૂદ્ધાર કરાવ્યો.

સુદર્શન તળાવના એ લોક કલ્યાણુના કાર્યની અમર યાદમાં સૂખા સુવિશાખે આ શિલાદેખ ડેતરાવ્યો છે.

આ શિલાદેખમાં મહાક્ષત્રપ દૃદ્રદામાએ પોતાની પૂર્વ થઈ ગયેલા મૈર્ય સમાદ્ર ચંદ્રગુપ્ત અને તેના પ્રાંતીય સૂખા વેશ્ય પુષ્યગુપ્ત તથા મૈર્યસમાદ અશોક અને તેના ચવને સૂખા તુખાસ્ક જેમણે આ સુદર્શન તળાવ અનુક્રમે બંધાવ્યું હતું અને તેમાંથી નહેરો બંધાવી સુશોલિત કર્યું હતું અર્થાત્ અનુક્રમે નિર્માણ કરતા, અને નહેરો બંધાવનારના નામો પોતાના શિલાદેખમાં ડેતરાવી પોતાના હૃદયની વિશાળતા બતાવી છે.

### અડકનું માપ.

તે અડક બેનાઈટના ખરખચડા પત્થરનો છે. તેનું circumference ઘેરાવો ૭૫ પ્રીથી પણું વધારે છે. તે પોલાશંકુના આકારનો છે અને જમીનની સપાઠીથી લગભગ બાર પ્રીટ ઉચ્ચી છે.

### અડક ઉપરના લેણો.

તેની ઉપર ડેતરાયલા કુલ ત્રણ શિલાદેખો છે, તે ત્રણે અડકના જુદા જુદા ભાગમાં ડેતરાયલા છે તેમાં—

( ૧ ) અશોકના ચૌદ શાસનવાળો શિલાદેખ અડકની ઉત્તર પૂર્વ દિશા-ઈશાન ખૂણુમાં ડેતરાયલો છે.

( ૨ ) મહાક્ષત્રપ દૃદ્રદામાનો શિલાદેખ અડકની ઉત્તર દિશામાં પશ્ચિમ તરફ છે.

( ૩ ) સુદર્શનનો શિલાદેખ નીચેના ભાગમાં દરવાજામાં પેસતાં સામેજ નજ્દે પડે છે.

### અડકની દિશા.

તે આપો અડક એવી રીતે પડેલો છે કે તેમાં ડેતરાયલો સમાદ્ર અશોકનો શિલાદેખ ગિરનાર પર્વતની સન્મુખ આવે છે એટલે કે પૂર્વદિશામાં છે. અને મહાક્ષત્રપ

રદ્રદામાનો શિલાલેખ પચ્ચિમમાં અર્થાતું જૂનાગઢ શહેરના વાધેશરી દરવાળ તરફે-  
ઉપરકેટ તરફ છે. અને તે દક્ષિણ તરફથી વાંચી શકાય છે. એ શિલાલેખ ( રદ્રદામાનો )  
બીજુ શતાબ્દિમાં કેતરાયાતું મંતંધ્ય છે. તેની સાલ ઈ. સ. ૧૫૦ મનાય છે.

આ રદ્રદામાના શિલાલેખમાં ઘડકની ૧૧ શ્રીએ પ ઈચ્ચા જગ્યા પહેણાઈમાં અને પ  
શ્રીએ, પ ઈચ્ચાની જગ્યા ઉચાઈમાં રોકાયલી છે.

શિલાલેખમાં નાની મોટી મળીને ૨૦ ( વીસ ) પંક્તિઓ છે. અલખત તે પેરિથાફેના  
રૂપમાં નથી પણ તેનો સંબંધ જુદી જુદી પંક્તિઓમાં અવિચિન્નપણે છે. તેની કોતરણી  
સાહી છે. તેના અક્ષરોની ઉચાઈ સરેરાશ હું ઈચ્ચ જેટલી છે. એટલે કે અક્ષરો હું ઈચ્ચ  
જેટલા માપના છે.

### ભાષા-શૈલિ ને લિપિ.

દેખની ભાષા સંસ્કૃત છે. તેની શૈલિ લલિત, એજસ્લબરી સુંદર ગંધમય છે.

લિપિ દક્ષિણી જૂની લિપિના મૂળાક્ષરોને મળતી છે એટલે કે મજકૂર ઘડક ઉપર  
સ્કંદગુપ્તના દેખની લિપિ છે તેને મળતીજ છે.

લેખ કુલ વીસ પંક્તિનો છે; પણ તેમાં છેવટના ભાગની ૪ પંક્તિઓ ( ૧૭-૨૦ )  
જ સુરક્ષિત અને સ્પષ્ટ વાંચી શકાય તેવી છે. બાકીની ૧-૧૬ પંક્તિઓ એવી છે કે જેની  
કોઈ ને કોઈ પંક્તિમાં કંઈ ન કંઈ લાગ વસાઈ જવા પાર્યો છે. તેમાં કંઈક ઈરાદાપૂર્વક,  
અજ્ઞાનતાથી કે મૂર્ખતાથી તુકશાન કરવામાં આવ્યું છે અને કંઈક લાંબોકાળ તેના ઉપર  
પસાર થઈ જવાથી ટાઠ તડકો ને વરસાહના કુદરતી વસારથી ઘડકની સપાઈ વસાઈ  
જવાથી તે ભાગ ઉપરના અક્ષરો કે શણ્ણો ઉકેલી શકતા નથી.

એ વીસ લાઈનના શિલાલેખમાં કુલ ટોટલ ૧૬૦૦ ( એગાણીસસો ) સ્ક્વેર ઈચ્ચ  
જગ્યા રોકાયલી છે. તેમાં વચ્ચે વચ્ચે અક્ષરો ઉડી ગયા હોય તેવી જગ્યા—missing portion-  
૨૭૫ ( બસો પંચાતેર ) ઈચ્ચની આદી છે. અર્થાતું આખા શિલાલેખની જગ્યાનો ૧/૭  
હિસ્સો ચાલ્યો ગયેલો છે, ઉડી ગયેલો છે, ઉઘડી ગયેલો છે. બાકીનો ભાગ જ્યાં ઘડકની  
સપાઈ એકસરખી છે ત્યાં સ્પષ્ટ વાંચી શકાય છે.

એ શિલાલેખનું આખું લાખાણ એક સરખી લાઈનોમાં નહીં પણ લાંખી હુંકી  
લાઈનોમાં લાખાણેલું છે. તેમાં કેટલીક પંક્તિઓની લંબાઈ, હુંકાઈ ખાસ ધ્યાન એચે  
એવી છે. જેમકે—

## શિલાકેખ અને અનુવાદ

શિલાકેખની પ્રથમ લાઈન ૫ પ્રીટ ઉ ઈચ લાંબી છે.

” નવમી લાઈન ૧૧ ” ૧ ” લાંબી છે.

” ૧૧ મી લાઈન ૯ ” ૯ ” ”

” ૧૭ ” લાઈન ૫ ” ૨ ” ”

” ૨૦ ” લાઈન ૨ ” ૫ ” ”

આ આજો શિલાકેખ મહાક્ષત્રપ રૂદ્રદામાની પ્રશસ્તિ રૂપે છે અને ખાંસ કરીને તે સુદર્શન તળાવના બાંધકામને લગતો છે. તે મહાક્ષત્રપ રૂદ્રદામાના આનર્ત ને સુરાષ્ટ્ર પ્રાંતના સૂણા—Governor પહૂલવ જલિના કુલૈયના પુત્ર સુવિશાએ ડોતરાવેલો છે. તેની પંક્તિવાર હુકીકત આ ગ્રમાણે છે—

પંક્તિ ૧-૩—તળાવની તત્કાલીન ઉત્તમ સ્થિતિનું વર્ણન છે.

” ૩-૪—મહાક્ષત્રપ રાજ રૂદ્રદામા તેના પિતા ક્ષત્રપ જયદામા અને તેના પ્રપિતા મહાક્ષત્રપ ચછુનના નામો તથા તે તળાવ તૂળ્યાની સાલ (૭૦+૨) છે. અલખત જયદામાનું નામ તેમાં ઉડી ગયું છે.

” ૪-૮—રૂદ્રદામાના સમયમાં શક સં. ૭૨ ના માગશર વદ ૧ મે અતિવૃદ્ધિના તોકાનથી તળાવમાં મોટું ૪૨૦૫૪૦૫૭૫ હાથનું ગાખડું પડ્યું, તળાવમાંથી પાણી બધું નીકળી ગયું ને તળાવ ખરાણ હેખાવવાળું થઈ ગયાનું વર્ણન છે.

” ૮-૯—મૌર્યસાટ ચંદ્રગુપ્તના ગવર્નર ક્વેશ્ય પુષ્યગુપ્તના વખતમાં તે તળાવ પ્રથમવાર બંધાવ્યાની તથા સાટ અરોકના પ્રાંતીય સૂણા તુપાસ્ટે તેને નાળીઓ—નેરો વિગેરથી સુશોલિત કર્યાનું વર્ણન છે.

પંક્તિ ૯-૧૫—રાજ રૂદ્રદામાના કાર્યોનું, સ્વલાપનું, પરાક્રમ, જીતેલા પ્રદેશો, ગૈધેચો પર વિજય, સાતકેર્ણીને એ વખત હરાવ્યાનું, વિદ્યાવ્યાસંગ, શરીર-બંધારણ, રાજકુંબરીઓના સ્વયંવરોમાં વરમાળા અને સ્વોપાર્વિત “મહાક્ષત્રપ” બિદ્રદ ધારણું કર્યાનું વર્ણન છે.

પંક્તિ ૧૬—તે તળાવને ઝરી ત્રણગણું વિસ્તૃત બંધાવ્યું અને તેને વિશેષ પ્રકારે શોલિતું કર્યાનું વર્ણન છે.

x ક્વેશ્ય એ ‘વરાહમિહિર’ ના મતે પશ્ચિમ ભારતમાં વસનારી એક જલિ હતી.

પં. ૧૭-૧૮—તળાવ બંધાંયા પહેલાં પ્રધાનોની તળાવ બંધાવવા ભાખતમાં અસમ્મતિ હોવાથી પ્રજામાં પ્રકટેલી નિરાશા ને હાહાકાર મચી જવાનો ઉલ્લેખ છે.

પંક્તિ ૧૯-૨૦—મહાક્ષત્રપ, ઇદ્રદામાના પ્રાંતીય ગવર્નર પહુલવળતિના કુલૈપના પુત્ર મુવિશાખની હેખરેણમાં એ કામ થયાનું વર્ણન છે.

એ શિલાલેખમાંની એ પંક્તિઓમાં ક્ષત્રપરાજ્યોના નામો આવે છે તે નીચે પ્રમાણે છે :—

પં. ૩ મહાક્ષત્રપ શણ્ઠ ડેાતરાયલો છે.

પં. ૪ સ્વામિચષ્ટનસ્ય પૌત્ર.....[ જયદામ્નઃ ] પુત્રસ્ય રાજ્ઞો મહાક્ષત્રપસ્ય....., રુદ્રદામ્નઃ ડેાતરાયલું છે.

પં. ૧૫ મહાક્ષત્રપ બિદ્ધ ધારણુ કર્યાનો અને મહાક્ષત્રપેણ રુદ્રદામ્ના મહાક્ષત્રપ ઇદ્રદામાએ તળાવ બંધાંયાનો ઉલ્લેખ છે.

પં. ૧૭ મહાક્ષત્રપ શણ્ઠ પદ્ધો છે.

પં. ૧૯ ઇદ્રદામાના સૂણા મુવિશાખનું નામ છે.

ખાંસ કરીને આ આખાય શિલાલેખમાં સુદર્શન તળાવની અનાવટ ને પુનર્દ્ધારની હૃદીકરણ વર્ણવી છે.

આ શિલાલેખ લારતવર્ષના પ્રસિદ્ધ પ્રાચીન શિલાલેખોમાં શુદ્ધ સંસ્કૃતમાં લખાયલો આ સૌથી પ્રાચીન મોટો શિલાલેખ છે. આ પહેલાના ×શિલાલેખો બધા પ્રાકૃત ભાષામાં કે સંસ્કૃતમિશ્ર પ્રાકૃત ભાષામાં લખાયલા છે.

\* એક સંસ્કૃત લેખ ભખુરામાં યશ્યૂપ ઉપર મળેલો છે પણ તે આની અપેક્ષાએ બન્ધુજ્ઞ નાનો છે.

### મૂળ સંસ્કૃતશિલાલેખ ।

૧. સિદ્ધં [॥\*] ઇદं તર્ડાકં સુદર્શનં ગિર[હ]નગરાદપ[હ]\* દ્વ[ક?]રમ[ન?]ત[અ].....  
[ચ]ઇકોપલવિસ્તારાયામોચ્છ્યનિઃસંધિબદ્ધદૃઢસર્વપાળીકત્વાત् પર્વતપા-
૨. દ્વારાત્મિકાદ્વિષિષ્ટ-સુક્ષ્મિષ્ટ[દ] અ[બ] [નધ?] મ.....  
.....[વ]જાતેનાકૃત્રિમેણ સેતુબન્ધેનોપપત્રં સુપ્રતિવિહિતપ્રણાળીપરી[વ]આહ-
૩. મીઢવિધાનं ચ ત્રિસ્કન્દ[ધ?].....  
.....નાદિમિરનુગ્રહૈર્મહત્યુપચયે વર્તતે [।\*] તદિદં રાજ્ઞો મહાક્ષત્રપસ્ય સુગૃહી-
૪. તનામ્રઃ સ્વામિ-ચષ્ટનસ્ય પૌત્ર..... : પુત્રસ્ય રાજ્ઞો મહાક્ષત્રપસ્ય  
ગુહમિરભ્યસ્તનામ્નો રૂદ્રદામ્નો વર્ષે દ્વિસપ્તિતમ્ [એ] ૭૦ [+] ૨
૫. માર્ગશીર્ષ-બહુલ-પ્રત[હ] .....  
..... : સૃષ્ટવૃષ્ટિના પર્જન્યેન એકાર્ણવભૂતાયામિવ પૃથિવ્યાં કૃતાયાં  
ગિરેરૂર્જયતઃ સુર્વણસિકતા—
૬. પલાશિનીપ્રભૃતીનાં નદીનાં અતિમાત્રોદ્વચ્છૈવેગૈઃ સેતુમ[અ?] .....  
.....[ચ]માણાનુરૂપપ્રતીકારમપિ ગિરિશિખરતરતુટાદ્વાલકોપતલ્પદ્વાર-  
શરણોચ્છ્યનિધ્વંસિના યુગનિધનસદ્-
૭. શ-પરમઘોરવો(વે)ગેન વાયુના પ્રમથિતસલિલવિક્ષિપ્તજર્જરીકૃતાવ[દી?] .....  
.....[ક]ષ[હ] સાખ્મવૃષ્ટગુલ્મલતાપ્રતાનં[મ] આ નદી[ત]લા[દ] ઇલ્યુદ્ધાટિતમાસીત[।\*] ચત્વારિ હસ્તશતાનિ વી(વિ)શદુતરાણ્યાયતેન એતાવંત્યેવ વિસ્તીર્ણેન
૮. પંચસપતિ હસ્તાનવગાઢેન ભેદેન નિસ્સ્તૃતસર્વતોયં મરુધન્વકલપમતિષ્ઠશં દુર્દ્વ[દ]અ.....  
.....[સ]યર્થે મૌર્યસ્ય રાજ્ઞિ ચંદ્રગ[ઉ][સ][સ] [ય][ર] આષ્ટિયેણ [વ]દેશેન  
પુષ્યગુમેન કારિતં અશોકસ્ય મૌર્યસ્ય તે[ન] યવનરાજેન તુષ[આ]સ્ફેનાધિષ્ઠાય
૯. પ્રણાળીમિરલ[મ]કૃત[મ]તલકારિતયા ચ રાજાનુરૂપકૃતવિધાનયા તરસ્મિ[ન]ભેદે દૃષ્ટા પ્રનાડ્યા  
વિશ[ત]તસેત[ઉ] .....ણા આ ગર્ભત્પ્રભૂત્યવિહતસમુદ્દ[હ][ત]ર[આ]જલક્ષ્મી-ધ[આર]-  
ણાગુણતસર્વવર્ણેરભિગમ્ય રક્ષણાર્થી પતિત્વે વૃતેન આ પ્રાણોચછ્વાસાત્પુરુષવધનિવૃત્તિકૃત-
૧૦. સત્યપ્રતિજ્ઞેન અન્યત્ર સંગ્રામેષ્વભિમુખાગતસર્વશત્રુપ્રહરણવિતરણત્વાવિગુણરિ[પુ?].....

\* અપિદૂરં ને ખદ્દે અવિદૂરં ( પાસે ) એવે પાઠ જોઈતો હતો.

.....તકારુણેન સ્વયમભિગતજનપદપ્રણિપતિ [ત?] આ[ય]  
[ ઉ?] બશરણદેન દસ્યુવ્યાલ્મિગરોગાદિભિરનુપસૃષ્ટપૂર્વેનગરનિગમ-

૧૧. જનપદાનાં સ્વર્વાર્થાર્જિતાનામનુરક્તસર્વપ્રકૃતીનાં પૂર્વપિરાકરાવંત્યનૂળનીવૃદાનર્તસુરાષ્ટ્રશ્ચ  
[ ભ]ર[મ]રુ[કચ્]છ[સ]ઝ[ન]ધુમ[ઔ]વ[ઈ]રકુકુરાપરાંતનિષાદાદીનાં સમગ્રાણાં તત્પ્ર-  
ભાવાદ[ય]અ.....ર[થ]કામવિષયાણા[મ]વિષયાણાં પતિના સર્વક્ષત્રાવિષ્કૃત-
૧૨. વીરશબ્દજાતોત્સેકાવિધેયાનાં યૌધેયાનાં પ્રસંગોત્સાદકેન દક્ષિણાપથપતેસ્સાતકર્ણેદ્વિરપિ  
ની(નિ)ર્વાજમવજી(જિ)લ્યાવજી(જિ)લ્ય સંબંધાવ્ [ઇ]દૂરયા અનુત્સાદનાત્રાપયશસા મા[દ?]ન  
.....[મ]વિજયેન બ્રષ્ટરાજપ્રતિષ્ઠાપકેન યથાર્થહસ્તો-
૧૩. ચ્છુથાર્જિતોર્જિતધર્માનુરાગેણ શબ્દાર્થગાન્ધર્વન્યાયાદ્યાનાં વિદ્યાનાં મહતીનાં પારણધારણ-  
વિજ્ઞાનપ્રયોગાવાપ્તવિપુલકીર્તિના તુરગગજરથચર્યાસિચર્મનિયુદ્ધાદ્યા.....  
.....[તિ]પરબલલાઘવસૌષ્ઠવક્રિયેણ અહરહર્દાનમાનાન-
૧૪. વમાનશીલેન સ્થૂલલક્ષેણ યથાવત્પ્રાત્મૈર્વલિશુલ્કભાગૈ: કનકરજતવન્નૈદૂર્યરત્નોપચયવિચ્યન્દ-  
માનકોશેન સ્ફુટલધુમધુરચિત્રકાન્તશબ્દસમયોદારાલંકૃતગદ્યપદ્ય.....ન  
પ્રમાણમાનોનમાનસ્વરગતિવર્ણસારસત્વાદિમિ:
૧૫. પરમલક્ષ્ણઠયંજનૈરૂપેતકાન્તમૂર્ત્તિના સ્વયમધિગતમહાક્ષત્રપનામના નરેન્દ્રકલ્યાસ્વયંવરાનેકમા-  
લ્યપ્રાપ્તામન્ [આ] મહાક્ષત્રપેણ રૂદ્રદામ્ના વર્ષસહસ્રાય ગોત્રાહ[મ]અ.....ર[થ]મ્ ધર્મ-  
કીર્તિવૃદ્ધયર્થ ચ અપીડયિત [વ]આ કરવિષ્ટિ-
૧૬. પ્રણયક્રિયામિઃ પૌરજાનપદં જનં સ્વસ્માત્કોશા[ન] મહતા ધનૈરેન અનતિમહતા ચ કાલેન  
ત્રિગ્[ઉ]ણ્દૃદૃતરવિસ્તારાયામં સેતું વિધા[ય?] [સ્ર?]ર[વ]વત[દ?]એ.....[સ્ર]ઉર્ધ્દર્શનતરં  
કારિતમિ [ત] ઇ [। ઝ] [અ?] [સ.] મિત્રાર્થે
૧૭. મહાક્ષત્રપ[મ]ય મતિસચિવકર્મસચિવૈરમાત્યગુણસુમુદ્ધુકૈરપ્યતિમહત્વાદ્ ભેદસ્યાનુત્સાહવિમુખ  
મતિમિ[:નિ] પ્રત્ય[અ]ખ્યાતારંમ
૧૮. પુનઃસેતુબન્ધનૈર[આ]શ્યાદ હાહાભૂતાસુ પ્રજાસુ ઇહાધિષ્ઠાને પૌરજાનપદજનાનુપ્રહાર્થ પાર્થિવેન  
કૃત્સનાનામાનર્તસુરાષ્ટ્રાણાં પાલનાર્થનિયુક્તેન
૧૯. પહ્લવેન કુલૈપપુત્રેણામાત્યેન સુવિશાખેન યથાવર્દ્ધર્થર્મબ્યવહારદર્શનૈરનુરાગમભિવર્ધ્યતા  
શક્તેન દાન્તેનાચપલેનાવિસ્મિતેનાયર્યેણાહાર્યેણ
૨૦. સ્વધિતિષ્ઠતા ધર્મકીર્તિયશાંસિ ભર્તુરભિવર્દ્ધ્યતાનુષ્ઠિતમિતિ । (II)

## ગુજરાતી અતુવાહ.

૫. ૧. આ તળાવ સુદર્શન ( નામતું ) ગિરેનગર ( જૂનાગઢ ) થી પણ હર....માટી પથરોની વિસ્તૃત લાંબી, ઉચ્ચી સાંધા વગરની બધી મજબૂત પાજ્યો. વડે બંધાયલો ડાવાથી પર્વતના—
૫. ૨. ચરણુની પ્રતિસ્પર્ધી કરવાવાળા સુશ્રિતષ્ઠ....અકૃત્રિમ સેતુઅન્ધથી મજબૂત સારા પ્રકારે બનેલી નહોરો, મોરીઓ,
૫. ૩. ગંધી કાઢવાના રસ્તાઓથી યુક્ત ત્રણુ સ્કન્ધવાળા....આહિ અતુથેડાથી ( અત્યારે ) બહુ સારી હાલતમાં છે. તે આ તળાવ રાજ મહાક્ષત્રપ સુગૃહીતનામા—
૫. ૪. સ્વામી-ચાષનના પૈત્ર....નો પુત્ર રાજ મહાક્ષત્રપ, વૃદ્ધ પુરુષો પણ જેના નામને જર્યા કરે છે. એવા રૂદ્રદામાના બહોંતેરમા ( ૭૦+૨ ) વર્ષના—
૫. ૫. માગશાર માસના કૃષ્ણપતિ....મેધના બહુ વરસવાથી પૃથ્વી એક સસુદ્ધ માઝક બની જવાથી ઉર્જાથત ( ગિરનાર ) પર્વતથી સુવર્ણસિક્તા
૫. ૬. પદ્માશિની આહિ નહીએના ખૂબ વધેલા વેગોથી સેતુ ( બંધ )....અતુર્દ્ય અટકાવ કર્યા છતાં પણ પહાડના શિખરો, વૃક્ષો, \*ઉપતદ્વો, દરવાજ અને રક્ષણુ કેવા માટે અતાવેલાં જીવાં સ્થાનોને. નાશ કરી દેવાવાળા, યુગપ્રલય જેવા
૫. ૭. પરમ બોાર વેગવાન વાયુક્ષારા મથાયલા પાણીથી ઝેંકાયેલા અને જર્યેર કરાયેલા પથરો, વૃક્ષો, જાડીઓ, લતાઓના ઝેંકાવાથી ડેઠ નહીનો તળોટી સુંધી ( બંધ ) ઉખડી ગયો હતો. ( તેમાં ) ચારસો વીસ ( વીસ ઉપર ચારસો ) હાથ લાંબુ, એટહુંજ ( ૪૨૦ ) પહોળુ—
૫. ૮. પંચાતેર હાથ ડિકુ ગાખડુ પડી જવાથી બધું પાણી નિકળી જવાને લીધે ( તે તળાવ ) રેતાળ જંગલની માઝક અત્યંત હૃદ્દર્શન ( ખરાણ દેખાવવાળુ ) ....( ૦ )....ને માટે મૌર્યરાજ ચાંદ્રગુમના રાષ્ટ્રીય-સ્ત્રો વૈશ્ય પુષ્યગુપ્તે અનાન્યઃ. અશોક મૌર્યને માટે યવનરાજ તુપાસે પોતાના અધિકારમાં
૫. ૯. ૧૦. જેને નહોરોથી અલંકૃત-શોકાંયું હતું એવું અને તેનો અનાવટમાં રાજાઓને ચોગ્ય બધી ગોઠવણુવાળું, એ ગાખડાની વચમાંથી દેખાતી તળી-નહેરનો વિસ્તૃત બંધ....( ૦ )....ગર્ભથી લઈ અવિહત અને સસુદ્ધિત રાજ્ય-

\* ઉપકામાળ.

લક્ષમીના ધારણુ કરવાના ગુણવાળા હોવાથી બધા વર્ગોએ પોતાના રક્ષણુને માટે પતિ ( રાજ ) તરીકે ચૂંટાયલા હોવાથી, ચુદ્ધ સિવાય મરતાં સુધી-આળુવન મતુભ્યવધ ન કરવાની દઠ પ્રતિજ્ઞાને ચરિતાર્થ કરી અતાવનારા, સામે આવેલા સમોનીયા શરૂને ધા કરીને નકામા શરૂઆ....કરણું ધારણુ કરવાવાળા, પોતાને શરણું આવેલા જનપદ ( દેશ ) ને જીવન અને શરણું આપવાવાળા, બારવઠીયા, સર્પ, જંગલીજંતુ, રોગ જેમને કરી સ્પર્શ્યો નથી એવા, નગર, નિગમ-

૫. ૧૧. અને જનપદોની પોતાના બળથી પ્રાસ, અનુરક્તા પ્રભાયોથી આખાઈ, પૂર્વિકર, પદ્ધતિમાંકર, અવન્તિ, અનૂપહેશ, આનર્ત, સુરાજ્ય, છેષ, મર્દ, કર્ણ, સિન્હુ-સૌરીર, કરુર, અપરાંત, નિષાદ આદિ બધા પ્રદેશોનાં, જે તેના પ્રલાવથી....અર્થ કામ વિષયોના સ્વામી બધા ક્ષત્રિયોમાં પ્રકટ કરેલી—

૫. ૧૨. પોતાની વીર પદ્ધતિના કારણું અલિમાની થયેલા અને ડોઈના પણ કાળ્યમાં ન આપવાવાળા યૈધીયોને જખરજસ્તીથી ઉખાડી નાખવાવાળા, દૃક્ષિણાપથપતિ સાતકણિંનું જે વાર ખૂલ્લી લડાઈમાં જીતવા છતાં નિકટનો સંબંધી હોવાથી પદ્ભષ્ટ ન કરીને યશ પ્રાસ કરવાવાળા....વિજયી, પદ્ભષ્ટ રાજાઓને ફરો સ્થાપન કરવાવાળા, પોતાના હાથને યથાર્થ—

૫. ૧૩. ઝે xઉદ્ધાવીને ( સહા ન્યાયતત્પર રહેવાને કારણું ) દઠ ધર્મતુરાગના અર્જન કરવાવાળા શખદ ( બ્યાકરણ ) અર્થ ( અર્થશાસ્ત્ર ) ગાંધર્વ ( સંગીત ) ન્યાય ( તર્કશાસ્ત્ર ) આદિ મહાવિધાયોનું પારણુ ( પારંગત થવા ) ધારણુ ( સ્મરણુ ) વિજ્ઞાન ( સમજવા ) અને પ્રચોગથી વિપુલ ક્રીતિ પ્રાસ કરવાવાળા, ઘોડા, હાથી, રથ ચલાવવામાં તરવાર હાલના ચુદ્ધ આદિમાં અત્યંત બળ, સ્કુર્તિ, સફ્રાઈ બતાવવાવાળા, દિન પ્રતિદિન ફાન, માન કરવા તથા અનુચિત વર્તાવથી દૂર રહેવાવાળા—

૫. ૧૪. સ્થળ લક્ષ્યવાળા, ઉચિતરૂપે મેળવેલી બલિ ( વિદોટી ) શુદ્ધ ( જગત ), અને લાગ ( રાજ્યનો હજ્જ-કર ) માંથી સોના, ચાંદી, વજ્ઝ, વૈદૂર્ય, રત્નોના હેલા-ઓથી લર્પૂર લંડારવાળા, સ્કુર્ટ, લધુ, મધુર, વિચિત્ર, કાંત શખદ સંકેતોવડે ઉદાર અલંકૃત, ગંધ પદ્ય....લંબાઈ, પહોળાઈ, ઉચાઈ ( સમ ચતુરસ્ક ) સ્વર, ચાલ, રંગ, સાર, બળ આદિ—

૫. ૧૫-૧૬. ઉત્તમ લક્ષણું અને બ્યંજનોથી ચુક્તા, કાંતમૂર્તિવાળા, સ્વયંપ્રાસ ( પોતે મેળવેલું ) મહાકષત્રપ નામધારી, રાજકન્યાઓના સ્વયંવરોમાં અનેક વરમાળાને

x તે વખતમાં રાજ પોતાનો હાથ ઉચ્ચો કરી ન્યાયનો નિર્ણય ruling આપતા હતા.

ધારણુ કરનારા, મહાકૃત્રય દૃદ્રદામાચે હજારો વર્ષને માટે ગોપ્ત્રાધારણુ....ને માટે અને ધર્મ તથા કીર્તિની વૃદ્ધિને માટે, પૌર, જનપદ જનને ( દેશના લોકોને ) કર વિષિ ( વેઠ ) પ્રથ્ય ( = પ્રેમ લેટ-નજરાણુ ) આદિથી પીડિત કર્યો વગર, પોતાનાજ લંડારમાંથી પુષ્કળ ધન વાપરીને થોડાજ વખતમાં ( પહેલાંથી પણ ) ત્રણુગણો મજબૂત અને લંબાદી પહેલાઈવાળો બંધ બંધાવીને બધી તરફથી પહેલાં કરતાં પણ ( તળાવને ) સુદર્શનતર-અધિક સુંદર કરી દીધું.

૫. ૧૭. મહાકૃત્રયના ભતિસચિવ ( સલાહકારક મંત્રીઓ ) અને કર્મસચિવો ( કાર્યકારી પ્રધાનો )—જે બધા અમાત્યગુણોથી ચુક્ત હતા તો પણ—ની, ગાખડુ બહુ મોઢુ હોવાથી આ ( તેને કરી બંધાવવા ) બાણતમાં અતુત્સાહને કારણે સમૃતિ હતી નહીં; પ્રથમમાં તેમનો વિરોધ હોવાથી—

૫. ૧૮. કરીને બંધ બંધાવાની આશા ન રહેવાથી, મળમાં હાહાકાર મરી જવાથી આ સ્થાનમાં પૌર જનપદના અતુચુક્તને માટે, સમસ્ત આનતો ને સુરાજ્ઝના પાલન માટે રાજા તરફથી નિયુક્તા—

૫. ૧૯. પહુલવલતિના કુલૈપના પુત્ર—અર્થ ધર્મ ને વ્યવહારને સારી રીતે જાણવાળા, ( પ્રણનો ) અતુરાગ વધારવાવાળા, શાંત, દાંત ( સંયમી ), અચ્યપલ, અવિસ્તિમત ( અનલિમાની ) આર્ય, અડગ ( લાંચ ન લેવાવાળા ) અમાત્ય સુવિશાયે, સારી રીતે શાસન કરતાં કરતાં—

૫. ૨૦. પોતાના લર્તી ( સ્વામી-રાજા ) ની ધર્મ, કીર્તિ, ને યશની વૃદ્ધિ કરતાં કરતાં બંધાવ્યો. ॥ ઈતિ ॥

## हिन्दी अनुवाद.

- पं. १-२ यह तालाव सुर्दर्शन क्षेत्रिनगर से भी दूर...मिट्टी-पत्थरों की विस्तृत, लम्बी, ऊँची, सन्धि-हीन सब दृढ़ पालियों से बँधा होने के कारण पर्वत के चरणकी प्रतिस्पर्धा करने वाले सुश्लिष्ट...अकृत्रिम सेतुबन्ध से उपपन्न, भलीप्रकार बनी हुई नालियों, मोरियों और मैला निकालने के रास्तों से युक्त, तीन स्कन्ध वाला...आदि अनुग्रहोंसे ( अब ) बड़ी अच्छी हालत में है।
- पं. ३-४ सो यह तालाव राजा महाक्षत्रप सुगृहीतनामा स्वामि चष्टन के पोते ( पौत्र )...बेटे ( पुत्र ) राजा महाक्षत्रप, बुजर्गलोग भी जिसके नामको जपा करते हैं ऐसे, रुद्रदामा के बहतरवें ( ७० + २ ) बरस में—
- पं. ५ मार्गशीर्ष कृष्ण प्रति...बादलके बहुत बरसने से पृथ्वी के एक समुद्रकी तरह होजाने पर ऊर्जयंत् नामक पर्वतसे सुर्वणसिकता—
- पं. ६ पलाशिनी आदि नदियों के बहुत ही बड़े हुए देगोंसे सेतु...अनुरूप, प्रतीकार किये जाने पर भी, पहाड़ के शिखरों, वृक्षों, अट्टालिकाओं, डैपतल्पों, दरवाजों तथा शरण लेनेको बनाये हुए ऊंचे स्थानों का विघ्वंस कर देनेवाले युगनिधन सदृश—
- पं. ७ परम घोर वेग वायुद्वारा मथे हुए पानीसे फेंके गये और जर्जर किये गये...पत्थरों, पेड़ों, झाड़ियों, लताओं के फेंके जाने से ठीक नदी की तलेटी तक उखड़ गया था। बीस ऊपर चारसौ हाथ लंबा, उतना ही चौड़ा—
- पं. ८ पचहत्तर हाथ गहरा दराड़ हो जाने से सब पानी निकल जाने के कारण मरु और बांगर के समान बहुत ही दुर्दर्शन ( बुरा दीखनेवाला )...( १ )...के लिए मौर्यराजा चंद्रगुप्त के राष्ट्रिय ( सूबा ) वैश्य पुष्यगुप्त का बनवाया, अशोक मौर्य के लिए यवन-राज तुषासफने अपने अधिष्ठात्रत्व में जिसे—
- पं. ९-१० नौलियों से अलंकृत किया था ऐसा, और उसकी बनवाई राजाओं के अनुरूप

\* जूनागढ़

† अविदूर-नजदीक अवें। ५८ होने। ज्ञेधतो। होतो।

१ बांध। २ गिरनार। ३ उपरली मंजिलों। ४ अधिकार। ५ नहें।

सब इन्तजामवाली, उस दराड़ के बीच दीख पड़ी नाली से विस्तृत सेतु... ( १ ) ... गर्भ से लेकर अविहत और समुद्रित राजलक्ष्मी के धारण के गुण के कारण सब वर्णों के द्वारा रक्षण के लिए पति ( राजा ) रूपमें वरे गये, युद्ध के सिवाय मरते हम तक कभी पुरुषका वध न करने की अपनी प्रतिज्ञा को सत्य कर दिखलाने वाले, सामने आये हुए बराबर के शत्रुको चोट देकर निकम्मे शत्रु.... करुणा धारण करने वाले, अपने आप शरण में आये झुके जनपदको आयु और शरण देने वाले, डाकू, व्याल, जंगली जन्तु रोग आदि जिन्हें कभी छू नहीं पाते ऐसे नगर निगमों—

- पं. ११ और जनपदोंकी अपने वीर्य से अर्जित अनुरक्ष प्रजाओंसे आवाद पूरबी आकर, पच्छिमी आकर, अवन्ति, अनूपदेश, आनर्त, सुराष्ट्र, श्वभ्र, ( श्वभ्रमति—साबरमती का कांठा ) मरु, कच्छ, सिन्धु—सौवीर, कुकुर, अपरान्त, निषाद आदि.... सब प्रदेशों के जो कि उसके प्रभावसे.... अर्थ, काम, विषयों को.... स्वामी, सर्व क्षत्रियोंमें प्रकट की हुई ( अपनी )
- पं. १२ वीर पदवी के कारण अभिमानी बने हुए और किसी तरह काढ़ न आनेवाले यौधेयों को जबरदस्ती उखाड़ देने वाले, दक्षिणापथपति सातकर्णि को दो बार खुली लडाई में जीत करभी निकट सम्बन्ध के कारण न उखाड़ने से यश प्राप्त करने वाले.... विजय पाने वाले, गिरे राजाओं के प्रतिष्ठापक अपने हाथको यथार्थ—
- पं. १३ रूप से उठा कर (=लगातार ठीक ठीक न्याय करते रहेने के कारण) दृढ़ धर्मानुराग का अर्जन करने वाले, शब्द ( व्याकरण ) अर्थ ( अर्थशास्त्र ) गान्धर्व ( संगीत ) न्याय ( तर्कशास्त्र ) आदि बड़ी बड़ी विद्याओं के पारण ( पारंगत होने ) धारण ( स्मरण ) विज्ञान ( समझने ) और प्रयोगसे विपुल कीर्ति पानेवाले, घोड़े, हाथी, रथ चलाने तलवार ढाल के युद्ध आदि.... अत्यन्त बल फुर्ती, सफाई दिखाने वाले, दिन—ब—दिन दान मान करने तथा अनुचित बर्ताव से परहेज रखने वाले,
- पं. १४ स्थूल लक्षवाले, उचितरूपसे पाई बलि ( मालगुजारी ) शुल्क ( चुंगी ) और भाग ( राजकीय अंश ) से—सोना, चांदी, वज्र, वैदूर्य रत्नों के ढेरों से भरपूर कोश वाले, स्फुट लघु, मधुर, विचित्र, कान्त शब्द संकेतों द्वारा उदार अलंकृत गद्य, पद्य.... लंबाई, चौडाई, ऊँचाई, स्वर, चाल, रंग, सार, बल आदि—

<sup>१</sup> राजा हाथ उठा कर अपना न्याय-निर्णय सुनाता था।

- पं. १५—१६ उत्तम लक्षणों और व्यंजनों से युक्त कान्त मूर्तिवाले, अपने आप पाये महाक्षत्रप नामवाले, राजकन्याओं के स्वयंवरों में अनेक मालायें पानेवाले महाक्षत्रप रुद्रदामाने हजारों बरसों के लिए, गोब्राहण...के लिए और धर्म और कीर्ति की वृद्धि के लिए, पौर जानपद जन को कर विष्टि ( वेगार ) प्रणय ( = प्रेम-भेट के नामसे धनी प्रजासे लिये हुए उपहार ) आदिसे पीडित किये बिना, अपने ही कोशसे बड़ा धन लगाकर थोड़े ही काल में ( पहले से ) तीन गुना दृढ़तर, लम्बाई, चौड़ाईवाला सेतु बनवा कर सब तरफ....पहले से सुदर्शनतर ( अधिक सुन्दर ) कर दिया ।
- पं. १७ महाक्षत्रप के मति सचिवों ( सलाह देनेवाले मन्त्रिओं ) और कर्मसचिवों ( कार्यकारी मन्त्रियों ) की, यद्यपि वे सब अमात्यगुणों से युक्त थे तो भी, दराड के बहुत बड़ा होने के कारण इस विषय में अनुत्साह के कारण सहमति नहीं रही; उनके इसके आरम्भ में विरोध करने पर—
- पं. १८ फिरसे सेतु बन्धने की आशा न रहने से प्रजा में हाहाकार मच जाने पर, इस अधिष्ठान में पौर-जानपदों के अनुग्रह के लिए, समस्त आनंद और सुराष्ट्र के पालन के लिये, राजा की तरफ से नियुक्त
- पं. १९ पहलव कुलैप के पुत्र अर्थ, धर्म और व्यवहार को ठीक ठीक देखते हुए ( प्रजा का ) अनुराग बढ़ानेवाले, शक्त, दान्त ( संयमी ), अचपल, अविस्मित ( अनभिमानी ), आर्थ न डिग सकने ( रिश्वत न लेने ) वाले—अमात्य सुविश्वास ने भली प्रकार शासन करते हुए,
- पं २० अपने भर्ता का धर्म कीर्ति और यश बढ़ाते हुए बनवाया । इति । ”

## English Translation

( Lines 1-2 ) Be it accomplished. This lake *Sudarśana*, from *Girinagara* (*even a long distance ?*).....of a structure so well joined as to rival the spur of a mountain, because all its embankments are strong, in breadth, length and height, constructed without gaps, as they are of stone, (*clay*).....furnished with a natural dam, (*formed by ?*)....., and with well-provided conduits, drains and weirs (?).....three sections.....by.....and other favours is (*now*) in an excellent condition.

( Ll. 3-6 ) This same (*lake*)—on the first of the dark half of *Mārgaśīrsha* in the seventy-second-72nd-year of the king, the *Mahākshatrupa Rudradāman*, whose name is repeated by the venerable, the son of.....( *and* ) son's son of the king, the *Mahākshatrupa* Lord *Chashtana* the taking of whose name is auspicious,.....when by the clouds pouring with rain, the earth had been converted as it were into one ocean, by the excessively swollen floods of the *Suvarnasikata*, *Pulsini* and other streams of mount *Ūrjayat* the dam....., though proper precautions (*were taken*), the water churned by a storm which, of a most tremendous fury befitting the end of a mundane period, tore down hill-tops, trees, banks, turrets, upper stories, gates and raised places of shelter-scattered, broke to pieces, (*tore apart*).....—with stones, trees, bushes and creeping plants scattered about, was thus laid open down to the bottom of the river.

( L. 7. ) By a breach four hundred and twenty cubits long, just as many broad, ( *and* ) seventy-five cubits deep, all the water escaped, so that (*the lake*), almost like a sandy desert, (*became*) extremely ugly (*to look at*).

( L. 8. ).....for the sake of.....ordered to be made by the *Vaiśya Pushyagupta*, the Provincial Governor of the *Maurya* King *Chandragupta*; adorned with conduits for *Asoka* the *Maurya* by the *Yavana* king *Tushāspsha* while governing; and by the conduit ordered to be made by him, constructed in a manner worthy of a king ( *and* ) seen in that breach, the extensive dam.....

(Ll. 9-15).....he who, because from the womb he was distinguished by the possession of undisturbed consummate royal fortune, was resorted to by all castes and chosen their lord to protect them; who made, and is true to, the vow to the latest breath of his life to abstain from slaying men, except in battles; who (*showed*) compassion .....not failing to deal blows to equal antagonists meeting him face to face; who grants protection of life to people repairing to him of their own accord and those prostrating themselves before him; who is the lord of the whole of Eastern *Ākar*, Western *Ākar*, *Avanti*, the *Anūpa* country, *Ānarta*, *Suruśhtra*, *S'vabhra*, *Maru*, *Kachchha*, *Sindhū-Sauvīra*, *Kukura*, *Aparānta*, *Nishāda* and other territories gained by his own valour, the towns, marts and rural parts of which are never troubled by robbers, snakes, wild beasts, diseases and the like, where all subjects are attached to him, (*and*) where through his might the objects of (*religion*), wealth and pleasure (*are duly attained*); who by force destroyed the *Yaudheyas* who were loath to submit, rendered proud as they were by having established their title of heroes among all Kshatriyas; who obtained good report because he, in spite of having twice in fair fight completely defeated *Sātakarni*, the lord of *Dakshināpatha*, on account of the nearness of their connection did not destroy him; who (*obtained*) victory.....; who reinstates deposed kings; who by the customary raising of his hand (*at the time of dispensing justice*) has earned the strong attachment of *Dharma*; who has attained wide fame by studying and remembering, by the knowledge and practice of, grammar, music, logic and other great sciences; who.....the management of horses, elephants and chariots, (*the use of*) sword and shield, pugilistic combat and other.....the acts of quickness and efficiency of opposing forces; who day by day is in the habit of bestowing presents and honours and eschewing disrespectful treatment; who is bounteous; whose treasury by the tribute, tolls and shares rightfully obtained overflows with an accumulation of gold, silver, diamonds, beryl stones and (*other*) precious things; who.....prose and verse, which are clear, agreeable, sweet, charming, beautiful, excelling by the proper use of words and adorned; whose beautiful frame owns the most excellent marks and signs, such as (*auspicious*) length, dimension and

height, voice, gait, colour, vigour and strength; who himself has acquired the name of *Mahākshatrapa*; who has been wreathed with many garlands at the *svayamvaras* of kings' daughters—he, the *Mahākshatrapa Rudradūman*, in order to.....cows and *Brahmaṇas* for a thousand years, and to increase his religious merit and fame—without oppressing the inhabitants of the towns and country by taxes, forced labour and acts of affection—by (*the expenditure of*) a vast amount of money from his own treasury and in not too long a time made the dam three times as strong in breadth and length .....( *on* ) all ( *banks* ).....( *and so* ) had ( *this lake* ) made ( *even* ) more beautiful to look at.

(Ll. 16-20) When in this matter the *Mahākshatrapa*'s counsellors and executive officers, who, though fully endowed with the qualifications of ministers, were averse to the task (*regarded as*) futile on account of the enormous extent of the breach and opposed the commencement (*of the work*), ( *and* ) when the people in their despair of having the dam rebuilt were loudly lamenting, ( *the work* ) was carried out by the minister *Suvīśakha*, the son of *Kulaipa*, a *Pahlava*, who for the benefit of the inhabitants of the towns and country had been appointed by the king in this government to rule the whole of *Anarta* and *Surashtra*, ( *a minister* ), who by his proper dealings and view in things temporal and spiritual increased attachment (*of the people*), who was able, patient, not wavering, not arrogant, upright ( *and* ) not to be bribed, ( *and* ) who by his good government increased the spiritual merit, fame and glory of his master.

## શિલાલેખમાંના વિરોષ નામોની અતુક્મળિકા.

અનૂપહેશા	પંક્તિ ૧૧
અપરાન્તા	” ૧૧
અવનિત	” ૧૧
અશોક	” ૮
આકર	” ૧૧
આનર્ત	” ૧૧, ૧૮
ઉજ્જ્વયત	” ૫
કૃદ્ધ	” ૧૧
કુકુર	” ૧૧
કુલૈપ	” ૧૬
ગિરિનગર	” ૧
ચષ્ટન	” ૪
ચંદ્રગુમ	” ૮
તુષાસ્ક	” ૮
દક્ષિણાપથ	” ૧૨
નિધાદ	” ૧૧
પઢૂલવ	” ૧૬
પલાશિની	” ૬
પુષ્યગુમ	” ૮
મર્દ	” ૧૧
મહાક્ષત્રપ	” ૩, ૪, ૧૪, ૧૭
માર્ગશીર્ષ	” ૫
મૌર્ય	” ૮
યવન	” ૮
યૌધ્યેય	” ૧૨
રૂદ્રદામન	” ૪, ૧૫
વૈશ્ય	” ૮
શ્વાષ	” ૧૧
સાતકણી	” ૧૨
સિન્હુ-સૌવીર	” ૧૧
સુદર્શન	” ૧
સુરાંત્રે	” ૧૧, ૧૮
સુવર્ણસિક્તા	” ૫
સુવિશાખ	” ૧૬

## ચોકળ વિધાનોનો પ્રતિવાદ.

વિલાગ અને.

રદ્રેદામને સુદર્શાન તળાવ બંધાવવામાં

જરા પણુ હિસ્સો પૂર્યો નથી...

“ પ્રાચીન ભારતવર્ષ ” ૨/૧૧ ચાની.

રાજ રૂદ્રદામા, શક્નતિ, રૂદ્રદામાના ઉત્તરાધિકારીએ વિગેરે સંબંધી હુકીકત આપણે પાછલા પ્રકરણોમાં વાંચી, તે સાથે મૂળ શિલાલેખો વિગેરે પણ જોયા.

આ વિભાગમાં રાજ રૂદ્રદામા અને તેની પ્રશસ્તિ સંબંધી કેટલીક ધતિહાસથી વિજ્ઞ અને અસંબંધ હુકીકતો કોઈ સ્થળે આપેખાયલી જોવામાં આવે છે તેનો વિચાર કરવામાં આવ્યો છે.

તેમાં ખાસ કરીને ડૉ. ત્રિલુષ્ણનદાસ શાહના પુસ્તકોમાં મહાક્ષત્રપ રૂદ્રદામા સંબંધી ઘણ્ણા ઉલટા સુલટા વિધાનો મળી આવે છે. તેમાં રૂદ્રદામાને સ્થાને બીજા રાજનોને સ્થાપવામાં આવ્યા છે, અથવા રૂદ્રદામાનું કાર્ય બીજાને નામે ચઢાવી હોવાયું હોય એવાં કથન મળી આવે છે.

આ પ્રકરણુમાં મેટે ભાગે તો અશોક દૈક 'ગિરનાર અડક લેખ' ઉપરના રૂદ્રદામાના લેખ સંબંધી જે ફેરફારવાળી માન્યતાએ છે તે સંબંધીજ વિવેચન કર્યું છે.

એ પ્રશસ્તિ ડેણી છે એ સંબંધી નિર્ણય કરતાં એ પુસ્તકમાં લખવામાં આવ્યું છે—

અત્યારે વિદ્ધાનોની માન્યતા એમ છે, કે આ પ્રશસ્તિ ચષ્ટણુંશી મહાક્ષત્રપ રૂદ્રદામને ડાતરાની છે.

પ્રા. લા. ૨/૧૮૬

આ પ્રશસ્તિ ક્ષત્રિય રૂદ્રદામને લખાવી હતી, એમ અધારી વિદ્ધાનોની માન્યતા થઈ છે. માર્દાં મન્ત્રોથ એમ છે કે તે બધી પ્રશસ્તિ સભાટ પ્રિયદર્શિનની છે.

પ્રા. લા. ૨/૩૦૫

....સુદર્શન તળાવને નાશમાંથી બચાવી લેનાર તરીકે સંશોધકો ક્ષત્રપ સમાટ રૂદ્રદામનને ઠરાવે છે. જ્યારે હું તેનો યશ મહારાજ પ્રિયદર્શિનને અર્પું છું.

પ્રા. લા. ૨/૩૮૨

ગ્રે. પિટરસન સાહેબના મંતવ્યનો સાર એમ છે કે, આ તળાવ પ્રથમ સઓટ ચંદ્રગુણના સમયમાં વિષણુગુસે બાંધાંયું હતું અને તેનો ફરતો કાંડો, સઓટ અશોકના વખતમાં તુપ્સે અથવા તુષુષ્પ નામના અમલદારે પ્રથમવાર સમરાંયો હતો. જ્યારે બીજુલાલાનું સમાર કામ પ્રિયદર્શિનના સમયે કરવામાં આંયું છે. ત્યારે એપ્રિયાર્થીકાના લેખકે તેની યશકીર્તિનો આચો કળશ ક્ષત્રપ દ્રદ્રામનને શિરે ઢોઢ્યો છે. અલભત પિટરસન સાહેબનો અભિપ્રાય ચોખા શાખદમાં મહારાજ પ્રિયદર્શિનની તરફેખુમાં દર્શાવેલો તો નથીજ; પણ તે મતલભનો ભાવાર્થ નિકળતો સહજ તરી આવે છે અરે. છતાં એપ્રિયાર્થીકાના લેખકુથી તો આપણે માનપૂર્વક જુદાજ પહુંચાય છે અને પિટરસન-સાહેબના મતને મળતાં થતું જવું પડે છે.

પ્રા. ભા. ૨/૩૬૩-૪

કોઈ વિક્રિન લાગેજ એમ માનતો હશે કે તે પ્રશસ્તિ મહાક્ષત્રપ દ્રદ્રામાએ કોતરાવી છે. બધાનું એવું જ મંતવ્ય છે કે તે વખતે મહાક્ષત્રપ દ્રદ્રામાનો સૂચો સુવિશ્વાસ સૌરાષ્ટ્રના અધિકાર ઉપર હતો, તેણે એ પ્રશસ્તિ કોતરાવી છે, અને તે સુદર્શન તળાવને અંગે રાજ દ્રદ્રામાના કાર્ય સંબંધી છે.

વળી સંશોધકો ને માને તે કોઈ આધાર ઉપરથીજ માનતા હોય એમ તો માનવું જોઈએ. અને ઉડતી કદ્યનાએ કરતાં સંશોધકોનું મંતવ્ય વધુ વળૂદવાળું હોય છે તે સ્વીકારવું જોઈએ. ને ખરેખર સંશોધકો છે તેમણે એ તળાવને નાશમાંથી બચાવી લેનાર તરીકે દ્રદ્રામાનેજ માન્યો છે. કેવળ કલ્પના કરવાથી એકનો યશ બીજને મળી જતો નથી એ પણ એટલું જ સત્ય છે.

આગળ જઈને પિટર્સન સાહેબને ને બદનાંથી આપવાનો પ્રયાસ થયો છે તે તો ખરેખર બીજાંજવાખદારી ભર્યું પગલું છે. પિટર્સન સાહેબનો ઉધાડો કે ઢાંકેલો કે એવી મતલભવણો મત છેજ નહીં કે ને લેખક મનાવવા મય્યે છે. વળી પિટર્સન જો પ્રિયદર્શીની પ્રશસ્તિ કે તળાવનો ઉદ્ઘાર કર્યાનું માનતા હોત તો તેમને ભામક કે સંદિગ્ધ લખાણ લખવા કરતાં સ્પષ્ટ શાખ્દોમાં શા માટે ન લખત ? પોતાનું મંતવ્ય સૌ કોઈ સ્પષ્ટ શાખ્દોમાં જહેર કરી શકે છે, પરંતુ તેમનો પ્રિયદર્શીની તરફેખુનો મત છેજ નહીં. આપી પ્રસ્તાવનામાં તેમણે એ સંબંધી કશું કહ્યું નથી.

વળી ચંદ્રગુણના સૂચા વિષણુગુમ અને અશોકના તુપ્સ કે તુષુષ્પ હતા એ કોનો મત ? પિટર્સન કે ડૉ. શાહનો ? જો પિટર્સનનો મત કહેતા હોય તો એમ કહેવું જોઈએ કે તે પોતે બીજને નામે અંધેર ચલાવે છે અને જો પોતેજ એમ માનતા હોય તો તે અજ્ઞાન છે. કારણ કે ચંદ્રગુણના સૂચાનું નામ વિષણુગુમ નહીં પણ વૈશ્ય પુષ્યગુમ છે અને અશોકના સૂચાનું નામ તુપ્સ કે તુષુષ્પ નહીં પણ તુષાસફ છે.

ಹಿ + ಪಿಟಸ್ರ್ನನೋ ತಣಾವನಾ ಸಮಾರಕಾಮ ಸಂಖ್ಯಾ ಶೋ ಭತ ಛೆ ತೆ ನೆಇಂಬೆ. ಅಂಬಲಮಾಂ ತೋ ಪಿಟಸ್ರ್ನನೋ ಸ್ವಲಂತ ಡೆಾಈ ಭತಾಜ ತೆಮಣ್ಯು ರಣ್ಣ ಕರ್ತೀ ನಥಿ ಛತಾಂ ತೆಮಾಂ ತಣಾವನಾ ಸಮರಾ-ವನಾರಾ ಖಂಡಾವನಾರಾ ತರೀಡಿ ಸ್ಪಷ್ಟ ಶಾಫ್ಟೋಮಾಂ ಯಂಡ್ರಗುಸ್, ಅಶೋಾಕ ಅನೆ ಇಂದ್ರಧಾಮಾನೇಜ ಭತಾಂಯಾ ಛೆ. ಛತಾಂ ಲೆಖ್ಕ ಥಿಬ್ಜು ನಾಮ ತೆಮಾಂ ಕ್ಯಾಂಥಿ ಉಪಳವಿ ಕೆ ಶೋಧಿ ಶಕ್ಯಾ ಛೆ ಕೆ ತೆವಿ ಭತಲಭನೋ ಭಾವಾರ್ಥ ಕ್ಯಾಂಥಿ ಕಾಳ್ಬೋ ಛೆ ತೆ ಜಣಾಂಯು ನಥಿ. ಏಪಿಥಾರ್ಥಿಭಾನಾ ಲೆಖ್ಕಥಿ ಬ್ರಹ್ಮ ಶಾ ಮಾಡೆ ಪಡ್ಬು ಥಾಯ ಛೆ ತೆನು ಪಣ್ಯ ಕಣ್ಣ ವಣ್ಣಧಾಣು ಸತ್ಯ ಪ್ರಮಾಣು ಭತಾಂಯು ನಥಿ.

ವಣಿ ಶಿಲಾಲೇಖ ಪ್ರಶಸ್ತಿಮಾಂ ಪ್ರಿಯದಶ್ರೀತು ನಾಮ ನಥಿ, ನಿಶಾನ ನಥಿ. ಏರಿಂದ ಪಿಟಸ್ರ್ನನೇ ತೆನೀ ಕಳೆಪನಾ ಕರವಾತು ಕಣ್ಣ ಕಾರಣು ನಥಿ. ಡಂಕಟರ ಮಹಾಶಯನೆ ತೆನು ನಾಮ ಶೋಧಿ ಕಾಳ್ಬಾತು ಕೆ ಉಪಳವಿ ಕಾಳ್ಬಾತು ಮನ ಕೈ ಥಿ ಆಂಯು ತೆ ಕಣ್ಣ ಮುಶಕೆಲ ನಥಿ. ಪರಂತು ಆಧಾರ ವಗರ ಈತಿಹಾಸಮಾಂ ಡೆಾಈ ವಸ್ತು ಉಪಳವಿ ಶಾಕಾಯ ನಿಂಬೋ.

ವಣಿ ಪ್ರಿಯದಶ್ರೀ ಅನೆ ಇಂದ್ರಧಾಮಾನಾ ಸಮಯಮಾಂ ಆಂಕಾಶ ಪಾತಾಣತು ಅಂತರ ಛೆ. ಲಗಳಾಗ ಸಾಡಾತ್ರಣುಸೋ ವರ್ಷತು ಛೆ, ಪ್ರಿಯದಶ್ರೀ (ಅಶೋಾಕ) ಈ. ಪ್ರ. ೨೭೭-೨೪೬ ಮಾಂ ಥಯಾ ಛೆ ಅನೆ ಇಂದ್ರಧಾಮಾ ಈ. ಸ. ಥಿಬ್ಜು ಸಹಿಮಾಂ ಥಯಾ ಛೆ. ಏರಿಂದ ಶು ಪ್ರಿಯದಶ್ರೀ ರಾಜನಾ ವಖತಮಾಂ ಸಾಡಾತ್ರಣುಸೋ ವರ್ಷ ಪಣ್ಯಿ ಥನಾರಾ ಇಂದ್ರಧಾಮಾತು ನಾಮ, ಸಾಲ, ಸಂಕತ ಹಿಂಡಿಕತ ಅನೆ ಘಟನಾಯೋತು ವರ್ಷನ ಕರವಾಮಾಂ ಆಂಯು ಹತು ? ' ಇಂದ್ರಧಾಮಾನಿ ಲ್ಲವನನೀ ಪಣೆಪಣ ಶು ಪ್ರಿಯದಶ್ರೀನಾ ವಖತಮಾಂ ಜಣಾಂ ಗಾಂ ಗಾಂ ಹತೀ ? ಖರೆಖರ ಜೆ ತೆ ಪ್ರಶಸ್ತಿ ಪ್ರಿಯದಶ್ರೀ ರಾಜನಾ ವಖತಮಾಂ ಲಖಾಂ ಹಾಯ ತೋ ತೆಮಾಂ ಇಂದ್ರಧಾಮಾನಿ ಹಿಂಡಿಕತ ಶಾ ಮಾಡೆ ವರ್ಷಾಂ ವಾಧ ಗಾಂ !

† ...But the interest of the inscriptions in our book is confined almost exclusively to the great King Rudradaman. The second inscription gives us more information with regard to this monarch (Rudradaman) than we have for any of other ruling members of his house. It refers to an event which happened, according to the inscription " In the 72nd year of the Mahākshatrapa Rudradāman...the Pahlava minister Suvishākha, son of Kulaipa, undertook the mighty work of restoring the dam ; and the inscription,...tells how this task was by him successfully accomplished.....It is too much to hope that.....the opportunity of serving themselves as heirs in this matter also to Chandragupta, Aśoka, and Rudradāman, by giving the people back their lake ?

Dr. P. Peterson  
Prakrit & Sanskrit Inscriptions  
P. 4-5-6.

સુદર્શન તળાવની મૂળ ઉત્પત્તિ વિષે લખતાં એજ પુસ્તકમાં લેખક લખે છે કે—

“ સમાટ ચંદ્રગુસ પોતાના પુરોહિત-રાજયુર્ ચાણુક્યને લઈને, પોતાના જૈનધમોનુયાથીએ સાથે સંઘ કાઢી, આ પરમ પવિત્ર તીર્થાધરાજના દર્શનાર્થે વારંવાર આવતો. અને ત્યાં આવતા શ્રી સંઘના યાત્રીનોને પાણીની તંગી ન પડે માટે, ગિરિરાજની તળેટીમાં પોતે સુદર્શન તળાવ બંધાંયું હતું . . . . . સુદર્શન તળાવ, કૃષિની શીલવણી અર્થે બંધાવવામાં નહોતું આંયું, પણ પોતાના સહધમી યાત્રાળુએ, છૂટક યા સંઘ કાઢીને આવે, ત્યારે જળની તંગી ન પડે તે માટે, સ્વામીવાત્સલ્યતાની ભાવનાથી પ્રેરિત થઈને તે બંધાંયું હતું. . . . આ ભાખતમાં સુદર્શન તળાવની પ્રશાસ્તિ પોતેજ અખંડનીય અને અતૂઠ પૂરાવો ગણી શકાય તેમ છે.      પ્રા. બા. ૨/૧૮૩-૪-૫.

રાજ ચંદ્રગુપ્તે તે તળાવ શા માટે ને શા હેતુથી બંધાંયું હતું તેની વિગતમાં હું ઉત્તરવા માગતો નથી, ચંદ્રગુસને ચાણુક્ય ત્યાં કયારે ને ડેટલીવાર જાત્રાએ જતા તેના હંડાણું છણુંબટ મારે કરવી નથી અને ડૉ. શાહ જેમ કહે છે તેમ માની લઈએ કે કે લોક્યલ્યાણું કે કૃષિ માટે નહીં પણ તે તળાવ ધાર્મિક લાવનાથી બંધાવવામાં આંયું

### ૫. સ્વામીવાત્સલ્યની

૫ અત્યાર સુધીના ધતિહાસકાર વિદ્યાનોના ભતે તે તળાવના બંધાવવા સંબંધીનો હેતુ કૃષિ-ખેતી વાણીની પ્રગતિનો હોટો. કારણું કે ચંદ્રગુસના વખતમાં ખેતી વિભાગનો ઓર્ઝિસર રહેતો, તે નહોરો, ઝૂવા, તળાવ દ્વારા ખેડુતોને પૂરતું પાણી પહોંચે છે કે નહીં તે તપાસ રાખતો, જ્યાં પૂરતું પાણી ન મળતું ત્યાં નહોરો, તળાવો, સરોવરો, સેતુ-અધો રાન્ય તરફથી ખોલાવવામાં બંધાવવામાં આવતા. ચંદ્રગુપ્તે એવા ધણું સાધોના ખેતીની સિંચાઈને માટે તૈયાર કર્યા હતા. ‘અર્થશાસ્ત્ર’ પણ એ વાતની સાક્ષી પૂરે છે. તેના બીજા અધિકારના ૨૪ અધ્યાયના ૭ માં સુતમાં કુદ્યા શબ્દ દ્વારા નહેરતું વર્ણન કરાયાં છે.

ચેંગાદથેને કહે છે કે—સ્લૂમિના અધિકતર ભાગમાં સિંચાઈ થાય છે, અને એથી એક વર્ષમાં એ વખત વાવેતર પાડ થાય છે.

“ Megasthenes ” Book. I. F. 1.

“ તે અંગળ વધીને એમ પણ કહે છે કે, જેમ ભિસ્ક્રમાં થાય છે તેમ અહીં પણ રાન્યના કર્મ-ચારીએના નદીએનાં નિરીક્ષણ અને જમીનનું માપ વિગેરે કરે છે. તે કોણો નહેરોની દેખરેખ રાખે છે કે એથી મોટી નહેરોનાં પાણી નાની નહેરોમાં થઈને બધા ખેડુતોને સમાનભાગે મળી શકે છે.

“ Megasthenes ” Book. III, F. XXXIV.

“ તેજ પ્રમાણે સુદર્શન તળાવ પણ ખેતીવાણીની સગવડ માટે બંધાંયું હતું એમ વિદ્યાનો માને છે. એક સ્થળે લખ્યું છે કે—

ગિરનાર મેં, જો કાઠિયાવાડ મેં હૈ, એક ચદ્રાન પર ક્ષત્રપ રૂદ્રદામન્ કા એક લેખ ખુદા હુંથા હૈ। ઉસસે વિદિત હોતા હૈ કે દૂરસ્થિત પ્રાન્તોં કી સિંચાઈ પર મૌર્ય સપ્રાદ કિતના ધ્યાન દેતે થે। ..... ઇસ જીલકા નામ સુદર્શન રક્ખા ગયા ઔર ઇસ સે ખેતોં કી સિંચાઈ હોને લગી। બાદકો અશોકને ઇસમેં સે નહરેં ભી નિકલવાઈ।

“ બૌદ્ધકાળીન ભારત ” પૃ. ૧૬૮.

હતું; પણ તે બધી હકીકત માટે પ્રશસ્તિને પૂરાવા રૂપે બતાવે છે ત્યારે તો કહેવું પડે છે કે ડા. શાહ બીલકુલ હંણક ચલાવે છે અને દેખતાની આંખમાં ધૂળ નાખવાનો પ્રયાસ સેવે છે.

ચંદ્રગુપ્તે તળાવ શા માટે બંધાવ્યું હતું કે તેને ઉદ્દેશ શો હતો તે સંખંધી પ્રશસ્તિમાં તો એકે અક્ષર મળતો નથી. પ્રશસ્તિ તે વિગત જણાવતી નથી.

હું તો એમ પણ માનવા તૈયાર થઈ કે ચંદ્રગુપ્તે ત્યાં એક નહીં અનેક તળાવો બંધાવ્યા, અનેક મંહિરો ને ધર્મશાળાઓ બંધાવી, પ્રતિદિન તે જાત્રાએ આવતો અને હામ હામ ને ડામ ધરાવનારા ત્યાં અલકાપુરી વસાવી શકે અને વસાવી હતી એ બધુંચું માની લઇ પરંતુ તેને માટે હકીકતો અને પૂરાવાઓ સત્ય રજુ થવા જોઈએ. ધરીબાર એમ પણ સ્વીકારી લઇ કે આ પાંચમા આરામાં પણ ડા. ત્રિલુલનદાસ શાહને કેવળજીન થયું છે, પણ તેને માટે પ્રમાણ બતાવવાં જોઈએ. પ્રમાણ વગરની કદ્વપના ધર્તિહાસમાં આગેઝી ધર્તિહાસનેજ વિકૃત કરવાનો યતન સેવવામાં આવતો હોય તો તે ધર્તિહાસની દાખિએ હું તો શું કોઈ પણ વ્યક્તિ અસ્વીકરણીય અને અક્ષણતથ્યજ ગણે. તેમ આ પ્રશસ્તિ સંખંધી અવિચારિત જની ગપગોળા હંકવા કોઈ પ્રેરાય તો તે અક્ષણતથ્યજ લેખાય.

અને છતાં તેમની દાખિએ, પ્રશસ્તિમાં ચંદ્રગુમનો જે હેતુ હતો તે હેતુ બતાવતી પંક્તિઓ ડોતરાયલી હોય તો તે પંક્તિ પુસ્તકમાં લખવી જોઈતી હતી અને પ્રશસ્તિમાંથી જે એ પંક્તિ ભળી હોત તો જરૂર ટાંકી પણ હોત.

હવે તે આખા ઘડક લેખને, શિવાને અને અરોકની આજાએને બધાને રાજ પ્રિયદર્શીના બતાવવાનો આડકતરો પ્રયાસ કરતાં લખે છે કે—

જે ખડક ઉપર સમ્રાટ પ્રિયદર્શીનો લેખ ડોતરાયલ છે અને જેને ગિરનાર રોક એડિક્ટ=ગિરનારના ઘડકલેખ તરીકે ઓળખાવાય છે. તેજ ઘડક ઉપર આ સુદર્શન તળાવની પ્રશસ્તિ ડોતરાવાઈ છે. અત્યારે વિક્રાનેની માન્યતા એમ છે, કે આ પ્રશસ્તિ ચંદ્રભૂવંશી મહાક્ષત્રપ રદ્રવામને ડોતરાવી છે.

પ્રા. ભા. ૨/૧૮૬.

ડૉ. મહાશય આનો શો અર્થ કરશો ? છતાં એમ માની લઘુએ કે, તે કૃષિ માટે નહોતું. પરંતુ તેને માટે તેમની પાસે કશું સાધન છે ? કે કોઈ પ્રમાણ છે ? અથવા કૃષિ માટે તે તળાવ બંધાવ્યું હોય તો તેમને એમ માનવામાં વાંધો શો આવે છે કે તે તેમને કૃષિ માટે આસ નિષેધ કરવો પડે છે. શું કૃષિ એ દેશને માટે, રાજ્યને માટે કે ચંદ્રગુમને માટે ધાતક વરતુ હતી ? કે ચંદ્રગુમને એ અણુગમતી હતી ? વળી તે તળાવમાં પાછળથી નહોરો જોદાવી હતી એ શા માટે ? નહોરો વગર લોકોને પાણી પીવામાં વાંધો આવતો હતો ? કે નહોરો વગર સ્વામિવાત્સલ્યની ભાવનાને બાધા પહોંચતી હતી ? ડૉ. મહાશય પાસે ધર્તિહાસકારોને જવાબ આપવા માટે કશા પ્રમાણો છે ખરાં ?

ઉપરના અવતરણુમાં ખડક ઉપરનો લેખ અને આખી ખડકને પ્રિયદર્શી રાજની જણ્ણાવે છે. સાથે સાથે બીજાજ વાક્યમાં લખે છે કે તેજ ખડક ઉપર આ સુદર્શન તળાવની પ્રશસ્તિ કોતરાયલી છે. તેથી એમ તો સમજાયું કે આ પ્રશસ્તિ અને પ્રિયદર્શીની લેખ ડા. શાહના મતે પણ બન્ને લિખ ચીજે તો થઈ.

એથી શું લેખકનો એમ કહેવાનો આશય છે કે તે અશોકનો શિલાલેખ અને સુદર્શન તળાવની પ્રશસ્તિ બન્ને પ્રિયદર્શી રાજની છે ?

અને જો એમ માનવા તૈયાર હોય તો તેમણે અશોક અને પ્રિયદર્શીની લિખ માનવાની આખા પુસ્તકની બાળજ ઉંઘી વળી જાય છે. કારણ કે ઈતિહાસમાં અશોક ને પ્રિયદર્શી બન્ને એકજ છે છતાં તે એ લિખ છે એમ લખીને ડા. શાહે પાનાના પાના લખ્યાં છે તે તેમનાંજ આ વચનથી અસત્ય હરે છે અને પોતાનીજ કુહાડી પોતાના પગપર પડે છે.

હવે રહી પ્રશસ્તિની વાત. અને તે ચાષનવંશી મહાક્ષત્રપ ઝરદામાની છે એ એક ને એક એ જેવી સત્ય હકીકત છે.

પં. ૬ મીનો સંબંધ બીજા રાજને લાગુ કરતાં તેનું કે વિવેચન કર્યું છે, અને રાજ પ્રિયદર્શી સાથે તેનો સંબંધ વળગાડ્યો છે ને જે સિદ્ધાંતો ખાંધ્યા છે તેના ઉપર મારે વર્ણન કરવું બહુ જરૂરી નથી, છતાં જો તેના વર્ણનમાં ઉત્તરવામાં આવે તો લેખકના ટાંગા તેમનાંજ ગળામાં આવી પડે તેમ છે.

પ્રશસ્તિ પ્રિયદર્શી રાજની છે એમ ખતાવવા એક બીજી યુક્તિ લેખક આપે છે કે—

“આઠમી પંક્તિમાં મૈર્યાવંશી સમાટ ચંદ્રગુમ અને તે બાદ સમાટ અશોક પરતે ઉલ્લેખ કરેલ છે, અને પછી જગ્યા ખાંદી આવે છે, એટલે સ્વાસ્થાવિક છે કે એક પછી એક ગાઢીએ આવનારતું-સમાટતું વર્ણન કરવાનો શિરસ્તો હોઇને સમાટ અશોક પછી તેની ગાઢીએ આવનારનેજ લગતું તે ખ્યાન હોઈ શકે.

પ્રા. લા. ૨/૩૬૪-૫.

ઉપરના અવતરણુમાં મારીમચડીને પ્રશસ્તિમાં પ્રિયદર્શીતું નામ કલ્પવાનો પ્રયાસ કર્યો છે પણ તેમ કરતાં તે કેટલાં અસત્ય આદેખે છે તેનો ખ્યાલ નથી આવ્યો.

ઉપરનાજ અવતરણુમાં ડા. ભૂલથી કે એધ્યાનથી અશોક અને પ્રિયદર્શીની એક-તાને સ્વીકાર કરી ગયા. અહીંયા પ્રિયદર્શીને અશોક પછી ગાઢીએ આવ્યાતું માને છે. ( વાસ્તવમાં તે બન્ને એકજ છે ) પરંતુ અસત્ય-અસંભવ અસત્ય તો એ આદેખાયું છે કે રાજ બિન્હુસારને આખાને આખા જાહી મંત્રથી ગાડુરી જેમ સાપને સંતાડે તેમ હડાડી હીધા. એક પછી એક ગાઢીએ આવ્યાતું પ્રશસ્તિમાં વર્ણન માની શું ચંદ્રગુમ

પછી તરતજ અશોક ગાહીએ આવ્યા છે ? અથવા ડા. શાહ અશોકને ચંદ્રગુમનો પુત્ર માને છે ? આ અજ્ઞાનનો કોઈ સીમા છે ખરી ? અશોક અને ચંદ્રગુમના રાજ્યકાળની વર્ણે ચંદ્રગુમના પુત્ર અને અશોકના પિતા બિન્ડુસાર ક્યાં ગાયથ કરી નાખ્યા ? કે ડાક્ટરના મતે બિન્ડુસાર નામની કોઈ વ્યક્તિ થઈજ નથી અને બીજા સ્થળોમાં બિન્ડુસારની હકીકતો આવેણી છે તે અસત્ય છે ? અને બિન્ડુસાર જેવી કોઈ વ્યક્તિ થઈ હતી તો અને અનુક્રમવાર વર્ણનનો શિરસ્તો માન્યો તો ત્યાં બિન્ડુસારનું વર્ણન પ્રશસ્તિમાં કેમ ન આવ્યું ? શું બિન્ડુસારની આખી હકીકત અને ધતિહાસને લેખક ઉદ્ઘાટી હેવા માણે છે ? અને ચંદ્રગુમને પછી તેની ગાહીએ સીધા અશોકને બેસારી હે છે ?

બોલુ વાત, લેખક આમ શિરસ્તો શખ્ષ વાપરી સમાટ અશોક પછી તેની ગાહીએ ગ્રિયદશાનીને ઉત્તરાધિકારી તરીકે મનાવવાનો હરાદો રાખે છે.

શિલાલેખમાં જ્યા ખાલી પડી છે તે એટલા માટે નહીં કે ત્યાં કોઈના નામ કોતારાવવાના હોય, પરંતુ તે જ્યા તો ખાલી એટલા માટે હેખાય છે કે એકતો શિલા ખાડા ખડીયાવાળી હોય ને અક્ષરો ન લખી શકાય તેવી જ્યા હોવાથી જ્યા ખાલી રાખવી પડે છે. અથવા કોઈ અક્ષરો લખાયા હોય પરંતુ વણત જતાં, પવન પાણીના ધસારાથી અક્ષરો ધસાઈ ગયા હોય તો જ્યા ખાલી હેખાય પરંતુ તેમાં શિરસ્તાનું કશુ કારણું નથી.

“ આગળ જતાં એમ નિર્દેશ કરેલ છે કે, “ પૂર્વ તથા પાશ્ચમ આકરાવંતિ, અનૂપદેશ, આનર્ટા....વિગેરે દેશો તેણે પોતાના બાહુભળથી તાણે કરી લીધા હતા.”

ક્ષત્રપ દ્વદ્દામને પોતાના બાહુભળથી ધણા દેશો જીતી લીધા હતા તે આપણે ભલે કણૂલ રાખીએ, ( જેકે આપણી આ માહિતિનો આધાર પણ સુખ્યત્વે કરીને તો આ સુફર્શન તળાવનો સંશયાત્મક લેખક જ છે ) તો એટલું તો ચોક્કસ જ છે કે, આવા વિસ્તૃત પ્રદેશ ઉપર તેણે કદ્દી સત્તા જમાવીજ નહોતી. જે કોઈ ઉપરમાંના કેટલાક પ્રદેશો અથવા પ્રદેશ ઉપર તેનું આધિપત્ય ઉત્તર હિદમાં હતું તે તો તેના પિતા અથવા દાદા તરફથી વારસામાં જ મળ્યા હતા, એટલે તેણે બાહુભળથી જીત્યા હતા એમ નજ ગણ્યાય. પ્રા. લા. ૨/૩૬૫-૬.

ઉપરના અવતરણમાં દેશો ગણ્યાવતાં પૂર્વ આકરાવંતિ અને પશ્ચિમ આકરાવંતિને દેશ ગણ્યા છે, તેમ કરવામાં આકુર અને અવંતિનો લેદ પરખાયો નથી. ખરી રીતે તેનો પદ્ધચેદ પૂર્વઆકુર, પશ્ચિમઆકુર અને અવંતિ એ પ્રમાણે દેશો અલગ પાડવાના છે. આકુર પણ દેશ છે ને અવાનિત પણ દેશ છે.

વળી દ્વદ્દામાની પ્રશસ્તિને લેખક સંશયાત્મક લેખ માને છે. એટલે એ પ્રશસ્તિને પ્રમાણ તરીકે તો માનતાજ નથી. જ્યારે એ લેખ સંશયાત્મક છે તો પછી અખંડ ને અતૂટ પૂરાવો શી રીતે ગણ્યાવ્યો છે ? કે પોતે ધારે તે પ્રમાણે ને પોતાની કલ્પના પ્રમાણે

પ્રશસ્તિને અતૃપુરાવા તરીકે અને સંશ્યાત્મક લેખ તરીકે ગણુવા તૈયાર થાય છે ? ઐતિહાસિક પ્રમાણેને પણ આમ પોતાની કલ્પના પ્રમાણે વાળવાનો આ ધૃપુ પ્રયત્ન નથી કે ?

વળી એક તરફ ઉપરના પ્રદેશો પોતાના બાહુભળથી ઝડપામાચે જીતી લીધા અને એજ વાક્યમાં લખે છે કે આવા વિસ્તૃત પ્રદેશો ઉપર તેણે સત્તા જમાવીજ ન હતી. તેણે પ્રદેશો જીતી લીધા અને સત્તા જમાવી નહોતી એમ કહીને લેખક શે આશાય જતાવવા માણે છે ?

વળી તે પ્રદેશો તેને વારસામાં મળ્યા હતા એમ કહીને તો ગજબજ કર્યો છે. એક તરફ લખે છે કે તેણે સ્વખળે જીતી લીધા અને બીજુ તરફ લખે છે કે તેને વારસામાં મળ્યા હતા. આ ચતુર્મુખ વાહી વહી શે અર્થ કાઢવા વિચાર રાખે છે ?

૩૬૪ ધૃપુ ઉપર તો લખ્યું છે કે “હવે આપણે ઐતિહાસિક પૂરાવાથી જાણીએ છીએ કે ઝડપામનના પિતામહ ચંદ્રણુ મહાક્ષત્રપે જે જે મુલકો જીતી લીધા હતા, તેમાંને મોટો ભાગ, તેના પિતા જયદામને શુમાવી દીધે હતો.”

આ કથન અને પૂર્વ અવતરણનો મેળા શી રીતે બેસારશે ? એક તરફ દાદાની મિલકત બાપાએ શુમાવી દીધી અને બીજુ તરફ બાપદાદાની મિલકત વારસામાં મળી આ મુખમસ્તીત વક્તવ્યં દરશાવ્યા હરીતકી જેવું નથી લાગતું ?

લેખક આગળ જતાં દિવ્યચક્ષુથી પ્રશસ્તિમાં શાલિશુક્તનું નામ શોધી કાઢે છે. પહેલાં પ્રિયદર્શીના નામની શોધ કરી હવે શાલિશુક્તના નામની શોધ કરે છે. અને લખે છે કે—

“વળી સુદર્શન તળાવની પ્રશસ્તિમાં શાલિશુક્તનું નામ લેડાયલું છે.”

પ્રા. લા. ૨/૩૬૬.

અને આ શાલિશુક્તનું નામ ગોતવા માટે બુદ્ધિ પ્રકાશ માસિક અને દી. બ. કેશવલાલ ધ્રુવની આડ ભતાવી છે.

ઉપરનું લખાણ વાંચીને રહેકે એમ કહેવાનું મન થઈ જાય છે કે લેખકે પ્રશસ્તિ વાંચી જોઈ છે ખરી કે એમને એમ ધંદેડયે રાખ્યું છે ? એર આથી એ વસ્તુ સિદ્ધ થઈ શકે છે. એક તો લેખકે મૂળ પ્રશસ્તિના સ્વયં દર્શન નથી કર્યા લાગતા. અને બીજું ‘બુદ્ધિપ્રકાશ’ કે દી. બ. ધ્રુવનું લખાણ કોઈ વેનમાં વાંચ્યુ લાગે છે.

હકીકતો એમ છે કે પ્રશસ્તિમાં શાલિશુક્તનું નામનિશાન નથી અને દી. બ. ધ્રુવનું પણ જેવું કથન નથી. શ્રીમાન ધ્રુવનું શાલિશુક્ત સંખ્યાધી લખાણ પ્રશસ્તિ સાથે સંખ્યાંધ રાખતું  
૧૦

નથો, તેમનું લખાણ તો શાલિશુક સંપ્રતિનો લાઇ છે એ બતાવનાડું છે. શાલિશુક સંપ્રતિનો લાઇ હોય કે ગમે તે હોય પણ તેનો સંબંધ પ્રશસ્તિ સાથે જોડવામાં અને તે સાથે હી. બ. મુલને ઘસડવામાં કરી સાર્થકતા નથી. શાલિશુક સંપ્રતિનો લાઇ થાય છે કે પુત્ર થાય છે એ ચર્ચવાનો અહીં વિષય નથી. વિષય-મુદ્દો તો શાલિશુકનું નામ પ્રશસ્તિમાં છે કે નહીં તે ચર્ચવાનો છે. શ્રીમાન् મુલનું લખાણ એ સંબંધી કાંઈ જણ્ણવતું નથી, એટલે તે આધાર નકર્મો છે. હા, જો \*મુલવસાહેબ પ્રશસ્તિમાં શાલિશુકનું નામ બતાવવામાં એકમત થતા હોત તો તો તેમનો હવાલો પણ આપવો વ્યાજણી હતો, આ તો મુખ્યથી કલકત્તા જવા માટે અમહાવાહની ગાડીમાં બેસવા જેવું કર્યું છે.

લેખક પ્રશસ્તિના એ વિલાગ પાડતાં જણુવે છે કે—

“ પ્રશસ્તિના એ વિલાગ છે. ઉપર પ્રમાણે પ્રશાસના કરતા વાક્યવાળો ભાગ અને ભીજો તુલના કરી બતાવતો ભાગ. બન્ને ભાગની લિપિ પણ બુઝી પડતી હેખાય છે. એટલે સાખીત થાય છે કે, બન્ને ભાગને ડેાતરવાનો સમય લિન્ન લિન્ન હોવો જોઈએ. પ્રથમનો ભાગ.....શાલિશુકે ડેાતરવેલ છે, જ્યારે દ્વિતીય અને અંતનો ભાગ દૃદ્રદામને ડેાતરાંયો હેખાય છે.

પ્રા. લા. ૨/૩૬૬.

ઉપરના એકજ અવતરણુમાં એક વળત પ્રશસ્તિના એ ભાગ જણુંયા અને તેમાંજ કરીને ત્રણ વિલાગ જણુંયા, પરંતુ કેટલી કેટલી પંક્તિના એ વિલાગ ગણવા તે બતાયું નહીં. સાથે સાથે તેની લિપિ પણ લિન્ન લિન્ન બતાવી છે. લેખક પેતા સ્કન્ડગુમના લેખને અને આ પ્રશસ્તિને એક તો નથી ગણ્ણી લેતાને ? વળી લિપિના જ્ઞાન વગર લિપિની પરીક્ષા કરવા નિકળ્યું એ અનધિકાર ચેદા નહીં તો બીજુ શું ? આખી એ પ્રશસ્તિ અખંડ ને એકજ છે તેના એ કે ત્રણ વિલાગ નથી, તેમ લિપિ એકસરખી છે ભાષાની છટા ને શૈલિ એક સરખી છે.

બીજુ વિચારવાની વાત તો એ છે કે પ્રિયદર્શી કે શાલિશુકના વળતમાં સંસ્કૃત ભાષામાં શિલાદેખો કે પ્રશસ્તિએ લખાતી હતી કે કેમ તેનું પણ જ્ઞાન લેખકને છે ખર્દું ? દૃદ્રદામાની આ પ્રશસ્તિ લખાયા પહેલાંના સંસ્કૃતમાં લખાયલો શિલાદેખ મથુરાના

\* હી. બ. મુલને સ્વરૂપ રાણું ને બદલે સૌરાષ્ટ્ર સુધારી શાલિશુકનો સંબંધ સૌરાષ્ટ્ર સાથે જોખો છે પણ તે વિચારણીય છે. શાલિશુકનો સૌરાષ્ટ્ર સાથે કશો સંબંધજ નહોતો, તેની સત્તા પણ ત્યાં ન હતી. બીજા પણ યુગપુરાણ માં અર્દતેનું અર્દયન, કેતતિ (હત્વ) તું સંપ્રતિ વિગેરે સુધારા કર્યા છે તે ચર્ચવાનો આ પ્રસંગ નથી, છતાં એ ‘સૌરાષ્ટ્ર’ ને ‘સંપ્રતિ’ ના સુધારાથી ડા. શાહ શાલિશુકને સૌરાષ્ટ્રમાં માનવા લલચાય કે પ્રશસ્તિમાં ધુસાડવા ભથે તો તે મિથ્યા પ્રયાસ છે.

એક નાના ખ્યાલુપના લેખ સિવાય ઈતિહાસમાં એકે હજુ મળ્યો નથી. ડા. શાહ પ્રિયદર્શી રાજના વખતમાં લખાયલો સંસ્કૃત શિલાલેખ મેળવી શક્યા છે જરા? આમ ઉટપરાંગ વાતોની લખી છે કે ઈતિહાસથી કાંઈ વિચાર પણ કર્યો છે ખરા? ઇન્દ્રદામાના આ લેખના એ કે તણું લાગ પાડવા, તેનો લિખ કાળ ગણુંબો, કે લિપિલેદ ગણુંબો એ સંભવિતજ નથી છતાં એમ માની લઈએ તો પણ તે લેખની ત્રીજી ને ચોથી પંક્તિમાં મહાક્ષત્રપ ચણનું અને શાલિશુકે ને બદલે ઇન્દ્રદામાનું નામ લણાયું છે, શક સંવંત આપ્યો છે તો એ પ્રથમ લાગ કેનો ગણુંબો? તેની ૧૧, ૧૨, ૧૩, અને ૧૪ મી પંક્તિમાં તેની બળશક્તિનું વર્ણન કરી એ બળ શક્તિના પરિણામે \*મહાક્ષત્રપની પદવી ધારણું કર્યાનિ પંદરમી પંક્તિમાં ઉલ્લેખ છે અને તેજ પંક્તિમાં મહાક્ષત્રપ ઇન્દ્રદામાનું નામ છે તો તે વચ્ચેલો લાગ કેનો સમજવો? તેની સત્તરમી પંક્તિમાં મહાક્ષત્રપ શખદ પડેલો છે ને ૧૬ મી પંક્તિમાં તેના સૂધા સુવિશાખનું વર્ણન કરેલું છે તો તે અંતનો લાગ કેનો સમજવો? એમ પહેલા બીજા ને બીજા લાગ (કરીએ તો) માં ઇન્દ્રદામાજ જ્યાં હોય ત્યાં હોયાય છે અને શાલિશુકેનું તો નામનિશાન નથી. શું શાલિશુકે પોતાને બદલેજ લવિષ્યમાં થનારા ઇન્દ્રદામાનું નામ લખ્યું? શાલિશુકેની કલ્પના લેખકને આવીજ શી રીતે તે સમજું શકાતું નથી.

વળી આગળ જતાં લેખક લગે છે કે—

“ સુદર્શન તળાવની પ્રશસ્તિનો પ્રથમ લાગ મહારાજ પ્રિયદર્શીને જ લગતો છે.  
પ્રા. લા. ૨/૩૬૬.

“ ઇન્દ્રદામન અને સંપ્રતિના સમય વચ્ચે લગભગ ૩૦૦ વર્ષનું અંતર છે. એટલે જનતામાં દંતકથારૂપે પણ લોક કલ્યાણુના આવાં કાર્યો વિષેની હકીકત કણોપકર્ણ તરવરતી રહ્યાંજ કર્યી હોય, કે કે ઉપરથી આવા મહાન મૌર્યવંશી સંઆટના સત્કાર્યેનો. ઉલ્લેખ કરવાનું મન, રાજ ઇન્દ્રદામનને થઈ આવ્યું પણ હોય. અને કેંથી એક પછી એક સંઆટના કાર્યોનું નિવેદન કર્યું હોય; અને તેમની નામાવળીમાં પોતાનું નામ પણ ગૌરવવંતુ-શોભતું કરવા માટે, તેણે એમ દર્શાવવા ઈચ્છિત ધાર્યું હોય; એટલે ઉપરના બધા સંગ્રહો કે કેચ્યાએ અન્ય દેશો સ્વયંગે છુટી લીધા હતા, તેમની માર્ક હું પણ આવો છું અને મેં પણ ઈત્યાદિ ધૃત્યાદિ કામો કર્યો છે, તેટલું જણાવવા પૂર્તો તેનો હેતુ હોય. આમ સુંગો મહિમા ધૃત્યાદિ કામો કર્યો છે, તેટલું જણાવવા પૂર્તો તેનો હેતુ હોય. આમ સુંગો મહિમા વધારવાનો પોતાનો હેતુ નજ હોત તો રાજ ઇન્દ્રદામને પોતાના કાર્યો બુદ્ધિજ ણડક શિલા ઉપર કોતરાવ્યાં પણ હોત, પણ એકજ શિલા ઉપર કોતરાવેલા હોઈને તે સરખામણી કરવા માટેજ છે એમ આપણું અતુમાન દઠીભૂત થાય છે.”

પ્રા. લા. ૨/૩૬૭.

\* બૌદ્ધકાળીન ભારત. પૃ. ૩૩૦

\* ૧૫-સ્વયમધિગતમહાક્ષત્રપનામના મહાક્ષત્રપેણ રૂદ્રદામના.

આ પારિથાઇ લખીને તો ડૉક્ટર શાહે હુદ્ગ વાળી છે. ઝુદ્રદામાચે જે વિશાળતાથી ને હુદ્ધયની ઉદ્ઘારતાથી ખીણના નામો પોતાની પ્રશસ્તિમાં કોતરાવ્યાં છે તેને ડૉક્ટર મહાશય સ્વાર્થ, પાણંડ ને કૌલાંડ તરીકે ઓળખાવે છે. આ અનુનની પરાકાષ્ઠા નહીં તો ખીણું શું ?

એક તરફથી કહે છે તે પ્રશસ્તિ ઝુદ્રદામાચે કોતરાવી નથી, ખીળ વખત કહે છે ઝુદ્રદામાચે પ્રશસ્તિ કોતરાવી તો ખરી પણ અદ્ધી શાલિશુકે અને અદ્ધી ઝુદ્રદામાચે કોતરાવી, વળી નીળ વખત કહે છે કે પ્રશસ્તિ તો ઝુદ્રદામાચેજ કોતરાવી પણ તે મૌર્ય-વંશી રાજાઓની દંતકથાથી આકર્ષાઈને તેમનાં સતકાર્યોનો ઉલ્લેખ કરવાનું તેને મન થઈ આવ્યું માટે કોતરાવી. આવો અસંખ્ય પ્રલાપ કરવાનો હેતુ શો હશે તે તો લેખક જણે પણ એ ઈતિહાસનો મોટામાં મોટા દોહ છે એ તેમણે સમજુ લેવું ધટે.

મૌર્ય સામ્રાટુની દંતકથાઓથી આકર્ષાઈને તેમના કાર્યોનો ઉલ્લેખ કરવા માટે એ પ્રશસ્તિ કોતરાવી હોય એમ માનવામાં આવે તો શું મૌર્ય સામ્રાટુનું આ તળાવ બંધાવ-વાનું એકજ સતકાર્ય ઈતિહાસમાં મળ્યું છે શું ? આમ લખીને મૌર્ય સામ્રાટુની મહત્ત્વાની વાચવા માગે છે કે તેમના ઈતિહાસને કલાંકિત કરે છે. કારણું કે આ પ્રશસ્તિ તો સુદર્શન તળાવની છે. કોઈની જોટી કીર્તિ વધારવા જતાં તેને અદ્ધનામ કરાય છે કે ગુણ ગવાય છે ?

વળી ઝુદ્રદામાનો શિલાલેખ તે હોત તો તેણે જુહાજ ખડક ઉપર કોતરાવ્યો હોત એમ લખીને લેખક એમ અતાવવા માગે છે કે સ્કેનન્ડગ્યુમનો તેજ ખડક ઉપર શિલાલેખ છે તે પણ રાજ પ્રિયદર્શીનોજ છે ? કારણું કે સ્કેનન્ડગ્યુપ્તે પણ ખીણે ખડક શોધ્યો નથી. તેણે પણ અશોક રોક ઉપરજ પોતાનો લેખ કોતરાવ્યો છે. સૌ સૌના ખડકો જુહાજ હોયા જોઈએ એવો કાંઈ નિયમ છે ? જ્યાં કોતરવા લાયક જગ્યા મળી જય ત્યાં શિલાલેખ કોતરી શકાય. પરંતુ તેથી કોઈના ધરમાં કોઈનો સામાન મૂડી રાખે તો તે સામાન ધરધણીનો થાય નહીં. આવી બાલિશવૃત્તિઓ હું છોડી હેવી જોઈએ.

“ પંક્તિ નવ અને દશમીમાં જે લખાયા વિનાનો ભાગ રહી ગયો છે, તેમાં મહારાજ પ્રિયદર્શીનિનું નામજ હોવું જોઈએ. કારણું કે તે સામાદ અશોક પછી તુરતજ રાજ્યાડદ થયેલ છે.

પા. લા. ૨/૩૬૭.

આગળ હું કહી ગયો કે પ્રિયદર્શી એ અશોક પછી ગાદીએ આવનાર જુદ્દો કોઈ રાજાજ નથી પણ અશોક પોતેજ પ્રિયદર્શી તરીકે ઓળખાતો હતો. અર્થાતુ પ્રિયદર્શી એ ઈંઅશોકનુંજ ખીણું નામ છે લેખકે ૨/૨૮૨ ઉપર તેની બિજીતા વિષે

\* પા. લા. ૨ પૃ. ૩૬૭ ઉપર સમુદ્રગ્યુમનો શિલાલેખ એ પ્રમાણે લખ્યું છે તે જોડું છે. સ્કેનન્ડગ્યુમ જોઈએ.

૬ લેખક સંપ્રતિ ને પ્રિયદર્શી માનતા હોય તો તે બમ છે.

લાંબુ વિવેચન કર્યું છે તે નિર્ણયક છે. હવે વિચાર કરીએ કે-પ્રિયદર્શીને એજ અશોક હોય અને તે ધર્તિહાસથી એમજ સિદ્ધ થાય (છે) તો તે પ્રશ્નિને દૃદ્રદામાની પ્રશ્નિ ગણુવામાં વાંધો ખરો કે ?

આગળ જતાં લખે છે કે

“ આ સધાનાં મહારાજ પ્રિયદર્શીનાંજ યશોગાન રૂપે વિશેષણૂં છે; તે સર્વ ભાગ, તેના નામનેજ સમયપણે લાગુ પડી શકે તેવાં છે. બીજા કોઈ રાજને સમય દીતે અને સર્વાંગે લાગુ પડે તેવાં નથી, તેમ લાગુ પડતાં પણ નથી.      પ્રા. ભા. ૨/૩૬૭

ઇતિહાસમાં પણ શું ત્રાગા મંડાય છે કે ? પેલા ઇકીરો દુક્ખાન ઉપર ત્રાગા માંડે ને કહે કે તમારી ઈચ્છા હોય કે ન હોય પણ અમને આપો. તેમ આ પણ એવોજ ભરાખર તાત છે. ધર્તિહાસમાં એ હુકીકત હોય કે ન હોય, પણ તે પ્રશ્નિની છે એમ મનમાનતું કરી મનાવવાતું આ પણ એક ત્રાગુ છે; પણ એમ ત્રાગા માંડયે ઈતિહાસ કશુજ મનમાનતું કરી આપવાનો નથી. તે પણ જગતાનું મહાવીર જેટલોજ નિષ્પક્ષ ને વીતરાગ છે.

ચંદ્રગુપ્તના સૂખા સુવિશાખને તેનો \*સાગો હોવાની કલ્પના કરતાં લખે છે કે-

“ ઉપરનાજ સુદર્શન તળાવની પ્રશ્નિનિમાં ચંદ્રગુપ્ત રાજ્યે ને અધિકારીએ તે તળાવ બંધાંયું છે, તે અધિકારી સંઘાટનો સાગો થતો હતો એમ લેખાય છે. અને તે અધિકારી વિજાતીય હોવાતું ધરાયું છે. પણ આ વિજાતીય હોવાતું મુખ્ય કારણ તો તે અધિકારી પદ્ધતિ જાતિનો હોવાતું પોતે જણાયું છે; અને આ પદ્ધતિને ધરાનના પહૂલવાજ જાણી વિજાતીય ઠરાવી દીધો છે. બાકી ખરીરીતે તો તે પદ્ધતિ ક્ષત્રિયોજ છે.

પ્રા. ભા. ૨/૨૮૨.

સુદર્શન તળાવની પ્રશ્નિ ને મહારાજ પ્રિયદર્શીનના સમયના કોતરાયેત ખડક લેખ ઉપર ( .... ) જળવાએ રહેલી છે. તેમાં તે તળાવ પ્રથમ ચંદ્રગુપ્તના સમયે બંધાવેલું હતું.... તે સમયે તેના બાંધકામ ઉપર હેખરેખ રાખનાર સંગ્રહ ચંદ્રગુપ્તનો સૂખો સુવિશાખ હતો. આ સૂખાને પદ્ધતિ જાતિનો હોવાતું તેમાં કોતરાવાયું છે.

પ્રા. ભા. ૨/૧૮૬.

ડે. આં. રે. પ્રસ્તાવના પુ. ઉરમાં રેખસનની માન્યતા સુજણ આ સુવિશાખને દૃદ્રદામન ક્ષત્રિયનો સૂખો ઠરાવાયો છે....પણ તેમાં સાંક લખ્યું છે કે....અશોકના સૂખા વિશાખે તે સમરાંયું હતું.

પ્રા. ભા. ૩/૨૮૬.

\* પુરાતત્ત્વ પુ. ૧, પુ. ૧૪ ઉપર હીરાલાલ ત્રિભુવનદાસ પારેએ “ આપણું ઈતિહાસિક સાહિત્ય ” ના મથાળાનાળા લેખમાં રાષ્ટ્રીય શબ્દનો ‘ સાગો ’ એવો અર્થ કર્યો છે, તે પણ એકું છે. અહીંયા તેનો અર્થ ‘ સૂખો ’ અથવા ગર્વનીર થાય છે. ‘ રાષ્ટ્રીય ’ શબ્દનો અર્થ ‘ સાગો ’ તો નાટકના પાત્રોમાંજ મેટે લાગે વપરાય છે.

ઉપરના અવતરણોમાં કેટલા ગપાડા હંકયાં છે? સુવિશાખ એ કેનો સ્થળો હતો? ચંદ્રગુપ્તનો? અશોકનો? કે ઇન્ડિયામાનો? ડા. શાહ પહેલા ને બીજા કવેઠેશનમાં ચંદ્રગુપ્તનો સ્થળો જણાવે છે, ને ત્રીજા કવેઠેશનમાં અશોકનો સ્થળો જણાવે છે. અને ધર્તિહાસ ઇન્ડિયામાનો સ્થળો જણાવે છે. તો સુવિશાખ કેટલા રાજનો સ્થળો રહ્યો? તેનું આચુષ્ય કેટલું? એ કલ્પનાને તો જવા દઈએ પણ અશોકનો સ્થળો વિશાખ ડા. શાહ પ્રશસ્તિમાં જણાવે છે તે તે કયાં? પોતે પ્રશસ્તિ જોઈ નથી અને બીજા સાચા વિદ્વાનોને પ્રશસ્તિનો દમ બતાવી પાછા પાડવાની નિષ્ટુર્તતા કેટલી હુદે વધારી છે?

પણ એમ ડાક્ટર શાહ એટલું તો અનિયાચે માની ગયા છે ખરાને કે તે સમાર-કામ સુવિશાખના વખતમાં થયું હતું? જે એટલું માને તો તે સુવિશાખ કેનો સ્થળો હતો તે આપોઆપ નક્કી થઈ જશે. ખરીરીતે તે સુવિશાખ ઇન્ડિયામાનો સ્થળો હતો. અર્થાત સુદર્શન તળાવ ઇન્ડિયામાના વખતમાં તેની આજાથી સુવિશાખે તેને સમરાંયું હતું. આ લેખક પોતે પોતાનીજ જગતમાં સપડાય છે. ચંદ્રગુપ્તના વખતમાં તો સુવિશાખનો જન્મ પણ ન હતો. તેનો સ્થળો \*વૈશ્ય પુષ્યગુપ્ત હતો, અશોકનો સ્થળો યવન તુપાસદે હતો. ડા. શાહ ચંદ્રગુપ્તના સ્થળને વૈશ્યગુપ્ત કે વિષણુગુપ્ત કહે છે તે પણ અસલ્ય છે. તેઓ તેને વિષણુગુપ્ત શા માટે કહે છે તેનો આશય નીચેના ઝૂકરામાં મળી આવે છે.

“ડા. રાજેન્દ્રલાલ મિત્રના કહેવા પ્રમાણે....તેમાં ચાણુક્યને લગતી હકીકત છે, તેમાં તેનું નામ વિષણુગુપ્ત જણાયું છે....” સુદર્શન તળાવની પ્રશસ્તિ ઉપરથી પણ આ વાતને પુછ્યે મળતી હેખાય છે, એટલે કે તેનું એડં નામ વિષણુગુપ્ત ડોય તેમ લાગે છે.

પા. લા. ૨/૧૭૨.

ડા. રાજેન્દ્રલાલે તો ચાણુક્યનું નામ વિષણુગુપ્ત હોવાનું જણાયું છે. જ્યારે એ વિષણુગુપ્તની સાથે ડાક્ટર મહાશય આ પ્રશસ્તિનો સંબંધ જોડી, ‘પુષ્યગુપ્ત’ ને સ્થાને ‘વૈશ્યગુપ્ત’ શણદ કહ્યો, વૈશ્ય શણદનો ‘વિષણુ’ શણદ જનાવી ‘ગુપ્ત’ શણદને ‘વિષણુ’ શણદ સાથે જોડી દઈ વિષણુગુપ્ત શણદ ઉપજલી કાઢ્યો. અને તે વિષણુગુપ્ત ચાણુક્યનો પર્યાય વાંચી જનાવી તેમના માનેવા વિષણુગુપ્ત સ્થળને ચંદ્રગુપ્તના રાજ્યાંત્ર ચાણુક્ય મનાવવાનો ધરાડો તો નથી ને? કારણ કે પ્રશસ્તિમાં તો સ્થળાનું જ

\* પં. ૧૭-૨૦. મહાક્ષત્રપ.....પાર્થીવેન કૃત્સનાનામાનર્તસુરાષ્ટ્રાણાં પાલનાર્થચિયુક્તેન પહૂલવેન કુલૈપુત્રેણામાત્યેન સુવિશાખેન...અનુષ્ઠિતમિતિ સમગ્ર આનર્ત ને સુરાષ્ટ્રના રક્ષણ માટે નિમેલા મહાક્ષત્રપ (ઇન્ડિયામાના) પાર્થીવ પહૂલવ કુલૈપ પુત્ર સુવિશાખે બંધાયું.

\* વૈશ્ય તે વખતે સૌરાષ્ટ્રમાં રહેનારી એક જાતિ હતી.

પં. ૮. ચન્દ્રગુપ્તસ્વય રાષ્ટ્રેણ વૈશ્યેન પુષ્યગુપ્તેન।

અશોકસ્વય મૌર્યસ્વય તેન યવનરાજેન તુષાસ્ફેન।

લખાણ છે, રાજગુરુનું નથી. વળી વિષણુગુપ્ત નહીં પણ વૈશ્ય પુષ્ટયગુપ્ત છે. વળી ચંદ્રગુપ્ત અને ક્ષત્રપોના ધર્મ સંબંધી પ્રશસ્તિને પૂરવા રૂપે રજુ કરતા લખે છે કે—

ચંદ્રગુપ્ત સભ્રાટ પોતે જૈન ધર્મી હતો. તેમ તેમના રાજગુરુ-ચાણુકચળ પણ જૈન ધર્મીજ હતા. આ બાણતમાં સુદર્શન તળાવની પ્રશસ્તિ પોતેજ અખંડનીય અને અતૃપ્ત પૂરવો ગણી શકાય તેમ છે.

પ્રા. ભા. ૨/૧૮૫.

ચંદ્રણુવંશી ક્ષત્રપો જૈનધર્મ પાળતા હતા તેના એક ખીજા પૂરવામાં સુદર્શન તળાવની પ્રશસ્તિ પણ દેખી શકાશે.

પ્રા. ભા. ૩/૩૬૫.

ચંદ્રગુપ્ત કયા ધર્મનો હતો કે ચાણુકચળ કયા ધર્મના હતા તેની ચર્ચામાં હું અહીં ઉત્તરવા માગતો નથી, ક્ષત્રપોનો ધર્મ ક્યો હોયો જેઘણે તે મેં આ પુસ્તકમાં “ક્ષત્રપોનો ધર્મ” નામના પ્રકરણમાં પ્રમાણપૂર્વક ચર્ચા કરી છે, પરંતુ તે બધાનો ધર્મ શોયા હતો તે પ્રશસ્તિથી સાધીત કરવું અશક્ય છે. કેવળ મનુષ્યવધ ન કરવાની પ્રતિજ્ઞાથી અવશ્ય ધર્મિક સંસ્કાર દેખાઈ આવે છે; પરંતુ ડૉક્ટર મહાશય તેનાથી એકેનો ધર્મ સાણીત કરી શકે તેમ નથી. કારણું કે એ દેખ દૂદ્રદામા સિવાય ખીજનો કોઈનો નથી. પછી ખીજના ધર્મી તેમાંથી સિદ્ધ થઇ શકતા નથી અને દૂદ્રદામાની તો એ પ્રશસ્તિ હોવાનો ડૉક્ટર શાહ આશહીપૂર્વક ઇન્કાર કરે છે પછી દૂદ્રદામાનો ધર્મ કે ચાણન વંશના ક્ષત્રપો પ્રશસ્તિમાં કયાંથી આવ્યા? તેમના ધર્મની હકીકત તેમાં કયાંથી ઉપણ આવી, અહિસા ધર્મના પાલનના પૂરવા રૂપે એ પ્રશસ્તિ શી રીતે થઇ? વળી ક્ષત્રપોના કે દૂદ્રદામાના ધર્મ સંબંધી હકીકત માટે પ્રશસ્તિને પ્રમાણભૂત ગણવામાં આવે છે તો તેની ખીજ હકીકત સંબંધી શા માટે પ્રશસ્તિને અપ્રમાણિત માનવામાં આવે છે? દૂદ્રદામા તરફ તેમને આટકો અધો દ્રેષ્ટ કેમ છે? કે પછી જ્યાં પોતાનું ધાર્યું કરવું હોય ત્યાં દૂદ્રદામાની પ્રશસ્તિને પ્રમાણ ગણી સહારો હોવો અને પોતાના મંત્રયમાં આડુ આવતું હોય ત્યાં તેનું દ્રેષ્ટપૂર્વક અંડન કરી નાખવું.

આજ વસ્તુ નાચેના એ અવતરણમાં પણ મળી આવે છે કે જ્યાં પોતાની કદ્વયનાને અનુકૂળ નથી આવતું ત્યાં દૂદ્રદામાને ઝૂર, ધાતકી, અનાર્ય કહીને વખોડી કાલ્યો છે અને કદ્વયનાને અનુકૂળ કરવા માટે એજ દૂદ્રદામાને અહિસાધર્મના પાલનમાં આહર્ય-રૂપ માન્યો છે.

“ રણ સંથામ સિવાય પ્રાણુન્ટે પણ મતુષ્યવધ ન કરવો તેવી પ્રતિજ્ઞા તેણે લીધી હતી ” આ વાક્યજ દૃદ્રદામા ક્ષત્રપ કરતાં સામાટ સંપ્રતિને વધારે બંધણેસતું થઈ પડે છે કે પ્રણમાંથી તે ઉત્તરી આવ્યો હતો. તેવી કૂર અને ધાતકી સ્વલ્લાવવાળી અનાર્થ જાતિની કોઈ વ્યક્તિનું હૃદય હિંદમાં થોડા વર્ષના વસવાઠથી આવી અનુકંપા ધરાવતું થઈ જય એમ જનવા ચોગ્ય છે ખરું ?

પ્રા. ભા. ૨/૩૬૫

અહિસા ધર્મ પાલન કરનાર પણ ક્ષત્રિયવટને ભૂલાવી હે તેવાં તેમજ આશ્ર્યમાં ગરકાવ કરે તેવાં કાર્યો કરીને, રાજપાટ પણ શોલાવી શકે છે તેનાં દ્યાંતરૂપ આ ચષણુનો આઓ ક્ષત્રપવંશ કહી શકાશે.

પ્રા. ભા. ૩/૩૬૪.

આવી રીતે પોતાને ઈષ લાગે તેમ ધતિહાસને વાળવામાં ધતિહાસનું રક્ષણ કરે છે કે ધતિહાસનો દ્રોહ કરે છે તે સુસજન સ્વયં સમજી શકે તેમ છે. પોતાની કલ્પનાને અનુકૂળ થાય માટે કોઈને વખાણી મૂકવો કે લાંડવા માંડવું એથી ધતિહાસમાં કેટલી વિકૃતિ પેદા થાય છે ? જે કે તેથી ધતિહાસમાં તો કશુ સુધરતું બગડતું નથી પણ લોકોને ભ્રાંતિમાં નાખવાનો આ અતિનિંદ્ય પ્રયાસ છે.

તેમના સિવાય બીજા ઐતિહાસિક પુરુષોએ એ પ્રશસ્તિને વાંચવામાં ને અર્થ કરવામાં ઘણી ગેરસમજૂતી કરી છે ને ઘણું અર્થને મારી નાખ્યો છે એમ લખવાનું સાહસ કરતાં જણ્ણાવે છે કે—

આ સુદર્શન તળાવની પ્રશસ્તિના ઉકેલમાં અને અર્થ કરવામાં જે ગેરસમજૂતિએ થવા પામી છે.....

પ્રા. ભા. ૩/૨૮૬.

તે પ્રશસ્તિના વાચન-ઉકેલનો જે ગેરસમજૂતિ કરેલો અર્થ કરવામાં આવ્યો છે તેથી કેટલોક ધતિહાસ માર્યો ગયો છે;

પ્રા. ભા. ૩/૩૬૫

પ્રશસ્તિનો અનર્થ જેટલો ‘પ્રાચીન ભારતવર્ષ’ પુસ્તકના લેખકે કર્યો છે તેનો થોડા અંશે પણ કોઈ ધતિહાસકારે ધરાદાપૂર્વક કર્યો નથી. ‘ચોર કોટવાલને દ’ડે ’ ની નીતિ અખત્યાર કરી લેખક કેને કેને લાંડવા નિકળ્યા છે ? પોતાને અનર્થી કરવા છે અને બીજાને લાંડવા નિકળવું છે. પ્રશસ્તિનો અર્થ કે કાંઈ કરવામાં આવ્યો છે તેથી કશો ધતિહાસ માર્યો ગયો નથી. પણ પોતાની કલ્પના પ્રમાણે પ્રશસ્તિ બોલતી નથી એથી પ્રશસ્તિ કે ધતિહાસકારોને દોષિત ગણું કરતાં પોતાની કલ્પનાને ઝૂષિત ગણું વાજણી છે, ને તેમાંજ પ્રામાણિકતા છે.

ખરી રીતે એ પ્રશસ્તિ ડૃદ્રદામાના સૂણા સુવિશાળે કોતરાવી છે, તે શક સં. ૭૨ ની છે. તેના બે કે ગ્રણ વિલાગ નથી પણ એક અને અખંડ પ્રશસ્તિ છે ( અલખત તેનો વચ્ચેલો ઘણો ભાગ ચાલ્યો ગયેલો છે. ) તેની શરૂઆતમાં-ત્રીજી ચોથી પંક્તિમાંજ મહાક્ષત્રપ ચાલુન અને ડૃદ્રદામાના નામો છે. તેની વચ્ચેલી પંક્તિઓમાં તેના શુણ્ણાતું વર્ણન કરાયું છે. પંદરમી સતરમી વિગેરે પંક્તિઓમાં ડૃદ્રદામાનું નામ અને 'મહાક્ષત્રપ' શણ્ણો કોતરાયલી છે. તે એક અવિલક્ષ્ણ ને એકજ સમયે છટાળજ ભાષામાં લણાયલી-કોતરાયલી પ્રશસ્તિ છે.

તેમાં ચંદ્રગુમ ને અશોકના નામો તો એટલા માટે આવે છે કે તે પ્રશસ્તિ સુદર્શન તળાવને અંગે કોતરાયલી હોઢિને સુદર્શન તળાવના બંધાવનારાના નામ તેમાં લંઘાં છે, તે તેની ઉદારવૃત્તિનો પરિચય આપે છે.

પરંતુ માનોકે તે નામો આ પ્રશસ્તિમાં ન આપ્યાં હોત તો?—તે નામો આપીને તો તેણે ધતિહાસની રક્ષા કરી છે, તેણે ધાર્યું હોત તો તે તળાવનો બધોજ યશ પોતે લઈ શકત. અને આપણુંને ખણર પણ ન પડત કે ચંદ્રગુમ કે અશોકનો તળાવ સાથે શો સંબંધ હતો. પરંતુ એક ભાણુસ મહેમાનને પોતાનો ઓરડો રહેવા માટે આપે તો તેથી શું આપું મકાન મહેમાનનું થઈ જય કે? ધતિહાસમાં પણ આવી કૂઠ ચલાવવાની વૃત્તિ લેખકને સ્ફૂર્ત આવી.

વળી ડૉ. શાહ નીચે પ્રમાણે વખે છે:

“ વિશેષમાં, સભ્રાટ સંપ્રતિ સંબંધમાં આપણે જોઈ ગયા છીએ, કે તે શ્રી સંબંધ સાથે પ્રતિવર્ષી શ્રી ગિરનારણની યાત્રાએ જતો હતો. આ સુદર્શન તળાવ પણ તે ગિરિજાની તળેટીમાંજ આવેલું છે. એટલે જે તેને કાંઈ સમરાવવા જેવું હોય તો તેની નિગાહ ઉપર પ્રભાજને તે મૂક્યું પણ હોય અને દોાં કલ્યાણ તથા પ્રભાહીતનાં કાર્યો કરવામાં જે ચીવટ અને ઉત્સાહ તે ધરાવતો હતો તે જોતાં, તે તેણે હુરસ્ત કરાવી આપ્યું હોય તો તેમાં કાંઈ આશ્ર્ય પામવા જેવું પણ નથી.” પ્રાચીન ભા. ૨/૩૬૬.

ડૉ. મહાશયના જણાવવા મૂજાણ ણડક લેખ નં. ૮ વાંચતા કોઈપણ જગ્યાએ ગિરનારણનું નામ વાંચવામાં કે જોવામાં આવતું નથી. પણ તે ( અશોક-સંપ્રતિ નહીં ) રાજ્યાલિપેકના દશમે વર્ષે ગયા ( જ્યાં બુઝને જ્ઞાન પ્રાસ થયું હતું ) યાત્રાને માટે ગયા હતા, પણ તેમના લખવા મૂજાણ પ્રતિવર્ષ ગિરનારણની યાત્રાએ જતા હતા તે તદ્દન હણ્ડક છે. ડૉ. શાહ પોતેજ જૈતના રૈખ્ય મહેતસવ અંકના પૃ. ૭૭ માં સંબોધિનો અર્થ સમ્યક્રત કરે છે જ્યારે પોતાના ઉપર્યુક્ત લણાણુમાં યાત્રા અર્થ કરે છે. આમ પરસ્પર વિરોધ લરેલા તેમના કથનથી સ્વયં સમજી શકાય તેમ છે કે તેમનું ચિત્ત કરે વખતે કયાં બ્રમજુ કરતું હશે.

વળી ડૉ. શાહ પોતાના કથનની પુષ્ટિના પ્રમાણ માટે જૈન ધર્મ પ્રસારક સભાથી પ્રકાશિત થયેલા “ શ્રી પરિશિષ્ટ પર્વ ભાષાન્તર ” ના પૃ. ૨૧૦ થી ૨૧૮ નો હવાલો આપતાં

નોટમાં જણાવ્યું છે કે — તેણે ફૂવા, તળાવ, વાવ અંધાવ્યા હતા, પરંતુ પરિશિષ્ટ પર્વ વાંચતા તેમાંથી ન તો ફૂવા, ન તો તળાવ, કે ન તો વાવ અંધાવ્યાનો ઉલ્લેખ મળે છે. ન જણે ડા. શાહે કયું ફૂરણીન કગાવીને વાંચ્યું હશે તે તેમોજ જણે.

પ્રસ્તુત પુસ્તકના લેખક વિક્રતસમાજમાં અણુમાનીતા થઈ પડ્યા હોય અને તેથી ઉકળી જઈ વિક્રાનો ઉપર આશ્રેપ મૂકતાં પોતે ત્રીજા લાગમાં એક સ્થળે લખે છે કે—

“....પણ જણાવવાનું કે નામાંકિત વિક્રાનો જે કાઈ તર્ક, વિતર્ક કે કલ્પના કરે, પછી ભલે તે બાહુજ વિચિત્ર હોય છતાં તેને વિદ્યાના એક અંશ તરીકેજ સર્વે વધાવી દેયે છે, જ્યારે કોઈ સામાન્ય ભાણુસ લદે સત્યપૂર્ણ અને પ્રમાણિક આધાર સાથેની વાત રણ્ણ કરે, તોપણ જો તે રણ્ણઆત પૂર્વણદ્ધ મંતવ્યથી લિન્ન પડતી હોય, તો તે સૂચનને આદર મળવો તો એક બાળુ રહ્યો, પણ ઉલ્લદું તેને તોડી પાડવાનો પ્રયત્ન કરાય છે અને હાસ્યપાત્ર બનાવાય છે. આ અંથના લેખક તરફ વિક્રાનોનો આવો વર્તીવ તો સામાન્ય થઈ પડ્યાનું માલૂમ પડ્યું છે.

પ્રા. ભા. ૩/૩૫૮

સત્યપૂર્ણ ને પ્રામાણિક આધારવાળી વસ્તુ ગમે તે રણ્ણ કરે તેને આદર ને સન્માન મળે છે. પૂર્વણદ્ધ મંતવ્યથી લિન્ન પડે તોપણ શું થયું ? જે વાસ્તવિક હકીકત છે તેને સહુ કોઈ સ્વીકારે છેજ. પરંતુ તેની પાછળ ઘટના અને પ્રમાણેનો આધાર હોવો જોઈએ. જ્યાસ્તવાલ આહિ ભારતીય વિક્રાનોએ આજે અપૂર્વ માન મેળવ્યું છે. પ્રમાણિક આધારો આપી ભલભલા યૂરોપીન ઈતિહાસવેત્તાઓને આશ્વર્યમાં નાખ્યા છે. પરંતુ તેમના વિચારો અને વસ્તુઓએ પાછળ ગૂઢ અન્વેષણ અને સચોટ હકીકતોનું બળ હતું. કેવળ કલ્પનાઓ કે વિતર્ક, કુતર્કો ન હતા.

ઇતિહાસમાં સામાન્યજ વિશેષજનો લેદ નથી, નાના કે મોટાનો પદ્ધતાપાત નથી. ઇતિહાસની કોઈપણ સત્ય હકીકત કોઈથી તોડી શકાતી નથી, જે બણ્યું છે તે ‘ન બણ્યું’ થતું નથી-થઈ શકતું નથી. પરંતુ આભાસને ઇતિહાસ તરીકે રણ્ણ કરવામાં આવે કે મનઘડંત કલ્પનાના દોડા કુદાવવામાં આવે તો તેને આદર ન મળો અને હાસ્યપાત્ર પણ લેખાય તે સ્વાભાવિક છે. ઇતિહાસના પુસ્તકો ધણ્યાં લખાયાં, ઇતિહાસના વિક્રાનો પણ ધણ્યા છે છતાં તેમની તરફ નહીં અને પ્રસ્તુત અંથના લેખક તરફજ વિક્રાનોને ટીકા કરવાનો અવસર શામાએ ? તેમનીજ તરફ વિક્રાનોનો અણુગમો શામાએ થાય ? અને થાય તો તેમાં વિક્રાનોને દોષ કાઢવો કે તેમના તરફ ટીકા કરવી જરૂરી નથી-વ્યાજળી નથી. ઇતિહાસ કોઈને તોડી પાડવાની કોશીશ કરતો નથી અને ગમે તેવો માનધાતા પણ ઔતિહાસિક હકીકતો ઉપર વિતર્ક કે કુતર્ક કરવા જાય યા કલ્પના દોડાવવા જાય તો તેને પણ ઇતિહાસ સાંખી શકતો નથી. તે તો કોઈપણ જાતની લેળસેળ વગરની હકીકતોજ માળે છે અને એવી હકીકતો જે રણ્ણ કરે-પછી તે સામાન્ય હોય કે વિશેષજ હોય-તેને આદર ને સન્માનજ મળે છે.